

ਪੁਸ਼ਟ ਕ ਸ੍ਰ ਮੀ ਕਾ ਨੁ

ਤੈ ਮਾ ਸਿ ਕ

# ਪ੍ਰਬੰਧ

ਆਂਕਟੋਬਰ-ਡਿਸੇਮਬਰ ੧੯੯੪ • ਵਰ਷ ੩ ਅੰਕ ੪

ਚੰਦ੍ਰਕਾਨਤ ਟੋਪੀਵਾਣਾ  
ਸਾਂਤਿਲਾਲ ਮੇਰਾਈ  
ਜਗਦਾਸ਼ ਗੁਜਰ  
ਸਿਲਾਸ ਪਟੇਲਿਆ  
ਮਨੌਜ ਓਯਾ  
ਰਮਣ ਸੋਨੀ  
ਵਿਜ੍ਯ ਸ਼ਾਸਤ੍ਰੀ  
ਪ੍ਰਮਾਦਕੁਮਾਰ ਪਟੇਲ  
ਅਭਿ ਰਾਵਲ  
ਸਹੀਫਾ ਵੀਜਣੀਵਾਣਾ

ਸੰਪਾਦਕ

ਰਮਣ ਸੋਨੀ

# ਪ੍ਰਬੰਧ

## ગુજરાતી

### પ્રત્યક્ષીય III સંપાદક

#### સમીક્ષા

- ૧ ક્રીસમાં (કવિતા : પ્રબોધ પરીજ) ૫ ચંદકાન્ત ટેપીવાળા  
શતવાસો (વાર્તા : મણિલાલ ડ. પટેલ) ૭ શાંતિલાલ મેરાઈ  
સંબંધ વિનાના રેતુ (નિબંધ : યુસેફ મેંકવાન) ૮ જગદીશ ગુજરાત  
એલવેસ્ટેશન (નિબંધ : હર્ષદ કાપડિયા) ૧૧ સિલાસ પટેલિયા  
ઈચરઅક્ષા તરે નામ (નિબંધ : ગુજરાતં શાહ) ૧૪ મનોજ ઓઝ  
‘સત્તિષિ’ આદિ... (વિવેચન : કૃષ્ણાવીર દીક્ષિત) ૧૭ રમશ સોની  
ગુજરાતી સાહિત્યવિવેચન (વિવેચન : જયંત કોઠરી) ૧૯ વિજય શાસ્ત્રી  
સિતાવિશ્વારસંપાદક (સંશોધન-સંપાદન : ડીર્તિધા જોશી) ૨૧ પ્રમોદકુમાર પટેલ

#### ટૂંકાં અવલોકનો

- બદ્ધાઈ ઉમરલાડિયા સમગ્ર સાહિત્ય (સંપાદન : જશવંત શેખડીવાળા, રવીન્ડ ઠકોર) ૨૪ રમશ સોની.  
ગુજરાતી મહાનિબંધ સૂચિ (સંપાદન : પ્રકાશ વેગડ) ૨૫ રમશ સોની  
ગાંધીના કન્ન-જ (સંપાદન : મહેન્દ મેધાશી) ૨૬ રમશ સોની  
હીરક કેસુડાં (સંપાદન : રમશીક મેધાશી વગેરે) ૨૭ અનુભૂતિ

#### વાચનવિશેષ

- ૧ દુ સર વીથ લર્ડ (બ્રેથવેઈટ) ૨૯ શરીકા વીજળીલાલા

#### પુસ્તકસીકાર ભિતાલારી ૩૩

- આ અંકના લેખકો ૩૫

#### ચર્ચા

- ભાનુપ્રસાદ ત્રિવેદી ૩૭

#### વાર્ષિક સૂચિ ૩૮

# પ્રભ્યાન

જાન્યુઆરી-માર્ચ, ૧૯૮૫નો અંક 'સંપાદન વિશેખાંક' તરીકે પ્રગટ થશે.

વર્ષ અંક ૪ એપ્રેલોબર-ડિસેમ્બર ૧૯૮૪ : સંખ્યા અંક : ૧૨

૧૯૮૫

રમણ સોની

પચાશાંકો	શિરીષ પંચાલ પ્રમોદકુમાર પટેલ
શારદા	શારદા સોની ઈ-૨ તારાબાગ કવાર્ટ્સ પોલિટેકનિક વડોદરા ૩૮૦ ૦૦૨
અમૃતા-કાંપોંગ	શારદા મુદ્દાલાય જુમા મસ્જિદ સામે આંધી માર્ગ અમદાવાદ ૩૮૦ ૦૦૧ (કોડ ૩૮૮૮૫૬)
સુરતસાન	સરસાની ઓફિસેટ ૧૫/૩૩ બસીધર એસેટ બાસોલાયા અમદાવાદ ૩૮૦ ૦૦૧
મુશ્કેલી	અંકન ગ્રાફિક્સ ૫૧ કોમર્સ હાઉસ ધીકાંદી રોડ અમદાવાદ ૩૮૦ ૦૦૧
પાઠ્યાંકારાંકન	જીયદેવ શુક્ર

વાર્ષિક રૂ. ૫૦ દિવારિક રૂ. ૧૦૦ પંચવારિક રૂ. ૨૫૦

આંગન સભ્યપદ રૂ. ૫૦૦ શુલેશુક સભ્યપદ રૂ. ૧૦૦૦

અંકની છૂટકનકબ રૂ. ૨૦

લવાજમ મનીએપ્ટર કે ડ્રાઇવિંગ પોકલવા વિનાતી ચેકથી પોર્ટલનારે બેંક-કમિશનની રૂમ  
ઉમેરવી ચેક/ડ્રાઇવ શારદા સોની - પ્રકાશક : પ્રત્યક્ષાંચા નામે લખાયો

લવાજમ પોકલવાનાં સરનામાં

નીરિન મહેતા	૪૦૧/બી શિલ્પા ટેરેસ (ન્યૂ) શિશ્યોલી રોડ બોર્ડરલી (પટિયામ) મુંબઈ ૪૦૦ ૦૧૨
જીયદેવ શુક્ર	જીયદેવનગર જીન પાછળા સાવલી ઉદ્યો ૭૭૦ (જી. વડોદરા)
ગેરિલ ઓફિસી	'બ્લક' ૨૪ નેમિનાથનગર સુ. મ. માર્ગ આંબાલારી અમદાવાદ ૩૮૦ ૦૧૫
શારદા સોની	ઈ-૨ તારાબાગ કવાર્ટ્સ પોલિટેકનિક વડોદરા ૩૮૦ ૦૦૨

સંપાદકીય - પત્રવ્યવહાર

રમણ સોની ઈ-૨ તારાબાગ કવાર્ટ્સ પોલિટેકનિક વડોદરા ૩૮૦ ૦૦૨

આ અંકની પ્રકાશનતારીખ : ૧૫.૧૨.૧૯૮૪

મોકલવા આકર્ષનારું એક પરિબળ હોઈ શકે. એથી, એમ વિચાર આવે કે વધુ સર્વ-ગ્રાહિતાથી ને વધુ સક્ષમ રીતે આ, વાર્ષિક સમીક્ષાનું કામ પરિષદ કેમ ન કરે? પરંતુ, સમીક્ષાપ્રવૃત્તિ તો દૂર રહી, વાર્ષિક ગ્રંથસૂચિ કરાવવાની આપણી અપેક્ષા પજા પરિષદ પારોથી સંતોષાર્થી નથી. દર બે વર્ષે જ્ઞાનસત્રમાં અપાતં પારિતોષિકો માટે, નિષ્ઠાપિકોને મોકલવા પરિષદ જે યાદી તૈયાર કરે છે એ પજા ઘણીવાર અધૂરી હોય છે – ઓછા સાહિત્ય-મૂલ્યવાળાં ને અભ્યપરિચિત પ્રકાશકો-લેખકોનાં જ નહીં, મહાત્માનાં ને જાહીતાં પ્રકાશનો પજા એ યાદીમાંથી ક્યારેક છટકી ગયેલાં હોય છે. એના પરથી એક તક એ પજા થઈ શકે કે પરિષદને ય પૂરતા પ્રમાણમાં પુસ્તકો મળતાં નથી. પરંતુ, વધુ સાચી હકીકત તો એ લાગે છે કે અહીં પુસ્તકપ્રાપ્તિ કરતાં ચોકસાઈભરી વ્યવસ્થાનો પ્રશ્ન વધુ મોટો છે.

બીજું, આ વાર્ષિક સમીક્ષાની પ્રવૃત્તિ એક સમીક્ષક-સંપાદકને બદલે બેચાર વધુ અભ્યાસીઓની ટીમથી થાય તો એનું પરિષામ, સમીક્ષાની ગુણવત્તાની દૃષ્ટિએ વધુ સારું આવી શકે. એકલા મધુસૂદન પારેખ પર જ બધાં પુસ્તકોની ને બધાં જ સાહિત્યસ્વરૂપો પરનાં પુસ્તકોની સમીક્ષાનો બોજ આવી પડે એથી તેઓ (કે કોઈપજા એક અભ્યાસી) પૂરતી અને બધાં સ્વરૂપોના ગ્રંથો વિશે એકસરખી ક્ષમતાથી કામ ન કરી શકે એ સ્વાભાવિક છે. એક મુખ્ય સંપાદક હોય ને બીજા તે-તે સાહિત્યસ્વરૂપના વિવેચનની વિશેષ જાણકારી ને અધિકાર ધરાવતા સહાયક સંપાદક હોય તો પરિષામ વિશેષ ઘોટક બની શકે.

વળીવળીને મૂળ વાત તો, સર્વ પુસ્તકોની પ્રાપ્તિ આગળ જ આવવાની. કેમકે એના વિના, બીજું તત્ત્વ ભલે ગમે તેટલું કાર્યક્ષમ હશે તો પજા પરિષામ ધૂધળું આવવાનું અને અધૂરી વિગતો ને નિરીક્ષણો સમય જતો જાય એમ વધુ નહવાનાં – ગેરમાર્ગ દોરવાનાં.

એટલે વિચારણીય બલકે ચિંતાજનક પ્રશ્ન તો એ છે કે બધાં જ પ્રકાશકો એમનાં બધાં જ પ્રકાશનો સામયિકોને, સંસ્થાઓને કેમ મોકલતા નથી? વિવેચનમાં – સમીક્ષામાં એમને શ્રદ્ધા નથી રહી? સમીક્ષા-અવલોકનથી એમનાં પુસ્તકોનો પ્રસાર-પ્રચાર નહીં વધે એવું એમને લાગે છે? કે પછી એમની પોતાની વ્યવસ્થાજ્ઞાણ (નેટવર્ક) જ એટલી અપ્તમનિભર છે કે જેથી સમીક્ષા આદિથી થતા ગુણવત્તાપરક (કોર્પોરેટિવ) પ્રસારની એમને કશી ગરજ જ નથી? પ્રકાશકોની દિશાએથી વિચારતાં એક દલીલ એ પજા સામે આવી શકે કે હવે પુસ્તકોનું નિર્માણ ખૂબ મોંઘું થયું છે ને એટલે પુસ્તકો દેચવાને બદલે આમ વહેંચવા વિશે એ ઉદ્ઘસીનતા કે અનિયાધ ધરાવતા હોય તો એ સ્વાભાવિક નથી? જો કે ખરીદી કે વેચાણને પ્રેરવા માટે થોડીક વહેંચણી (સૅંપ્રલ ગીફ્ટ) કરવાની થાય એ પજા વ્યવસાયની જ એક આવશ્યકતા નથી? બીજી વેચાણવસ્તુ (કોર્મોરિટી)ની જેમ પુસ્તકને પજા એ લાગુ ન પડે? આમાં મતલેહો હોઈ શકે પજા મૂળ વાત તો એટલી જ કે પ્રકાશકોમાં સાહિત્ય કે સાહિત્યની પ્રવૃત્તિ માટે કેટલાં આદર-પ્રેમ બચ્યાં છે.

વસ્તુલક્ષી રીતે વિચારતાં, ખરેખર તો એક એવું કેન્દ્રીય ગ્રંથાલય હોય જ્યાં પ્રકાશિત થતું એકેએક પુસ્તક પહોંચતું હોય. આપણા સૌનો આ જૂનો અભિલાષ છે જે સંતોષાયો નથી. કાયદાની રીતે, અનિવાર્યપણે પ્રકાશનની નકલ મોકલવાની થતી હોય એ કોપીરાઇટિંગનો નિયમ પજા પળાતો હોય એવું ખાસ જ્ઞાપાતું નથી. એ દિશામાં ફરી જાગૃતિ લાવવાની ને વ્યાપક ઊંખપોહ કરવાની જરૂર છે. પ્રકાશકો માટે પજા આવી કેન્દ્રીય વ્યવસ્થા પ્રચારથ્યે પજા વધુ અનુકૂળ થઈ શકે.

એટલે, સામગ્રી અને એના પર કામ કરનાર – એ બંને પજો આવી સમસ્યાઓ છે. ને એ કંઈ ન જ ઉકેલી શકાય એવી તો નથી. માત્ર એ માટેની સમજ ને એ માટેનો નિષ્ઠાપૂર્વકનો તત્ત્વ જોઈએ. પજા આ જે ‘જોઈએ’ તે ‘છે’ આપણામાં?

ક્રોંસમાં

પ્રબોધ પરીખ

આર. આર. શેડ, મુનિષિન્યાન્ડ અમદાવાદ, ૧૯૭૪  
પૃ. ૧૩૬, રૂ. ૭૦

ચન્દ્રકાળા ટોપીવાળા

## કાળા લોખંડી ધુમ્મસ

આજે જ્યારે બારીઓ ખૂલ્લી રહી છે, બારણાં ખૂલ્લુંખૂલું થઈ રહ્યાં છે ત્યારે 'કાલે એકાદ બારી ખૂલ્લો'ની શ્રદ્ધા લઈને પ્રબોધ પરીખ બંધ કે બંધિયાર રચનાઓના સંગ્રહ 'ક્રોંસમાં' (૧૯૭૪) સાથે બહુ મોદેથી પ્રવેશ કરી રહ્યા છે. એમનો સંગ્રહ એક રીતે જોઈએ તો કાલબાધી છે.

આધુનિકતાનું લગભગ આથમણું છે. એક જમાનો હતો જ્યારે લાગણીના ફુવારાથી વિચારના ફુવારા પર અને આધુનિકતા-કાળમાં શબ્દના ફુવારા પર ગુજરાતી કવિતા આવી ઉભેલી, ત્યારે ભાષાની આત્યંતિક તોડકોડ કરનારા કવિઓમાં મનહર મોદી પછી પ્રબોધ પરીખ બીજે કરે હતા. સર્જકતાના ઉભરાઈ જવાના ઘ્યાલથી એ વખતે જે શબ્દસોમ છલક્યો, તાવના નશામાં જે લવરી ફૂરી કે ભકીમાંથી કાચા શોકાઈને જે શબ્દના તડતડવા ફૂટ્યા, એનો એક યુગસંદર્ભ હતો.

આ સંગ્રહમાં એ યુગસંદર્ભ છે. અમેરિકન પેઈન્ટર જેક્સન પોલોક જેમ રંગોને રેડીને શરીરની યદ્રદ્ધા ગતિએ અંકશન પેઈન્ટિંગ કરતો, એવું કંઈક અહીં શબ્દોની સાથે થયું છે. આ રચનાઓ અંકશન પોએટ્રી છે, જેને કારણે કવિને ઉરેઉરે વહેમ છે કે મારી કવિતાઓ work in progressના improvisations છે. ક્યારેક કવિ શબ્દના વેષ પહેરી મનની ગતિ જીવલવા મથે છે :

અહીં બરફ પર ફૂલ છે મારા શોકના  
પડછાયાઓનું  
કાંઠાવિહોણ દોડ્યે જતા સમુદ્રો  
લિપિ વિનાના  
ગંભીરી

આ વરસોના જંગલમાં

અજાણ્યા આકાશખંડોનાં ફળો

અહીં ધોઘચા અવાજમાં નશ પામ્યાં છે તે

અશક્ય ભૂગોળોની નસોમાં ગતિ

લોહીમાં ગુફાઓના સ્મરણનો ભય

દરેક ચાસોમાં ચરણું હોય મૃત્યુ

હવે અહીં આ હું કંઈ તરફ કરી રહ્યો છું (પૃ. ૨૨)

ક્યારેક મગજના બંડકિયાની સીડી ઉત્તરે છે ખરો, પણ મગજની સમજથી પણ દૂર એવા કશાકને કર્યા શબ્દોમાં જીવલવા પલ કરે છે :

એક એવી સાંજ.

ચૂપકીદીમાં જેમાં આત્માની છુકછુક ગાડીના  
લેન્ડસ્કેપો સંભળાય

બારી બહાર ઊડી જતાં પંખીઓ

વિમાન થઈ આંગળી પર બાંધી જાય

શહેરોની હારમાળા (પૃ. ૭૧)

ક્યારેક કવિ શીખેલી કષ્ણોના દેરાવમાંથી છટકવાનો  
પ્રયત્ન કરી શબ્દોનું સ્મૃતિનું ગતિનું ગંડપણ ઉલેચે  
છે :

કહીશ

કે અજાણી મોટરોમાં તારા ચાસમાંથી જોણ ફૂટે છે  
કે શબ્દો ફટક દઈ પંખી થઈ જાય છે

ને હવામાં તારી આવ-જાવ કરે છે.

એક પછી એક સીડીમાં વિહૃગનસ્તાઈન અને  
આમતેમ પૃથ્વી પર રખડતા વિહૃષકોને

ને એ બધાને ઉડાવતો જરૂર છું

ને સ્મરણના આ ફરી વળતા

અનિઓપ્યાં

તારા દેહના પર્વતો પી જવા અગસ્ત્ય થયો છું

(પૃ. ૮૮)

મોટે ભાગે આ રચનાઓમાં સમય સાથેનો અને  
વિષાદના અવકાશો સાથેનો સંઘર્ષ મોજૂદ છે. અને  
એમાં જ્ઞાન અને હયાતીનું દોરડાયુદ્ધ ઉમેરાયું છે. આ  
હયાતી કવિને માટે એક તદ્દન ગુંચાયેલી જાળ છે.  
આથી જ કવિ તર્કની સીમાઓ ઓળંગી કશુંક  
ઉકેલવામાં ઉદ્ઘક્ત રહે છે, અને ઉપનિષદ જેવી ક્ષણને  
પકડવા તલખે છે :

જે પણે છે તે પમાતું નથી, જે દૂર છે તેનો બમ દાંત  
તોડી નાખે છે ને વળ ઉત્તરી હે છે, જે અંદર

આવીને વસવા જાય છે તે અથડાઈને ફૂટી જાય  
છે, જેને જાકારો આપવાનો છે તે હાઉકાંઓમાં  
એની પાંખો ફક્કાત્વા કરે છે. જે પાસે છે તેની  
નિકટતા બાંધી લે છે ને જોડી નાખે છે આંખો, જે  
દૂર છે તેનો અવાજ ચુપચાયા કરે છે કશું આવ્યા  
વિના. (પૃ. ૧૧૨)

એમાંથી જ કદમ્બ આ સંગહનું ઉત્તમ કહી શકાય એવું  
'જાગરણસ્તોત્ર' રચાયું છે :

... પણ ખૂલ્ખામાં ફક્કાતી શાંતિ  
ચાલો સારું થયું  
પાછું આવ્યાની ગુહશાંતિ !  
પણ એટલું ધ્યાનમાં રાખજો

જે  
જાગીને આવ્યો છે

જુલીને ઝૂલ્યો છે  
ફૂદીને ફૂલ્યો છે  
મૂઠીને મૂઢ્યો છે  
ભીજીને ભીજ્યો છે

એના જાગરણનું શું ?

આ જાગરણ સ્તોત્રનો, કવિએ, પુરાણકથાનો ઢળ  
કહ્યો છે પણ ખરેખર તો એમાં પુરોહિતના કંઠે  
ઉત્તરતી ગુજરાતી સત્યનારાયણની કથાનો ઢળ ખપે  
લેવાયો છે. પણ ખૂલ્ખામાં ફક્કાતી શાંતિની  
અભિવ્યક્તિ દ્વારા કવિએ સમસ્ત માનવજીતની  
પુનરાવૃત્ત કરુણતાને સઘન રીતે ધ્વનિત કરી છે.

ક્યારેક કવિએ ઉપમા અલંકારનો તદ્વન નવો  
અવતાર કર્યો છે :

અવાજ થયા વિના તારાં સ્તાનો જોડી ગયાં છે  
પર્વતોની અનંત શક્યતામાં . (પૃ. ૮૫)

'ઉમાશંકર જોશી' કાવ્યનું આ સંગહમાં હોવું એક  
ચમત્કાર છે. અર્થની વાંકીચૂકી અભિવ્યક્તિઓમાં  
અટવાતી કવિની ઉત્પાદકતાએ અહીં સરલને જે  
સંનિષ્ઠતાથી હંસલ કર્યું છે, તે દાદ માળી લે તેવું છે.  
આજેઓખાં કાવ્ય ઉત્પાદ્ય વિના રહી શકાય તેમ નથી :

તમે અમને બબને આંખો આપી  
અને એ ભીની પણ કરી  
તમે બત્રે ખાથોથી પુઢી છલકાવી દીધી  
તમે શીખબ્યું અમને ચાલતાં જંગલમાં  
જંગલની પાર  
તમે કર્યા અમારા કાનોમાં મંત્રોચ્ચાર

અંતરના અજવાણાને ટકોરતા

તમે રચ્યો પુલ અહીંથી ત્યાં સુધીનો  
તમે અમને બબને આંખો આપી  
અને

એ ભીની પણ કરી - (પૃ. ૧૨૬).

'આબુમાં બે કવિતા'માંથી પહેલી 'ગૌમુખમાંમાં પણ  
વિષાદ સુરેખ રીતે ઉત્ત્યો છે :

ક્યાં છે તારો મીણિયો લાથ ?  
હવે મારા દેહ સાથે ચાલે છે તુ.  
પગથિયાંઓનો અંત નથી  
અને જંગલમાં હવા વિના કશું વાત કરતું નથી.  
દૂર દૂર  
નીચે ઉત્તરાતું હશે નરકમાં ?  
ધુમમસના પરદા તોડી ચાલું છું જંગલમાં (પૃ. ૪૮)

પરંતુ આવું બધું પ્રમાણમાં બધું અલ્ય છે. આ  
સંગહનું કોઈપણ પૃષ્ઠ ઉઘાડો, કોઈ પણ રચના વાંચો,  
કોઈપણ પંક્તિ વાંચો, ગમે ત્યાંથી વાંચવાની  
શરૂઆત કરો, તમે એક જ પ્રકારની એકત્રિધત્તમાં  
પ્રવેશો છો. જુદીજુદી દિશામાં જતાં એક જ સરખાં  
વાક્યોની ફેંકાફેંકમાંથી રચનાઓનું ભાગ્યે જ કોઈ  
કલેવર બંધાય છે. મુખ્યાર્થનો બાધ કરતી પંક્તિઓ  
પર પંક્તિઓ આવ્યે જાય છે પણ એ કવિની શૈલી-  
રૂઢિનો જેટલો પરિચય આપે છે એટલો એના  
પ્રયોજનનો પરિચય આપતી નથી. આહુલાદને બદલે  
અકળામણ આપતાં સંહિતાતા, વિસંગત સાહચયો,  
અથ્યોની અનિશ્ચિતતા એક 'કાળાં લોંડી ધુમમસ'  
દ્વારા રચનાઓને અપારદશક કરે છે; પણ રહસ્યપૂર્ણ  
કરતી નથી : ઉદાહરણ રૂપે -

એ લાથ બાંધી સમુદ્રમાં શાક માછલીઓ તરે છે.  
આ આચાસનની રીતે સજજાનોએ શાલ ઓણી છે  
ને ઠંડી તો છે નહીં

ફરીથી

એના એ અવાજોનું ગોળ ગોળ આકાશ  
શાલ બની તરતા પાંખાળાં માણસો  
નાદી પાસે વસતાં ગામ, ખલે માંસ જિંચકી  
ચાલતાં વાહનો

(પૃ. ૧૩)

વધણ, મેદાનો, રણ, રેત, ગુજા અરીસા વગેરે વગેરે  
છૂટેક ચબરાડિયા પંક્તિઓનો ભોગ બન્યાં છે. દ્રેનની  
કે આકાશમાં ઓગળી જવાની વારંવારતાએ એની

ધાર ગુમાવી છે. વળી બહુ ઓછાં કાલ્યોમાં અછાંદસના લયને ખપમાં લેવાયો છે. મોટે ભાગે વિચિકિત વાક્યોનો ડેરેને શંભુમેળો એકઠો થયો છે.

કેટલીક પ્રાસંગિકતા, કેટલીક અંગતતા, કેટલીક પ્રાકૃતતા કે અપકૃતતા સહિતની વ્યતીત યુગશૈલી અંતર્ગત કુઠિત ચેતનામાંથી શબ્દોનું ક્રિયારું આપતો આ સંગ્રહ એકદરે હવે જાંઓ આસ્વાદ રહ્યો નથી. પ્રબોધે મને અને શાલિનીને કાલ્યસંગ્રહ બેટ મોકલ્યો ત્યારે ઉપર લખેલી ‘હેવટે છેક હમણાં’ પંજિત પાછળ કવિની પેણ આવી જ કોઈ પ્રતીતિનો એકચર સંભણાય છે.



### રાતવાસો

મણિલાલ ડ. પટેલ

આર. આર. શેઠ. મુખર્જી-અમદાવાદ, ૧૯૫૪  
કા. ૨૦૦, રૂ. ૪૫

### શાન્તિલાલ મેરાઈ

ધવો મોટો, પણ...

મણિલાલ પટેલે કહ્યે, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક અને અનુવાદક તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી છે. હવે નવલિકાકાર તરીકેની ઓળખ તેઓ ‘રાતવાસો’ ની ૧૯ વાતાંઓ દ્વારા આપે છે.

જોસેફ મેકવાને આ વાતાંસંગ્રહના આરંભમાં વાતાંઓનો ઉમળકાલેર કરાવેલો આસ્વાદ, નિવેદનમાં લેખકે પોતે આ વાતાંઓ વિશે આપેલી કેટલીક ગૌરવ-પ્રશાસ્તિભરી દિગતો તથા વાતાંસંગ્રહને અંતે મુકાયેલી એક વાતાં ‘ઉમરીની સમીક્ષા તેમ જ મારીવટો’ વાતાંની દ્વિલાવરસિંહ જાડેજાની સમીક્ષા વાંચ્યા પછી આ વાતાંઓ ગુજરાતી સાહિત્ય- ની ઉત્તમ વાતાંઓ હશે એવો અંદાજ વાચકના મનમાં બંધાય. એટલે જો આ વાતાંઓ વાંચીને સમીક્ષકને એના વિશે અન્યથા કહેવાનું થાય તો તેને વાતાકળાની પૂરી સમજ નથી એવું માનવા પેલ્યો ભૂમિકાઓ વાંચનાર પ્રેરાય. આવી પરિસ્થિતિમાં, આ વાતાંઓને વાંચતાંવાંચતાં મારા મનમાં સહજ જ જે પ્રતીભાવ જરૂર્યો તે પ્રામાણિકપણો ને આધારો આપીને મારે

લખવો રહ્યો.

મણિલાલ પટેલમાં વાતાં કહેવાનો કસબ છે, પોતાના વતનની બોલી ઉપર પ્રભુત્વ છે, સંવેદનોને સુપેરે વ્યક્ત કરવાની ક્ષમતા છે છતાં એમ લાગે છે કે વાતાં કહેવાના કસબમાં ક્યાંક કશુંક ખૂટે છે જેથી કેટલીક વાતાંઓ જેટલી સઘન-નક્કર (કોમ્પેક્ટ) બનવી જોઈતી હતી તે બની નથી. (દા.ત. ‘ધીપળો’, ‘જાંબુ’, ‘રાતવાસો’, ‘મારીવટો’, ‘અંતર’, ‘ટ્રેપ ક્રાંચ છે ?’) બોલીનો ઉપયોગ થાય તે બરાબર પણ ક્યાંક તેનો અતિરેક થયો છે અને ક્યાંક એવું લાગ્યું છે કે મણિલાલે પોતાનું આ ભાષાપ્રભુત્વ સાબિત કરવા જ વાતાંના લાઘવના ભોગે સંવાદો મૂક્યા છે. (દા.ત. ‘ચીડો’, ‘બદલી’, ‘મારીવટો’, ‘ફારગાતી’, ‘ધી.ટી.સી. થયેલી વહુ’, ‘બાંધી મુક્કી’) તો વળી સંવેદનોની સૂક્ષ્મતા એમાં થઈ ગયેલા ક્યાંક નિબંધકાર મણિલાલના તો ક્યાંક કર્યા મણિલાલના પ્રવેશથી એની પ્રભાવકતા ગુમાવે છે. દા.ત.

રાતી જારથી લીપેલી ભીતોવાળું ધર ભૌંય તળિયે મોટી મોટી ઓકાળિયો માના હાથનું હેત એમાંથી જાડો પગને અડકે ને અંદર પેસે, કાળજી જઈ બેસે.’ (મારીવટો; પૃ. ૭૭)

આ નિલોડીનો દેલો એની જતુ આવી કે તાતી ઊઠ્યો છે. એના લીલાછમ દેવાને ચઢવા માટે ખેડુ કળિયાં રોપે છે. વાલોળ-પાપડીના દેવા સુકાઈ ગયા છે, હવે એની મોસમ ગઈ. એ દેવાઓને ખેડુએ તાંતેડી નાખ્યા છે. એના કળિયાં હવે નિલોડીનો આધાર બનશે.’ (અંતર; પૃ. ૧૨૦)

મે મહેશનું ધર રંગબેરંગી ચાંદરણાંથી શાશગારી દીધેલું. ટોડલે, દ્વાર સાખે, તોરણે કબાટે, જીતે, ટેબલે, ખુરશીએ, પાણિયારીએ, વાસણે, વળગણીએ, પલંગે, પથારીએ, મેં બધે જ ચાંદરણાં પાથરી દીધેલાં – જાકમગીળ. કેટલા ઉત્સાહથી હું ચાંદરણાં વર્દને આવેલી-અકલંધ, આખેઆખી, વજબોટી...’ (ચાંદરણાં; પૃ. ૧૪૧)

કેટલીક વાતાંઓને એમણે પ્રતીકાત્મક બનાવવાનો પ્રયત્ન કર્યો છે પણ ઠીકઠીક એવાં પ્રતીકો સાંકેતિક રહેવાને બદલે બોલકાં બની ગયાં છે:

દ્વાર ચીડાની તીણી અણી પર એણે ૬

ઓચમતો પગ દાખ્યો... અક્ષી ખૂંપવાને બદલે વળી ગઈ. શરીર પરસેવે તરફ તડકો કરતાં લાગે છે.' (ચીડો; પૃ. ૩૭)

'કંચળીનાં આખલાં અંધારામાં જરવાતાં નહોતાં' (કંચળી; પૃ. ૫૫)

એમની કબૂલર જેવી છાતી ભીસાતાં, પટેલાં છૂટવાનું બળ કરતો સબૂર, હવે વધારે ને વધારે ભીસ કરવા લાગ્યો. ગરમગરમ છટપટાતી કાચા, ઉનાઉના ચાસ સબૂર જાણો બાપની નવી આણોલી ઘોડી પવાણતો હતો. જરજર તળાવ હણહણતું સંભળતું હતું. ઘણી વાર સુધી અંધારું ગુંદારું રહ્યું.' (કંચળી; પૃ. ૫૮)

મેધાણી, મરિયા, પત્રાલાલ અને ઉમાશંકરના જાનપદી વાતાઓ રચવાના પુરુષાથી આધુનિક વાતાકારો પૈકી મણિલાલે આગળ ચલાયો છે એવા મતલબનું જોસેકભાઈએ કહ્યું છે. વાત સાચી છે. પરિવેશ ગામડાનો હોય અને પાત્રોય ગામડાનાં હોય એવી બંધી વાતાઓનો આખો સંગ્રહ આધુનિકો પૈકી મણિલાલ પટેલ પાસેથી જ કદાચ પ્રથમ વાર મળતો હો. છતાં સરખામણી કરવા જતાં એમ કહેવાય કે મણિલાલની વાતાઓમાં મેધાણી જેવો બહોળા અનુભવોનો પ્રભાવ નથી, મરિયા જેવું ભાવવૈવિધ્ય નથી, પત્રાલાલ જેવી 'અભિવ્યક્તિની તાજપ નથી અને ઉમાશંકર જેવું ઊર્ડાણ નથી. આપોઆપ પ્રગતી ઉઠતી સર્જકતામાં જે કામજી હોય છે તેની આ વાતાઓમાં ઓછપ વર્તાયે છે. હું એવી વાતાઓનો ચાહક છું જે અખાની ભાષામાં કહું તો 'અભિનવો આનંદ આજ અગોચર ગોચર હવું'નો અનુભવ કરાવે. અલભત્ત, સિદ્ધહસ્ત કહેવાતા વાતાકારોમાં પણ એવી વાતાઓ ઓછી જ હોવાની છતાં કોઈ પણ વાતાકારની મથ્યમજા આવી વાતાઓ સિદ્ધ કરવાની જ હોવી ઘટે. મણિલાલ પટેલની થોડે અંશોયે આવો અનુભવ કરાવનારી વાતાઓ મને લાગ્યી છે - 'ઉમરી', 'બાંધી મુઢી', 'તોફાન', 'દોઢીમાં'. વતન પ્રત્યેનો તીવ્ર લગાવ એમની મોટા ભાગની વાતાઓમાં જોવા મળે છે. છતાં 'બાંધી મુઢી' વાતા મને એવું સૂચન કરવા પ્રેરે છે કે મણિલાલ પટેલે આત્મકથા લખવી જોઈએ.

આગળ ઉલ્લેખ્યું તેમ ૧૮ વાતાઓ પૈકી પાંચ-છ વાતાઓ તો એમને વાતાકાર તરીકે સિદ્ધ કરે જ છે, છતાં મુખ્યત્વે પ્રશ્નાય, કામ અને વતન પ્રત્યેનાં સંવેદનો ફરતે જ વિંટળતી રહેતી તેમની વાતાઓ, તેમની કંઈક એક જ પ્રકારની લઢામાંથી બહાર આવે તો અવશ્ય કાહું કાહે. ને નિવેદનમાં કરેલા દાવા કંઈક પ્રતીતિકર બને.

અંતે આ સંગ્રહની સૌથી કઠે એવી જો કોઈ વાત હોય તો તે છાપકામ પ્રત્યેની બેદરકારી. મણિલાલ જેવા વિદ્ધાન લેખક હોય, આર. આર. શેઠ જેવા પ્રથમ કક્ષાના પ્રકાશક હોય ત્યારે સંગ્રહમાં વાક્યરચનાને લગતી, ખોટા શબ્દોને લગતી, વિરામ-ચિહ્નોને લગતી અને જોખણીને લગતી પાર વગરની ભૂલો રહી જતી હોય ત્યારે આપણે બેમાંથી ઠપકો કોને આપીશું? □

### સંબંધ વિનાના સેતુ

#### યોસેફ મેકવાન

રાન્ડે પ્રકાશન, અમદાવાદ, ૧૯૭૪. કા. ૧૭૧, રૂ. ૪૨

જગદીશ ગુજર્ણ

### અપેક્ષા જન્માવતી સર્જકદૃષ્ટિ

આ પુસ્તકમાં લેખકે એક લધુનવલ તથા ૨૩ ટૂકી વાતાઓનો સંચય કર્યો છે. આભારી જીવનની પોકળતા અને અભાવના સંવેદનને રજૂ કરવાની લેખકની સર્જકદૃષ્ટિનો એ પરિચય કરાવે છે.

અંતરજીવનનાં રહસ્યોને ગોપવીને જીવનારં દંપતીઓની વાત 'સંબંધ વિનાના સેતુ'ની કથારૂપે રજૂ થઈ છે. દાખ્યતના સંબંધોનું એક જટિલ વિષયક લેખકે આલેખવા ધાર્યું છે. જ્યાં પાત્રો બાબુ સ્તરે જે સામાજિક સંબંધથી જોડાયાં છે, એનાથી ભિત્ત પ્રકારે માનસિક સ્તરે જીવે છે. જેની જંખના છે એને પામી ન શકવાની વથ્થા તેમજ એ વથ્થાને ભૂલી વર્તમાનને જીવત્તા રહેવાની કોણિશમાં આ પાત્રો જીવે છે. અને પોતપોતાના અંતરંગને ગુમ રાખવાની સતત મથ્યમજા કરતાં રહે છે.

શ્રીમા ભગીરથ સાથે પરિચયમાં આવતાં પ્રશ્નાયસંબંધે બંધાય છે, પરંતુ પરિસ્થિતિ વિષમ

બનતાં પ્રશ્નયના સંબંધનો પરિધિ સંકોચાતો જાય છે. અનંત સાથે એ પરણી જતાં ભગીરથ કેવળ યાદોરૂપે એના મનોવિશ્વમાં છવાયેલો રહે છે. તો અનંત એની પ્રિયા મીસ ઈન્દ્રિય વર્મની સ્મૃતિઓમાં ખોવાયેલો રહે છે. ગૌરી ભગીરથને પરણી છે પરંતુ એના ચિત્રમાં મોહનની સ્મૃતિઓ ઢબુરાઈ છે. ભગીરથ ગૌરીના સાત્ત્રિધ્યમાં શ્રીમાનાં સ્મરણોમાં ખોવાઈ જાય છે, તો ગૌરી પતિ ભગીરથના પડખામાં મોહનની યાદોમાં રૂબે છે.

દેરેક પાત્રનું આમ આગવું ભાવવિશ્વ છે. એમના અંતરજગતમાં બાબુ સામાજિક સતરના સંબંધ સંદર્ભ ગુમાવી બેકા છે. સ્વખ અને વાસ્તવ વચ્ચેની દોડમાં આ પાત્રો છદ્વારે જીવ્યા કરે છે. આથી એમના સંબંધો બે પતંગોના ગંઠાઈ ગયેલા પેચ જેવા જીણપાય છે.

૫૮ પૃષ્ઠોનો અલ્યવિસ્તાર ધરાવતી આ કથાને લેખક 'લઘુનવલ' તરીકે ઓળખારે છે. પરંતુ લઘુનવલના સ્વરૂપને અપેક્ષિત એવા મુખ્ય સેન્દ્રિય ચરિત્ર તરીકે આ પાત્રોમંથી એકેયના સંવેદનને સૂક્ષ્મતાથી વિકસાવવાનું શક્ય બન્યું નથી. લઘુનવલમાં આરંભથી અંત સુધી કોઈ કેન્દ્રીય ચરિત્રનું નિયંત્રણ રહેતું હોય છે. ગૌરીના પાત્રને એ પ્રકારે લેખક વિકસાવી શક્યા હોત. 'મને બે સ્વરૂપે જીવનું જીવનું ન હતું' એમ મોહનને સંભળાવતી ગૌરી એના બોસ અનંત સાથે સહજતાથી જૂઠાણું ચલારે છે અને પોતાના જ સંહિતે માનવમનની ગૂઢતા વિશે નિરીક્ષણ કરે છે : 'કેવું ચાલાક છે આ મન ! ભૂતકાળની હડીકત છુપાવી અન્ય અપરિચિત આગળ કેવું ઠાવકું બની જાયતા ને સંસ્કારિતાનો ધુમરસિયો મહેલ રચી દે છે !' એનો પતિ ભગીરથ ગૌરી પાસે પોતાના પૂર્વેના પ્રશ્નયસંબંધની નિખાલસ કબૂલાત કરે છે ત્યારે એને ઠડી સ્વસ્થતાથી સાંલળી કહે છે : 'એટલે આ કઈ નવું નથી. પ્રેમ તો દરેકને થબો જ જોઈએ ને !' - આવી કેટલીક કષોએ ગૌરીના મનોભાવોની સંકુલતા તથા દ્વાદ્શાવસ્થાને લેખક વિશેદ્ધતાથી ઉધારી શક્યા હોત. ગૌરી પોતાના મનનું રહસ્ય અકબંધ રહેવા દે છે. પોતાના દેહની માગણી કરનાર મોહનને એ ઘૃણા કરે છે છતાં એને ભૂલી નથી શકતી. - આવા કેટલાક અસ્તિત્વગત વિરોધાભાસોને તથા ભાવશાબલ્યની

કષોએ સૂક્ષ્મતાથી નિરૂપી શકાયાં નથી.

કથાનાં સાત પ્રકરણોમાં પ્રત્યેકના આરંભે એકબેંક શેર મૂકવામાં આવ્યો છે. જેમાં છણયુક્ત જીવનની પેકળતા તથા આભાસી સંબંધોની અમશાનું સૂચન મળે છે. સ્મૃતિસ્થાન્યો તથા બદલાતો કથનકેન્દ્રોની ટેકનીક દ્વારા કથાનો વિકાસ થાય છે. પાત્રોના સંવાદોમાં ય ભૂતકાળની સ્મૃતિરૂપે સંવાદો આવે ત્યારે એ સ્વાભાવિક જીણપતા નથી. કથાસંકલના ત્યાં શિથિલ બની રહે છે. મોહનનું હાંફેરીલથી મૃત્યુ થાય તથા મીસ વર્મ વિમાની અક્સમાતમાં મૃત્યુ પામે એવી ઘટનાઓનો દાબ વધુ પડતું વજન ધરાવે છે.

ગદની તરાહો નોંધપાત્ર બની છે. રસૂલ તથા મોહનની બાનાં પાત્રોમાં ગ્રામીણ લહેકા તથા વળોટ પોજાયા છે. પણ ક્યાંક ભાષાની ભલક આશ્વામાં લેખક પોતે અંજાઈ જતા લાગે છે :

‘હું પીગળતા બરકની જેમ તત્ત્વી ઊંઠું છું.’

‘ઓગતા સૂરજના તડકામાં એ શબ્દો ક્યારેક એવા તો ભૌંકાય છે કે લોહી સર્કે બની ઝાંક્યા કરે છે.’

- આવાં આલેખનો ક્યારેક ફૂટકતા જન્મારે છે. ‘સ્પર્શારી’ તથા ‘ઉષા’ જેવા શબ્દોનો અતિ વંપરાશ મેનરિઝમ બની રહે છે. જોઉણીની ભૂલો ઘણીવાર અકળારે છે. ‘દ્રિયવંદ્ય’ જેવા એકાધિકવાર જોવા મળતા જોઉણી-દોષ અસહ્ય લાગે છે.

આ કથામાં સંબંધોની ગ્રંથ નિરૂપવામાં લેખકે વધુ ધ્યાન આપ્યું છે. ગ્રંથવાયેલા સંબંધોને કારણે જીન્મતી વિશિષ્ટ ભાવપરિસ્થિતિની સંકુલતા અભિવ્યક્ત કરવા તરફ ઝાંઝું ધ્યાન અપાયું નથી.

\*\*\*

‘સેતુ’ વિભાગની ૨૩ વાતારિચનાઓમાં કેટલીક કૃતિઓ વાતાર્કણાની નોંધપાત્ર શક્યતાઓ પ્રદર્શિત કરે છે. વાતારિસ્વરૂપને અનુરૂપ સંવેદન તથા નિર્વહણારીતિની પસંદગી કરવાની લેખકની સૂઝ પ્રથમ દૃષ્ટિએ જ વર્તાઈ જાય છે. નિરૂપશવિષયનું વૈવિધ્ય પણ ધ્યાનરૂપ છે. દામ્પત્યની પ્રસત્રતા અને વિષમતા, રોજિંદા જીવનની રેઢીયાળતા અને સંબંધોની પેકળતા, અસ્તિત્વગત એકલતા અને વ્યર્થતાબોધ, જાતીય આવેગોના ધખારા તથા કુઠાઓ અર્હી

વિધવિધ પ્રકારે આવેખાયાં છે. કથનરીતિના પ્રયોગો પણ ધ્યાન ખેંચનારા છે. કલ્યાનોની ભાત દારા ઉપસત્રો વિરોધ, તિર્યકૃતા કે વક્તાભરી સર્જકદૃષ્ટિ, ભાવસંકમજ્ઞ, સ્મૃતિસાહચર્યાં, કપોળકલ્યિત અંશો તથા પાત્રોના માનસિક વૈચિત્રયાના નિરૂપણ દારા વાતાકાર કોઈ ને કોઈ સૂક્ષ્મ જીવનરહસ્યને ઉઘાડવા મથી રહે છે. 'એક ધરી - બે બાજુઓં શંકાશીલ માનસને કારણો વ્યાગ્નિત બનેલી સરલાના મનોભાવો આવેખાયા છે. પતિ નયન ડૉક્ટરોની ક્રોનફરન્સમાં બેંગલોર જઈ રહ્યો છે. ત્યાં એને કોંલેજ-કાળના મિત્રો મળશે એનો આનંદ પ્રગટ કરે છે. એની વાતોમાં વારંવાર ડૉ. મીસ મેરીનો ઉલ્લેખ ઉત્સાહનેર થતો રહે છે. આથી નારીસહજ ઈષ્યાને કારણો સરલાનું મન શંકા અનુભવે છે. શંકાનો ભાવ તીવ્ર બનતાં પતિ પોતાને ય સાથે લઈ જાય એવી અદર્ભ્ય ઝંપના જાગે છે. પતિ જાણો પોતાની ઉપેક્ષા કરી રહ્યો છે, એવું અનુભવતી સરલા કશી સ્પષ્ટતા કરી શકતી નથી. એના ચિત્તમાં વધતો જતો ઉચાટ નિરૂપવામાં સર્જકતા પ્રગટી છે. આખરે 'તું પણ મારી સાથે આવે તો કેમ !' એવો પતિનો પ્રસ્તાવ સરલાની શંકાને તરફાળ ઓગ્ગાળી નાખે છે. અંત લગી સરલાની તંગ ચિત્તાવસ્થાનું આવેખન કરવામાં અને વાતરીની વેધક ચોટ સિદ્ધ કરવામાં વાતાકારનો વિશેષ પ્રગટ્યો છે.

'તણખલું' વાતરીમાં પ્રશ્નયવૈફલ્યની વેદનાને કારણો હદપારી અનુભવતા નાયકનું ભાવવિશ નિરૂપાયું છે. વૃક્ષ અને તણખલું, ખડક અને રેતી જેવાં કલ્યાનો દારા એક સાંકેતિક ભાવસુષ્ઠિ નિર્ભિત થઈ છે. નટખટ અને ચંચળ નાયિકા તો કહીને ચાલી ગઈ હતી : 'તણખલું બની ઊર્જા કરજો, રેતી બની સર્વ કરજો.' પરંતુ એ સહજોદ્દગ્ધર તો વિચ્છેદનો અભિશાપ બની નાયકના જીવનને વેરાન બનાવી મૂકે છે. ભૂતકાળની રમ્ય કષ્ણોમાં રાચ્યા કરતો નાયક અચાનક પ્રિયાનો ચહેરો તરવરી ઊઠતો જુઓ છે. હથ લંબાવે છે... "એની લટ પકડાઈ પણ સરકી ગઈ. મુક્કી ખોલી જોયું તો તણખલું." આન્તિદ્શાના કપોળકલ્યિત અંશો ધરાવતી શૈલી વાતની આસ્તાવ બનાવે છે. અભ્યાવ તથા હદપારીની વેદના આ કષ્ણોમાં દ્વિગુણિત બની રહે છે.

'એ...!' માં નાયિકાની ભાવસ્થિતિમાં આવતાં

સૂક્ષ્મ પરિવર્તન કલ્યાનોની ભાત દારા મૂર્ત કરવાનો પ્રયાસ છે. 'અસ્તિત્વની ધાર પરમાં પણ કલ્યાનલીલા દ્વારા કુઠાઓ તથા અસંગ્રહિતનો બોધ મુખર થયો છે. 'બે કષ્ણોની વચ્ચે'માં પ્રિયતમને મળવાનો નાયિકાનો ઉન્માદ તથા થનગનાટ કેવો હેરી ઉધાસીનતા તથા વિશાદમાં પરિષ્ણિતે છે એનું માર્ગિક આવેખન થયું છે, 'અંત વિનાની વાતરી'માં રોજિંદી પરિસ્થિતિ તરફ આકસ્મિક દૃષ્ટિપાત કરવામાં આવ્યો છે. 'ભય' તથા 'દુન્દ'માં જાતીય આવેગોની ઉન્મુક્ત અભિવ્યક્તિ છે, જોકે એમાં સૂક્ષ્મતાનો અભાવ છે.

'કોઈપણ નામધારી' વાતરીમાં નિભ મધ્યમવર્ગાય માનવીના જીવનની અપેક્ષાઓ, લાચારી, અસહયતા તથા આત્મનિર્વિસનનું સંવેદન નિરૂપાયું છે. મધુ રાયની 'ધારો કે' વાતરી અહીં તરત યાદ. આવી જાય, જોકે મધુ રાય જે પ્રકારે પરિસ્થિતિ સાથે aesthetic distance કેળવી માનવજીવનની સામાન્યતામાંથી સૂક્ષ્મ જીવનરહસ્ય પ્રગટાવે છે, એવું આ ફૂટિમાં લેખક સિદ્ધ કરી શક્યા નથી. અહીં ફૂટિના Narrator સાથે વાતાકારનું ચિત્ત પણ ભળી જાય છે તથા ચોક્કસ બોધ કરાવવાનો સંકલ્પ ઉઘાડો પડી જાય છે.

ભાવનાવાદ તથા પ્રયોગખોરીએ પણ કેટલીક વાતાઓને નબળી બનાવી છે. 'બારી' વાતરીમાં સંવાદશીલી તથા કૌસ રચનાઓ, 'આકાશને ખૂશ્ય નથી હોતા'ની ભાવનાવાદી સુષ્ટિ, 'બંધ'માં પ્રચારાત્મક બની જતો ચૂર - વાતરીની સંરચનાને શિથિલ બનાવે છે. બે વાતરીઓના પેટાશીર્ધક તરીકે 'એક સિનેમેટોગ્રાફિક સ્ટોરી' એવું લટકણીયું નંબું કશુંય સિદ્ધ કરી શકતું નથી. બલકે, એવી ફૂટિમાં સિનેમેટોગ્રાફિક ટેકનીકનો પૂરેપૂરો કસ વાતાકાર કાઢી નથી શક્યા એવું લાગે છે.

ઇતાં, આ વાતરીઓમાં યોસેક મેંકવાનનો વાતાકાર તરીકેનો તથા એમની અનોખી કથનરીતિનો મિજાજ ધડાતો આવે છે. કલ્યાનોની ભાત દારા ભાવ- સંવેદન-ની સાંકેતિક ભૂમિકા રચવા તરફની દિશા પકડાય છે. ગદની ઈન્દ્રિયસંવેદ છટાઓનો તરબ લયાન્વિત વેગ આકર્ષે છે. પાત્રમાનસ, પાત્રવર્તન તથા પરિસ્થિતિનું બારીક અવલોકન કરવાની ક્ષમતા ઊઘડી રહી છે. આ વાતરીઓમાં સક્રિય બનતી સર્જકદૃષ્ટિ આપણા માટે એક નવી અપેક્ષા તો જન્માવે છે. □

રેલવે સ્ટેશન  
હર્ષદ કાપડિયા  
આર. આર. થેઠ, મુખૂરી-અમદાવાદ, ૧૯૬૪  
કા. ૧૭૨ ર. ૪૦

### સિલાસ પટેલિયા

## સ્મરણોનાં સંવેદનરસ્યાં દૃશ્યચિત્રો

દૂરપિદૂરના બચપણના અને એ પછીના સમયનાં, સંવેદનમાં બરાબર એકરસ થયેલાં સંસ્મરણો અહીં અત્યંત લાઘવથી શબ્દસ્થ કરાયાં છે. ગદમાં કાવ્યાત્મકતાનો સંસ્કર હોવા છતાં અહીં ફૂતક કાવ્યાત્મકતા, અપ્રસ્તુત અલંકરણાયોજન, શબ્દ-આત્મભાજી અને શબ્દ સાથેનાં ખોટાંખોટોં લાઉનો અભાવ છે. અનુભૂતિની બોયમાં ઘડાઈને આ નિબંધોની સુણિ આપણી સમક્ષ ઉંઘડે છે, જેમાં વિસ્મય છે, મૌનનું ઉંડાણ છે અને પ્રકૃતિની અનુકરણી લીલા છે. 'બદલાતાં દૃશ્યો' નામના નિબંધમાં વેખકે જે કેફિયત આપી છે, એમાં આ સર્વ નિબંધોની સુણિનો ટેન બંધાયેલો જોવા મળે છે : 'હું મારા અતીત વિશે વિચારું છું ત્યારે મારું અસ્તિત્વ એ અતીત સુધી લંબાયેલું જોઉં છું. ગામડાના રસ્તાની ધૂળમાં મારાં પગલાં આ અસ્તિત્વના પ્રતીકરૂપે હજુ સુધી સચ્ચાયેલાં પડ્યાં છે. આ અસ્તિત્વ ખૂબ નક્કર હોય છે. કારણ કે એ પગલાં પરથી કોઈ છોકરો વૃક્ષની ડાળ ઘસડીને લઈ રહ્યો હશે અને વિસોટો, બકરાના મોઢામાંથી પડી ગયેલું પાંદડું, ફૂતરાની લાળ, ગાડાના પૈડાના ચીલા વગેરે ઘણું પડ્યું હશે. છતાં એ હજુ સુધી ભૂસાયું નથી. ગામડાના કૂવામાં અંદર મોહું સાખીને પુઢાના લોભે બૂમ પાડતો એ અવાજ પાણીને ભેટાને તળિયે પહોંચી ગયેલો. કોઈ પણ કોસ કે ઘડો હજુ સુધી આ અવાજને ઉલેચી શક્યો નથી.' (પૃ. ૧૫૦) આમ આ નિબંધજગતમાં અતીતનો મધુર અવાજ છે. એ અવાજ સંકુલતા સમેત રહ્યાન્ન છે, જેને ઊંચકવા સર્જક અહીં મધ્યા છે. આવી અનેરી નિબંધલીલાને સમજવાનો, અનુભવવાનો અહીં એક પ્રયાસ છે.

અહીં કેટલાક નિબંધો રેખાચિત્ર યા રેખાચિત્રના અંશો ધરાવતા કે લઘુકથાની ક્ષમતવાળા છે. લઘુકથા, રેખાચિત્રની લગોલગ પહોંચે એવો એમાં પ્રયોગ પણ દેખાય. 'બ્યોર' નિબંધમાં બપોરી શાંત વાતવરણ, તડકાની ધાર, સ્તરખતપનું સ્થિર અને વચ્ચેવચ્ચે તૂટું ચિત્ર છે. એમાં નથું ઠક્કર છે. નથુના જીવનની એકવિધતા, નીરસતા, ચીડ અને કટાળો એના વર્તનની થોડીક લકીર દ્વારા પ્રાપ્ત થાય છે. 'ગધડીના નતું કંઈ છાપતા જ નથુંમાં છાપાં પ્રત્યેની એની ચીડ, એ સાથે જ એના જીવનની એકવિધતા પ્રકટ થઈ જતી અનુભવવા મળે છે. નીરસ બપોરને ચીરતો લાકડાં ફડવાનો અવાજ, ફૂતરાનું ઓટલા પર આવવું, માખીની કિયાને ધ્યાનથી જોતાં રહેવું - આ બધી ગતિશીલતાની મધ્યે નથુનું રેખાચિત્ર ઓછા શબ્દોમાં સરસ રીતે ગુંથાયું છે. તરલ ચિત્રો દ્વારા એક વાતવરણ બંધાય છે. 'ઘરીમ-ટેલબ'માં જુદાજુદા વિષયના શિક્ષકોની ખાસ લાક્ષણિકતા દર્શાવીને નર્મમર્પુકત વાણીમાં વેખકે રેખાંકિત કરેલા આ શિક્ષકો આપણી નજરમાં પણ હલબલી ઉઠે છે. એમાં હણવાશ સાથે લાઘવયુક્ત રેખાચિત્ર મળે છે, એ નોંધપાત્ર બાબત છે. "જાનસ"માં નાનીમાનું ચિત્ર : ... મારી નાનીમાં ખૂબ ભોળાં. જાનસને થાંબલલી પરથી ઉત્પારે. એને રાખથી માંજે. રાખ ભેગી મેશ અને તડકો ભૂસ્યાઈ જાય, ખરી પડે. પછી ગ્રેણમટોળ ટાંકીમાં ઘાસતેલ ભરે ત્યારે એમની આંખમાં તો એવી આસ્થા હોય કે આ ઘાસતેલ એટલે જ અજવાયું. પછી વાટ સરખી કરે અને ફોટો ચડાવી દે. ત્યાર બાદ નાનીમાં બાકસમાંથી દીવાસળી કાઢે. સળગાવે, એક હાથે જાનસની નાનકડી દાંડી દબાવે, ફોટો ઊંચો થાય, દીવાસળી અંદરની વાટને અડાડે, ફોટો નીચો કરે, આખી વાટ પટે. ફોટો પીળા પ્રકાશથી છલકાઈ ઉઠે. નાનીમાનો ચહેરો પણ પ્રકાશમાં ખીલી ઉઠે. તેમના રૂપેરી વાળ સ્પેનેરી બને. ચહેરા પરની કરચલીઓ વધુ ઉંડી લાગે. મંદિરની અલાર ભેગું નગરું પણ વાગે' (પૃ. ૩૩) જાનસનો સંદર્ભ લઈને એકિત કરેલું નાનીમાનું રેખાચિત્ર તો આજા નિબંધનો એક અંશ જ છે. કુશળ કેમેરામેન આસપાસના પરિસર પર પ્રકાશ ફેરી મૂળ બાબતને દૃષ્ટિગ્રેચર બનાવે એવી રીતે

અહીં ફનસ સાફ કરવાથી માંડી, એને પેટાવવા લગીની નાનીમાની ગીણીજીણી કિયા દર્શાવીને, એક ગતિશીલ અને અંતે સ્થિર થતું નાનીમાનું ભાવચિત્ર એમજો આપ્યું છે. 'ચંદ્રવો'માં ભરતકામમાં કાબેલ ડોશીમાનું શબ્દચિત્ર કરુણમધુર છે. ચંદ્રવામાં ગુંથાતા મોર, પોપટ સજીવ થઈ ઉઠે, બપોરનો અવાજ પણ એમાં ભળી જાય. ગરમ ઘૂળની સોડમ પણ ગુંથાઈ જાય. સર્જિક આવા વિવિધ સંદર્ભો ગુંથીને ડોશીમાની એકાગ્રતા, જીવનને માણસવાની તરસ, વગેરે દર્શાવ્યાં છે. ચંદ્રવો જાણે કે ડોશીમાના જીવનનું જ પ્રતીક બની જાય છે. પરંતુ એની સાથે અશુભ સંદર્ભ જોડાઈ જતાં એ ચંદ્રવા પ્રત્યે ઉદાસીન પણ થઈ જાય છે. 'નાનામી' નિબંધ આધુનિક વાતાવરણ જેવો છે. ડાખુઓ અને અન્ય માઝસોના કિયાકલાપો દ્વારા સમશ્શાનભણી ગતિ કરતો માનવસમુદ્દાય તાદૃશ થાય છે. મરણ પામનારનું નનામીમાંથી બહાર આવતું અને જીવતાનું ગોઠવાતું એ આખી કિયા રસપ્રદ બને એવી રીતે આદેખાઈ છે. ટૂકી વાતાની બધી જ ક્ષમતા અહીં છે. 'હબસીઓ'માં બેન્ના લીટીમાં અંડિત કરાયેલું એક હબસીનું ચિત્ર, 'સર્જકને કિનારે'માં એકાદ લસરકે શબ્દસ્થ થયેલ ગાંડો વૃદ્ધ અને બે ગ્રાઈવરનાં ચિત્રો કે "તડકો"માં લેગરબાવાનું રેખાચિત્ર ભલે લાઘવયુક્ત હોય, છતાં મમ્મેસર્શા અમીટ છાપ પાડનાર અને સર્જક-સર્વેદનથી ર્યાન્બિર્યાં છે.

અંધકાર-અજવાસ-પ્રકાશ-ઉજાસનાં વિવિધ રૂપો આ નિબંધસૂચિમાં સંતરેક રીતે રજૂ થયાં છે. 'વરસાદ' નિબંધમાં આવતું વર્ણન ઉજાસ-અંધકારને મૂર્ત કરે છે : 'સવારે આંખ ખૂલે ત્યારે અંધારું હજી પૂરેપૂરું ઊરી ગયું ન હોય. વરસાદ આકાશમાંથી ઉજાસ લાવીલાવીને અંધારાને ધોવાની મથામણ કરતો હોય. પણ અંધારું કેમેય ન ધોવાય. સામેની લાકડાની બારી પર, મકાનની પાળી પર, ઉજાસ રેલાયા કરે.' (પૃ.૧) આંખ ખૂલે છે, એ રોજિંદી ઘટના છે. આરંભમાં અંધારનું સ્થિર ચિત્ર છે, પછી ઉઘડતા ઉજાસનું ગતિશીલ ચિત્ર દોર્યું છે, જેમજેમ ઉજાસ પથરાય છે, એમ એમ અંધાર હટે છે. છતાં એ સંપૂર્ણ ગયો નથી. એની પણે 'બારી પર, પાળી પર' રેલાતો ઉજાસ છે. આ લેખના અંતમાં બલ્બના પીળા

અજવાણામાં ભળતું અંધારું એક જુદા જ વરસાદી વાતાવરનો અનુભવ કરાવે છે. 'ફનસ'માં રાત્રિના ધેરો અંધકારમાં અંડિત કરેલું આ ચિત્ર અદ્ભુત થયું છે : 'એવામાં સામેથી બીજું ફનસ આવતું દેખાય. એના અજવાણામાં બે પગ ચાલતા હોય. એ બે પગની ઉપરનું અંધારું નજીક આવે.' (પૃ.૩૫) અંધારામાં ફનસ લઈને ચાલતા અને સામે આવતા માણસને રામરામ કહેતા માણસનું આ દૃશ્ય કળાત્મકતાથી આદેખાયું છે ને એમાં સ્થિર અંધકાર અને ફનસનો થરકતો પ્રકાશ સરસ રીતે શબ્દસ્થ થાય છે. પેટ્રોમેક્સનું અજવાણું સુસવાય મારતું હોય', 'શરીરમાં એ પીળું અજવાણું ફરી વળે', 'અંધારાનો ધાબળો ઓઢી સૂઈ જાઉં', '... અજવાણામાં ફનસની પીળી જ્યોત દૂલ્લી ગઈ હોય —' આવાઆવ અંધકાર-અજવાસના ભાવસંદર્ભોમાં ઈન્દ્રિય-ગોચરતા છે. સર્જક-ગધનો અનોખો અનુભવ પણ એમાંથી મળે છે. 'બુપાલી તોડી'માં આવતી દીવીનો પ્રકાશ પણ વિવિધ રૂપોવાળો છે. એ પ્રકાશ વળી જુદું જ અપાર્થિવ વાતાવરણ રચે છે.' 'અભોગી કાનડા'માં પણ વિશિષ્ટ પરિવેશ, વાતાવરણ અને અનુભવ છે : લીલાં ટ્પકાનું જુમ્મર રચાઈ જાય છે. તેના પ્રકાશથી લીલો અંધકાર જણકી ઉઠે છે. જરૂખા, બારી, કમાન, બેઠકો પર લીલા પ્રકાશનો અભિષેક થવા માંયો. ધીમેધીમે, વધુ ને વધુ પ્રકાશનો ઢોળ ચઢતો રહ્યો. જરૂખામાં ઉભેલી રાજકુમારીની આંખોમાં લીલો પ્રકાશ અંજાઈ ગયો.' (પૃ.૧૩૮) રાગને સાંભળતાં અને માણશતાં સર્જકને જે અનન્ય અનુભવ થયો, એનું અહીં આદેખન છે, જે સંકુલ છે. જુમ્મર વિશિષ્ટ સ્થળનું નિર્દર્શન કરે છે. એનો પ્રકાશ, એથી જણકતો પરિવેશ અને રાજકુમારીનો સંદર્ભ - વિશિષ્ટ વાતાવરણ જન્માવે છે. બધું તાદૃશ થઈ ઉઠે છે. 'ઓહો ! જાણો અંધારિયો કૂવો !' (પૃ.૩૩) 'ધીમે ધીમે દીરો દેખાતો બંધ થઈ જાય એટલું અંધારું ઉંતરી આવે.' (પૃ.૩૬) 'ગહન તિમિરમાં તારાનું તેજ પડઘાતું હતું.' (પૃ.૧૩૭) ટેરવાં પર જાણે અંધારું ઉંગે.' (પૃ.૮) આ બધાં ચિત્રોમાં અમૂર્ત અંધકાર મૂર્ત થઈ ઉઠે છે. એની નિબિડતા અને ગતિશીલતાનો પણ દૃશ્ય-શાબ્દસર્થ ભાવકલાનો દ્વારા અનુભવ થાય છે. સુરેશ જોશી, મણિલાલ દેસાઈ, ગ્રેવર્ડનરામ

ત्रिपाठी ('સ્નેહમુદ્રા')માં આવતાં અંધકારનાં વણનોની યાદ આપે, એવાં આ અંધકાર-વણનો સચોટ અને વેધક છે.

પવનના વિવિધ સંદર્ભો પણ અનેક નિબંધોમાં કલાત્મકતાથી ગુણ્યાયા છે. 'જરમર' નિબંધનો ઉઘાડ : 'ચારેકોર ચુપકીદી છવાઈ હોય. વૃક્ષો કોઈકના પગરવની વાટ જોતાં હોય. પંખીની પાંખો જાણે ફક્ટાટ ભૂલી ગઈ હોય. ત્યારે અચાનક કાનની બૂટને ઘસાઈને પસાર થતા પવનનો પગરવ સંભળાય. નાનકદી ઉમરી કંકરા ને પાંદડાં ખખડાવતી આગળ નીકળી જાય. વૃક્ષો પણ એમાં તાલ પુરાવે. એને સાથ આપવા બારી ખખડે. જોરથી અથડાઈને પોતાનો કાચ ઝોડે. એના પડધા ચારેબાજુ પથરાઈ જાય.' (પૃ.૭૮) આરંભમાં સ્થિર ચિત્ર છે. પવન ધીરેધીરે ફૂકાય છે અને બધું આસ્થિર થઈ જાય છે. અંતમાં એની ગતિ વધે છે. આ પવનની ગતિનું ચિત્ર વૃક્ષ, પાંદડાં, બારી અને કાચના સંદર્ભ દ્વારા બરાબર સજ્જવ થયું છે. 'અદૃશ્ય પવનને લીધે પાંદડામાંથી ધ્વનિ વહે છે. મને એમાં મારાં ઝાંઝર ઝમકતાં લાગે છે.' (પૃ.૧૨૩) 'પણ કોઈકના મંદમંદ ઉચ્છ્વાસ જેવી પવનની લહેરખી સૂક્ષ્મ ઘાસ પરથી પસાર થઈ ગઈ. એને લીધે ઘાસ ઝંકુત થયું.' (પૃ.૧૨૮) આ બંને વણનોમાં માનવીય ભાવ સાથે પ્રકૃતિ અને પવન જોડાતાં, એક જુદો જ સંવેદન-અનુભવ સાંપડે છે.

અહીં ઘણાબધા નિબંધોમાં જુદાજુદા સંદર્ભમાં તડકો અને એ નિમિત્ત રચાતું વાતાવરણ અનુભવવા મળે છે. 'તડકોમાં તડકાનું ચિત્ર : 'તડકો વડીને ઠેડીને ફળિયામાં ઊતરી આવે ને તુલસીક્યારામાં તુલસીના પાનની મુલાયમ રૂંવાટી પર પડે ત્યારે તુલસીનું પાન હસી ઉઠે. પછી સામેના મકાનની પછીતનો વારો. તડકો આખી પછીત પર પથરાઈ જાય.' (પૃ.૨૮) અહીં તડકાથી આસપાસનું વાતાવરણ જે રીતે ખીલી ઉઠે છે, એનું દૃશ્ય છે. તડકાની તરલચંચલ ગતિ આખા નિબંધમાં છે. 'ફનસ'માં આથમતા તડકાનું આ ચિત્ર જુઓ. ઉનાળાનો તડકો આથમવાનો થાય ત્યારે અમારી ઔશરીની થાંબલી પર અંટો મારવા આવે અને થાંબલીમાં ખીલી ખોડીને ટાંગેલા ફનસ પર પડે. ફનસના ઝોટામાં તો આછી મેશ જામી હોય. તડકો

એ મેશમાં થઈને ધરાર ઝોટામાં ધૂસે પછી આરપાર નીકળવા મથે" (પૃ.૩૨) સંજ અહીં સજ્જવ થઈ જાય છે. તડકાનું ફનસમાં પ્રવેશાંબું - એ ગતિભર્યુ ચિત્ર પણ સુંદર બન્યું છે. તડકાનાં આવાં અનેક ભાતીગળ ચિત્રો અહીં આવેખાયાં છે.'

આ નિબંધોમાં સ્થિર, તરલ, ચંચલ અને ગતિશીલ એવી વિવિધ દૃશ્યત્તમકતાનું આવેખન થયું છે. ક્યાંક કથન દ્વારા, ક્યાંક વણન દ્વારા, ક્યાંક એકાદ કલ્પન દ્વારા સર્જકે વિવિધ ભાવમય ચિત્રો અંકિત કર્યા છે. એમાં લાઘવ છે, સાદગી છે, છતાં કલાત્મકતા અળપાતી નથી. 'વાદળ' 'ધૂમ્રસ' વગેરે નિબંધોમાં પ્રકૃતિના વિવિધ પરિસરમાં વાદળ-ધૂમ્રસને વિહરતાં દર્શાવીને સરસ ચિત્રો કર્યાં છે. પડછાયોમાં ઓશરીમાં ગોઠવેલાં ઢામનાં સ્થિર ચિત્રો વીગતપ્રચુરતાને કલાત્મકતાથી ખપમાં લેવાની સર્જકની આવડત સૂચવે છે. 'ભૂપાલી તોડી'માં વડવાઈ પર જૂલતી બાળકીનું ગતિશીલ, પ્રસત્રકર ચિત્ર અમીટ છાપ મૂડી જાય છે. વડની જૂલતી આળી, પંખીનો ફક્ટાટ, ચાંચમાંથી ખરી પડતો ટેટો - કેવું તરલ, ચંચલ જગંત અહીં શબ્દમાં ખીલી ઉઠે છે ! "સાહેલી તોડી"માં આ ચિત્ર કેવું સ્થિરતાનું મૂર્તિમંત રૂપ છે : "તેના ઝરુખા પર ઉદાસી બેઢી હતી. ન કોઈ રણકાર, ન કોઈ ઝણકાર, ન કોઈ અણસ્પાર, ન કોઈ ઉદ્ગાર, બધું જ નીરવતમાં તદાકાર." (પૃ.૧૧૮) ભાવસમાધિના અનુભવનું આ પ્રતીકાત્મક આવેખન સુંદર છે. "ન"નું 'આવતન સ્થિરતા ધૂટે છે અને અનુપ્રાસાત્મક શબ્દો લયાન્વિત સમાધિસ્થ સ્થિતિ દર્શાવે છે. 'જેઝમીન'માં આવતું આ વણન પણ રાગને માણતાં થયેલા પરમ આનંદને પ્રકટ કરે છે : 'જાણો નદી વહી. નદીના પનઘટ પર મટુકી લઈને ગોરી પાણી ભરવા આવી... ઠમક ઠમક. ઢેલની નૃત્યમય અદા એની પાણીમાં પગ મૂર્જાઓ છલક છલક... મટુકી ડુબાડી ભમમ ભમક. મટુકી છલક છલક...'

'ગાડી', 'ચણોઠી', 'બદલાતાં દૃશ્યો' અને 'રેલે સ્ટેશન' - એ નિબંધોના કેન્દ્રમાં સ્થળવિશેષ લેખે સ્ટેશન છે. સર્જકના અંતરના અતલ ઊંઘણમાં આ સ્ટેશનસંદર્ભ વિશીષ સંવેદન બનીને ઓગળી ગયો છે. પેલા અનામી સ્ટેશનના નામને વાગ્યોળતો બેસી રહું છું. હું આ સ્ટેશનની ભાગ્યોળમાંથી બહાર નીકળી

શકતો નથી' (પૃ. ૧૪૫), '... પ્રવાસીની આંખમાં સંતાઈને ભાગી છૂટવાની યોજના તૈયાર છે, પરંતુ ગાડી ક્યારે આવશે?' (પૃ. ૧૪૭) આ અને આવો વિશિષ્ટ ભાવસંદર્ભ સર્જકચિતની ભીતર, જીવનનો જે રાગ રહેલો છે, જે રહેસ્યમયતા પડેલી છે, એનો અંદ્રાજ આપે છે. રેલવે સ્ટેશન' નિબંધ આ કોટિના નિબંધોમાં ઉત્કૃષ્ટ છે. એમાં પ્રવાસી, એકલદોકલ માણસ અને સ્ટેશન પરની વિવિધ બાબતો - એવી રીતે એકરૂપતા સાથે છે કે સંંગ દૃશ્યનો સ-રસ અનુભવ થાય છે. લેખકની વૃક્ષપ્રીતિ ને ભાવના-મયતા 'છોડ', 'પાનખર', 'વૃક્ષ' નિબંધોમાં અભિવ્યક્તિ પામ્યાં છે. શહેરીકરણ, યાંત્રીકરણને લીધે વૃક્ષો કપાતાં જાય છે, એનો અંજપો અહીં છે. અહીં વંગ - કટાક્ષ છે, બોધાત્મક વલણ છે. વાત વાજબી હોવા છતાં, કલાત્મકતા જોખમાય છે. એથી આ નિબંધો નબળા છે. 'કોયલ' 'ફૂરદર્શન' અને 'આડામાં' સંપ્રત માનવજીવનની સંવેદનબધિરતા, જરૂરતા અને કોઠે પડી ગયેલું રેઢિયાળ જીવન પ્રતિબિંબિત થાય છે. આ નિબંધોમાં પણ કલાત્મકતા ઓછી વર્તાય છે.

આમ, આ નિબંધોમાં અતીતરાગનું ઈન્ડિયપ્રત્યક્ષ આહેજન છે. એમાં મુખ્યતા, વિસ્મય, તીવ્રતમ ભાવસંવેદન ગુંથાયાં છે. સર્જકની નિરીક્ષણશક્તિ, વાતાવરણ, રચવાની ક્ષમતા, કોઈપણ સંવેદન વિચારને રૂપાયિત કરી આપવાની સૂજ, અને ભાષાનું ક્રોશલ જોવા મળે છે. પ્રકૃતિ અને માનવજીવના સુંદર સંયોજનથી નીખરી ઉઠતાં ગતિશીલચિત્રો તાપાળીપૂર્વ છે. 'સ્ટેશન' વિષયક નિબંધો, 'વરસાદ', 'ઝાનસ', 'ચંદરવો', 'ધાપરાં', 'પગલાં' એમના ઉત્કૃષ્ટ નિબંધોના નમૂના છે. ગુજરાતી લખિત નિબંધની સુણિમાં આ એક અનોખો કલમરવ- શબ્દરવ છે. □

## ઇશ્વર અહ્યા તેરે નામ

ગુજરાવંત શાહે

આર. આર. શેઠ, મુલ્ય-અમદાવાદ, ૧૯૮૮  
કા. ૧૪૪, ર. ૪૦

મનોજ ઓગા

## કોમી તઙ્ગાવોનું સમભાવી વિશ્વેષણ

માણસ સામાજિક પ્રાણી છે એ ખરું પરંતુ તેની સામાજિકતાનાં અનેક સ્કુરેશા છે. આથી વસુધૈવ કુટુંબક્રમ તરફ ગતિની સાથે સમાજ-માળખાંની અંતર-પ્રક્રિયાના કારણે પ્રવૃત્તિ અનુસાર અનેકાનેક સામાજિક જીથરચના આકાર પામતી રહે છે. આવા સંબંધોની સંકુલ ભાતથી કેટલાંચે અંતરિક સ્પધારીન્દ્ર સજીવ છે. પણ આવાં બે કે વધુ પ્રબળ જીથ્યો વચ્ચે જો અંતરવિરોધ સજીવ તો તે મૂળ સમાજના સુચાલન માટે ભયજનક નીવડે છે.

વીસમી સદીના ભારતમાં હિન્દુ-મુસ્લિમ તઙ્ગાવ કટોકટીની કષાયે ઉપસેવા છે. આ તાતા પ્રશ્ન સર્વ જાગ્રત વ્યક્તિઓ કઈક મથામત્સ કરતી રહે તેવું આ લેખસંગ્રહમાં તાકેલું છે. આથી તેઓ 'અધી જાતિઓના, બધા ધર્મોના અને બધા પક્ષોના વિચારવંત સજીજનોના હાથમાં' આ પુસ્તક મૂકે છે.

ગુજરાવંત શાહે વિચારોના વૃદ્ધાવનમાં કરેલા વિધારની ભેટ ગુજરાતને લખિત નિબંધોસ્વરૂપે મળતી રહી છે. બુદ્ધ, મહાવીર, ગાંધી, સરદાર જેવા વિજ્ઞાનિવિશેષને અધ્યરૂપ રચનાઓ પણ તેમણે આપેલી છે. ધર્મપુરુષ અને કર્મપુરુષની એમની ઓળખ અભ્યાસુની છે. આ લેખસંગ્રહમાં આપણે હિન્દુ-મુસ્લિમ વચ્ચે સતત ચાલતા માનસ-યુદ્ધને અનેક દૃષ્ટિકોણથી તપાસ્યું છે. તેમનું નિરૂપજ કોઈ નયા વિશ્વેષકનું (ડિટેક્સ એનાવિસ્ટનું) નથી પરંતુ એક સંવેદનપદુ સહભાગીનું છે.

વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ લેખોનો આ સમુચ્ચ્યુ હોવાથી તેને સમકાળીન સંસ્કરણ સાંપરેલો છે. આથી વિષયવિકાસના તબક્કાઓની માળખાંગત મર્યાદા-ઓ તેને નહીં નથી લેખક પોતાની પ્રાસાદિક ભાષા-રીતને લીધે હિન્દુ-મુસ્લિમ સંબંધોના આ સંવેદનશરીર

વિષયને વધુ ગ્રાહ ને આકર્ષક બનાવી શક્યા છે.

લેખકે બતે કોમો, તેના નેતાઓ, કોમવાઈ સમૂહો તથા રાષ્ટ્રીય પક્ષોને ખુલ્લામાં લપડાક મારવાનો ઉપકમ કર્યો છે, પરંતુ તેમની લપડાક સ્નેહ-ચિંતા-પ્રેરિત હોવાની જાણ પાનેપાને થાય છે. તેમજો ઉભય કોમને સમજ આપવાનો, ધમકાવવાનો, રમૂજ કરવાનો, દાખલા આપી દલીલ કરવાનો અને કેટલીક શ્ટોક-સ્રીટમેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે.

પુસ્તકના પ્રથમ લેખની શરૂઆત તેઓ ભારતીય મુસ્લિમોનાં જનીનતત્ત્વોને લગતી રમૂજ મૂકીને કરે છે : ‘આજના ખુદાબક્ષના પિતા અલ્લાબક્ષના બાપા મૌલાબક્ષના બાપા... રામપ્રસાદ હતા !’ મહંમદ-અલી જીણાને ટંકીને પુસ્તકમાં અન્યત્ર પણ એમજો નોંધ્યું છે કે ભારતના મુસ્લિમોના છુટ ટકા હિંદુ મૂળના છે. એક મૂળના ગણી હાલનું વૈમનસ્ય ઘટાડવા મૂકેલી આ રમૂજ મુસ્લિમોને કેટલીક રોચક રહે તે પ્રશ્ન છે. કુંતીપુત્ર કહુને તે પાંડવ છે તેમ જણાવાયા છતાં આખર સુધી તેણે સારથિપુત્ર કહેવડાવવાનું ચાલુ જ રાખ્યું હતુંને ?

આવી વેધક ચોટ સંગ્રહના લેખોમાં અત્રતત્ત્વ વેરાયેલી છે. પાંચ-પંદર પેઢીએ એક જણાતાં હિંદુ-મુસ્લિમો વચ્ચે અલગાવ તો ઠીક પણ તનાવ, વિખવાદ અને અથડામણાનું કારણ શું ? તે માટે જવાબદાર કોણ ? તેવા પ્રશ્ન ઊંઘી ગુણવંત શાહ ધર્મગુરુ અને રાજકારણીઓને નોખા તારવે છે અને લોકો તેમને ઓળખી જાય તો અદ્ધું યુદ્ધ જીતી ગયા જાણવું એવો આશાવાદ પ્રગટ કરે છે. આનાથી કદાચ જેને તે ‘સિન્થેટિક ખુલ્લો’ કહે છે તે સમામ થશે તોયે મનો-સાંસ્કૃતિક એકતા વિના બે કોમો વચ્ચેની સમસ્યા સંતાઈ જવાની નથી તેવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. આથી જ તેઓ કહે છે. ‘બે કોમો વચ્ચેનું વૈમનસ્ય ઈતિહાસનું ઓણિયાણું છે !’

આમ તો આપણને કહેવાતું રહ્યું છે કે પ્રજાની યાદદાસ્ત ઓછી હોય છે. પરંતુ ઈતિહાસ તો અવચેતન મનમાં પડેલી છબિઓ રૂપે સચવાયા કરે છે. આથી પ્રત્યક્ષ કોઈ પ્રસંગ વિના અવચેતન મન, પ્રજાની પ્રતિક્રિયાનું નિસ્સરણ કરે છે. આમ હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્વનો ઈતિહાસ તેમના વર્તનની સમજ આપી શકે.

ગુણવંત શાહે આ ઈતિહાસની સમજ આપવા રામમનોહર લોહિયા, એમ. જે. અકબર અને જે. એસ. બંદૂકવાલાના લેખોની મદદ લીધી છે. ભારતમાં સત્તાના સથવારે આવેલા ઈસ્લામ અને હિંદુ ધર્મ શાસક-શાસ્ત્રના નાતે સમાંતર પ્રવાહે હજાર કરતાં વધુ વર્ષ રહેલા છે. આથી મુસ્લિમોમાં લઘુમતી છતાં ગૌરવની અનુભૂતિ વટાળનું પ્રોત્સાહન, તેને લીધે હિંદુમાં નિહિત રોષની લાગણી, બીજી બાજુ પરાપ્રાચીન ફિલસૂઝી, કલાના આધારે ઉત્ત્ર રહેવાની ભૂમિકા, કલાના ક્ષેત્રે સધારેલું સામંજસ્ય વળે બાબતો દર્શાવી હિંદુ-મુસ્લિમ સંબંધોની સંકુલતા સ્પષ્ટ કરાઈ છે.

તાજેતરની સદીઓમાં બિટિશારોની શાસકપદેશી થતી રહેલી પદતી, મુસ્લિમોને અકૃતુ બનાવવામાં અને હિંદુઓને છાનેછાને હરખપદ્ધૂરા થવામાં કારણ-ભૂત હતી. હિંદુઓ નવીન ઉન્નેષોને આત્મસાતુ કરવામાં સરખામણીએ વધુ પાવરધા નીવડ્યા જ્યારે નવશાસકો પ્રત્યેની આશંકા અને મંડુકમાનસથી મુસ્લિમો પાછળ રહી ગયા. ગુણવંત શાહ નોંધે છે કે ‘જાતિ વચ્ચે રહેલો આ તક્ષાવત બે કોમોના ઘર્ષણના પાયામાં છે.’

જોકે લેખક આ ગતિના તક્ષાવતને મુસ્લિમોની માનસિક ઊંઘાપ તરીકે ઓળખાવતા નથી ! ‘કોઈ વેત નમે ત્યારે હથ નમે તેનું નામ હિંદુ’ એમ કહી તેઓ કહે છે કે ‘પણ એક હથે તાલી ન પડે.’ આમ તેમને ભય રહેલો છે કે હિંદુઓ આ બાબતે થોડા થાક્યા છે. તેઓનો ભય મિથ્યા છે તેવું ન કહી શકાય પણ મુસ્લિમ-માનસનો ઉછેર એવા પર્યવરણમાં થતો રહ્યો છે કે હિંદુઓએ પહેલ છોડવી ન જોઈએ સમયે આ કર્તૃત હિંદુ વિચારવંતોના શિરે લાદેલું છે. ગુણવંત શાહ ઊંઘાપ નોંધક નર્સા થયેલા લાગે છે આથી ‘ભારતના મુસ્લિમાનોએ મારા જેવા અનેક ઉદારમતવાદી હિંદુઓને નિરાશ કરવામાં સફળતા મેળવી છે.’ એવું ચોંકાવનારું અને નિરાશાવાદી વિધાન કરે છે. આ કથન એમના મુખે ચોંકાવનારું જ નહીં આશર્યજનક પણ લાગે છે કેમકે તેમજો જ અન્યત્ર નોંધ્યું છે કે ‘લઘુમતી અને બહુમતીના પદ્ધતપણા વચ્ચે હરીકાઈ ન હોઈ શકે.’ અને ‘જાહો મુસ્લિમ હોવું એટલે જ ભારતવિરોધી હોવું એવી હવા

ચાલી છે.' આથી જ દેશમાં સૌથી દુઃખી વ્યક્તિ વિચારશીલ અને રાષ્ટ્રપ્રેમી મુસ્લિમ સજજન છે.'

આમ આવી સંતર્પક સમજ ધાર્ઘવવા સાથે શાહબાનો કેસ સામેની પ્રતિક્રિયા કે તે સંદર્ભે કોમન સિદ્ધિલ કોડનો વિરોધ તથા બાબરી મસ્ઝિદ પ્રશ્ને મુસ્લિમ ઉચ્ચાટને સમજવાના બદલે ગુણવંત શાહ આ ત્રણે મુદ્દે મુસ્લિમોને જિહ છોડી દેવા વીનવત્તા જણાય છે. ખરેખર તો શીખોને કેનેદામાં પોલીસ ગજાકેશા સાથે પાછડી પહેરવા દેવા અપાયેલી અદાલતી છૂટથી પોરસાત્ત ભારતીયોને મુસ્લિમ પરસનલલોની જમાનાજૂની અલગ હસ્તીના વિરોધનું કારણ સમજવું અધરું છે. તો પાંચસો વર્ષથી ચાલી આવતી મસ્ઝિદે પાંચ વર્ષથી ઊભા કરાયેલા વિવાદને પુરસ્કૃત કરવું પણ ચર્ચાસ્પદ છે.

જો કે લેખકે સામાન્ય હિન્દુના મનમાં વૈમનસ્ય પેદા કરતા અન્ય પ્રતીક-પ્રસંગો પણ દર્શાવ્યા છે, કેમકે પાડિસ્તાની કિકેટ ટીમના વિજય પ્રસંગે ક્યાંક થતી આતશબાળ, ઓટીખરી પણ હિંદી બોલવાની ગુજરાતી મુસ્લિમોની મમત વગેરે. આ વર્તન સાથે સહમત થવું અધરું પડે પરંતુ અત્યંત સંકુલ એવી આ માનસિક સમસ્યા ખરેખર તો મુસ્લિમ યુવાનોની એક અસ્વિતાની ખોજની, એક આઈડેન્ટિફીકેશનની મથામજ્ઞ છતી કરે છે. પછાતપણ માટે લઘુતાંગંથિ અનુભવતા, આ ગ્રંથિથી સરજાયેલી બિનસલામતીની ભાવનાથી મૂંઝાયેલા નેતાઓથી ગેરમાર્ગે દોરાયેલા અને બહુમતી પાસેથી આધીપાતળી ય તકની સમાનતા મેળવવામાં નિર્ણણ નીવડેલા સામાન્ય મુસ્લિમ યુવાનોનો, અવલંબન માટેનો અંધળોભીત આયાસ આવા વર્તનમાં વક્ત થાય છે. આ પરિસ્થિતિ માટે રાષ્ટ્ર-સમાજના અગ્રવર્ગ, સંપત્ત જૂથોની જવાબદારી પણ ખરી કે નહી તેવું વિચારતાં એમ લાગે છે કે ગુણવંત શાહે આ પ્રશ્નને પૂરો તપાસ્યો નથી.

જો કે લેખક કબૂલે છે કે 'બંને બાજુથી ટપલાં ખાવાનો મને શોખ છે.' આમ કહી તેઓ શિવસેન્પ, આર.એસ.એસ., મુસ્લિમ લીગ અને તેના નેતાઓની અટકણી કાઢવા સાથે હિન્દુ કહૃતરતા, અંધશ્રદ્ધા અને બંધિયારપણા સામે આકોશ વક્ત કરે છે. 'તું અમૃતનું સંતાન છો' એવા વેદવાક્યને

ઉચ્ચારી તેઓ શીખ આપે છે કે 'તતઃ ન વિજુગુપ્તસે' કેમકે વિકાર અને ધર્મ સાથે રહી શકતા નથી.

ઉપરાંત ભારતમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યાના જ સંદર્ભમાં કાશ્મીરમાં પાડિસ્તાનની ભૂમિકા, જેવા મુદ્દે એમણે સામાન્ય લાગણીને વાચા આપી છે, અને 'એકતાયાત્રા' દ્વારા શ્રીનગરમાં ધ્વજવંદન માટેના પ્રયાસોનું સમર્થન કર્યું છે.

સમગ્ર સંગ્રહમાં આમ, એમ. વી. કામઠે પુરોવચનમાં કહ્યું છે એમ, ગુણવંત શાહે ત્રાજવાની દાંડી સમતોલ રાખવાની નેમ રાખી છે. આખરે સમપાનમાં એ જ ચિત્તપર મળી રહે છે કે 'હિન્દુઓને ખ્યાલ જ નથી આવતો કે મુસ્લિમોને ક્યાંક્યાં અન્યાય થાય છે' અને 'ભારતના મુસ્લિમોની મુખ્ય સમસ્યા એ છે કે તેમને ફક્ત મુસ્લિમ-સમસ્યાઓની જ ફિકર છે.' ઉમયપણે સમજદારી ધાર્ઘવવાની આશા ઘણા વિચારવંતોએ પણ છોડી દીધી છે કારણ કે વાઈસના તંત્રી રહી ચૂકેલા કામઠ જેવા પીડ પત્રકાર એમ કહે છે કે 'ઈસ્લામ તાકાતને સમજે છે' આથી '(ન્યાયપૂર્વી) તાકાત સિવાયની વાતો નેવકૂફી છે.'

આ પરિસ્થિતિમાં પણ લેખકનું આશાવાહી કથન કે 'માશાસ આનંદની શોધમાં છે', એ માત્ર સુખવાહી સૂત્ર ન ગણાવું જોઈએ કેમકે, તેમણે દર્શાવ્યું છે કે વિજ્ઞાનનો વિકાસ, શિક્ષણનો પ્રસાર અને પરિણામે સ્વનો પરિચય પામવા મથતી વ્યક્તિઓ થકી સંસ્થાગત ધર્મના સ્થાને વ્યક્તિગત અધ્યાત્મનો ઉદ્ય એ ત્રણ વાનાં, માર્ગસની ખોખલી ધાર્મિકતાને અને તેમાં સમાયેલાં જૂનુન અને જુતાને દૂર કરશે. ઉપરાંત લોકશાહી અને બિનસંપ્રદાયિકતા, કમશઃ મનો-સાંસ્કૃતિક એકતા સર્જશો. ગુણવંત શાહનો આવો વિશ્વાસ આપણા સહુનું શ્રદ્ધાબળ છે.

વિચારવંતો, પોતાની ભૂમિકા સમજ શકે તેવી વ્યક્તિઓ સિવાય વિમર્શ કરતા નથી પણ સજજનોની ચૂપકીદીથી દુરાચાર વધે છે તે ન્યાયે જ્યાંજ્યાં તક મળે ત્યાં વિચારવંતો, સામાન્યજ્ઞની પારસ્પારિક સમજ વધારવામાં 'ઈથર અદ્યા તેરે નામ'ની સામચીનો ઉપયોગ કરે તેવું સમજીને જ લેખકે આ પુસ્તક વિચારવંતોના હાથમાં મૂકેલું છે, એવું મારું માનવું છે. તેમની નેમ સફળ રહો. □

સત્ત્વિ • સંસ્પર્શ • શોધ •

ચિંતન • ચેતોવિસ્તાર

કૃષ્ણવીર દીક્ષિત

રામદેશ પ્રકાશન, અમદાવાદ ૧૯૮૮. પાચેયાં પ. કા.  
(આશ્રે) ૭૦૦, ડિ. ર. ૨૦૦

સમજ સૌન્ધી

## સાહિત્યનુરાગી વિચારશીલ પત્રકારધર્મ

આવક અને પુસ્તક વચ્ચે, વ્યાપકભાવે તો જિજ્ઞાસુ વાચક અને સાહિત્યજગત વચ્ચે, સેતુરૂપ બનવાનાં આમાંણિક વૃત્તિ અને નિષ્ઠાથી તેમજ સાહિત્યકૃતિની ગુણસમૃદ્ધિને પરખનારી સમુદાર રુચિથી સાહિત્યિક પત્રકારત્વનાં વણથંબી આરાધના કરનાર સમીક્ષકોમાં બે નામ સૌથી પહેલાં યાદ આવવાનાં - જવેરચંદ મેધાણી અને કૃષ્ણવીર દીક્ષિત. મેધાણીએ ૧૯૮૫થી મરણપર્યત દોઢેક દાયકો 'જન્મભૂમિ'માં 'કલમ અને ડિતાબ' વિભાગ ચલાડેલો એને, અતુટ રાખવા જ હોય એમ, ૧૯૮૮થી કૃષ્ણવીર દીક્ષિતે 'સંભાળી લીધો પછી ૧૯૮૯થી 'ગુજરાતમિત્ર'માં 'અક્ષરની આરાધના' વિભાગ પણ શરૂ કર્યો. ત્યાંથી માંદીને સાડા ચાર દાયકા સુધી એકઘારી રીતે એમજો અનેક પુસ્તકો અવલોકણાં છે; અંધિવેશનો, ચચ્ચિસત્રો, સેમિનારો, વ્યાખ્યાનોના કાળજીભર્યા સમીક્ષિત અહેવાલો આપ્યા છે; વિવિધ સાહિત્યસમારોહો, પ્રસંગવિરોધો, વિશિષ્ટ ઘટનાઓના જીજાવટભર્યા પરિચય કરાવ્યા છે અને એમ આ આખા સમય-ગાળાની સાહિત્યપ્રવત્તિઓનાં શક્ય બન્યાં એટલાં બધાં સંચલનોને, સ્વકીય નિરીક્ષણો સમેત જીવ્યાં છે, નોંધી આપ્યાં છે. અમના આવા બહુ-ગ્રાહી અને બહોળા લેખનનું, એના વિવેચનમૂલ્યને પછી વિચારી-એ તો પણ, ઐતિહાસિક રે દસ્તાવેજ મૂલ્ય જ કેટલું મોટું ને મહત્વનું છે!

લેખકે પોતાની આ પુસ્તકસમીક્ષાઓમાંથી પસંદ કરીને અને એને સમીક્ષિત ગ્રંથોનાં સ્વરૂપવાર વગ્નિકૃત કરીને ૧૯૮૮માં પાંચ સંગ્રહોનો એક સંપુર્ત (રામદેશ પ્રકાશન દ્વારા) પ્રકાશિત કરેલો એમાં સર્જન અને વિવેચનનાં પુસ્તકોની સમીક્ષા હતી. ૧૯૮૯માં

પ્રકાશિત થતી આ બીજા સંપુર્તમાં વિભૂતિદર્શનકેન્દ્રી અને વિચારકેન્દ્રી ('સત્ત્વિ'), આત્મકથનાત્મક અને ચરિત્રાત્મક ('સંસ્પર્શ'), સંશોધનવિષયક ('શોધ'), અધ્યાત્મચિંતનવિષયક ('ચિંતન') તથા પત્ર-પ્રવાસ-વિષયક ('ચેતોવિસ્તાર') લગભગ દોઢસો પુસ્તકોની સમીક્ષાઓ ગ્રંથસ્થ થયેલી છે.

આ સંગ્રહોના અનુક્રમ પર નજર કરતાં પજ લાગશે કે લેખકે જે પુસ્તકોની અર્ધી પસંદગી કરી છે એમાંના મોટાભાગનાં તો ઉત્તમ કે નોંધપાત્ર કે પછી કોઈ ને કોઈ રીતે ચર્ચાપાત્ર છે. [એમાં 'ભારતીય તત્ત્વવિદ્યા' (ભુખલાલલ્લ), 'પરમસખ્ય મૃત્યુ' (કાલેલકર), 'શોધ અને સ્વાધ્યાય' (હરિવલ્લભ ભાયાણી), 'માલિલાલ નભુભાઈનું આત્મવૃત્તાંત' (સંધીરુભાઈ ઠાકર), 'સહરાની ભવ્યતા' (રધુવીર ચૌધરી) -ને નિર્દેશ નમૂનાદેખે કરી શકાય] સત્ત્વાદીન, નિસ્તેજ કે ડોળઘાલુ પુસ્તકોનાં ટીકા-આલોચનામાં એ પડ્યા નથી. જે વ્યાપકપ્રે સત્ત્વશીલ, સક્ષમ અને આવકારપાત્ર લાગ્યાં એવાં પુસ્તકોનો પરિચય કરાવી આપવાનો સાહિત્યનુરાગી પત્રકારધર્મ એની પાછળ પ્રવર્તતી રહ્યો છે. ઉત્તમના સ્વીકારની સાથે નરસાની આકરી આલોચના પજ કરી આપનારી, સાહિત્યવિદેશકની તારતમ્યરીતિ એમજો પેલા વ્યાપક ધર્મના સંદર્ભે જ, જોરી અજમાવી નથી. વળી, પત્રકાર તરીકે પજ એમજો (મેધાણી વગેરેની જેમ) પસ્તાળ પાડી નથી કે સુધારકનાં તીવ્યાશ-તીવ્યતા દાખવ્યાં નથી.

ખરેખર તો એમની દૃષ્ટિમાં ને રીતિમાં, એમના જુદુ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના જેણું અભિજ્ઞત સૈજન્ય જોવા મળે છે. પ્રાદીકથનમાં એમજો નોંધું છે એમ 'જીવનનો છંદ બની ચૂકેલા સાહિત્યના નિત્યના સંગને પરિણામે' ઉત્તમ જ્ઞાનાયોદ્ધ ગ્રંથોના વાચન-આસ્ત્વાદનની તૃપ્તિના આવેખો જાણો કે એમજો આ સર્વ અવલોકનો દ્વારા આપ્યા છે. એથી એમનાં કેન્દ્રીય રસ-વૃત્તિ તો ગુણગાઢી ને ગુણદર્શી જ રહ્યા છે. આ કારણે, લેખકો માટેનાં મોટાં ગુણવાચી સંબોધનો એમની કલમેથી સહજ રીતે સરી પડે છે - ધુરંધર, મહારાથી, મહાસાક્ષર, બુત્પત્ર, પંડિત, આત્મમશાહીર કવિત્રી વગેરે, ગુણવંત શાહના 'કૃષ્ણનું જાતનસંગીત'ને મારે એ 'મહાગંધ્ય' શાબ્દ પજ

યોજે છે. આમાં, પ્રભાવક નીવડેલા લેખકો પરત્વેનો ધન્યત્વનો ભાવ (જુઓ પ્રાક્કથન - પ્રત્યેકમાં - પૃ. ૬ અને ૭) પ્રતિબિનિત થાય છે એ ખરું, પરનું કોઈને એમનાં તુચ્છ-દૃષ્ટિ જરાક વધુ સમુદ્ધાર ને એમનો ગુણાનુરૂગ જરાક વધુ ઉત્કર પણ જણાય. અલબત્ત, એમાં ક્યાંય ગણતરીભરી કૃતક પ્રશાસ્તી નથી - સારાને એમણો વધુ સારું કહું છે એટલું જ. અપ્રામાણિક ચતુરાઈ ક્યાંય નથી. બધે એમના હૃદયની ને આશયની નિર્મણતા તો પ્રતીત થાય જ છે. વળી એમની આ ગુણદર્શિતા સાહિત્યસમજના વિકલ્પે આવેલી નથી - એમનો સાહિત્યતત્ત્વવિવેક પણ સાબધો તો છે જ, (સર્જનાત્મક ગ્રંથો વિશેના પહેલા સંપુટમાં એનાં ટીકટીક દૃષ્ટાંતો પડેલાં છે, અહીં પણ બેચાર તો જરે છે) જેમકે, કે. કા. શાસ્ત્રીના 'નરસિંહ મહેતો' : એક અધ્યયનને અવલોકનાં એમણો લખ્યું જ છે કે, 'આખરના પ્રકાશમાં નરસિંહની કૃતિએમાંથી અવતરણો જેટલાં વિપુલ સંખ્યામાં લિધાં છે, તેટલું સધન અને તેટલું ઊંડું વિવેચન સાંપડતું નથી.' ('શોધ', પૃ. ૨૦).

કૃષ્ણવીર દીક્ષિતની વિવેચનપદ્ધતિ લાક્ષણિક સર્વગ્રાહી પરિચયની છે: પુસ્તકના મુખ્ય કથયિ-તંત્યને અને લેખકના સૂરને એ બાબત્ર પકડે છે ને એમ એના ઉત્તમાંશોને ગ્રૂથી લેતો સમગ્રદર્શી પરિચય એ કરાવે છે. એમાં દેખાતી આકલનશક્તિ એમનો વિશેષ છે. પુસ્તકનું સાર-સત્ત્વ હાથમાં આવી પડે એવી આ સાર-ગ્રાહિતા ઉપરાંત મૂળ ગ્રંથને વાંચવા પ્રેરે એવાં આસ્વાદકતા અને પ્રત્યક્ષતા પણ એમના લેખનનો વિશેષ બને છે. એમણો જ લખ્યું છે એમ 'ગ્રંથના પરિચયનું દાર ઉઘાડવાના એક વિનિમ્ય પ્રયાસ' ('ચિંતન', પૃ. ૫૩) લેખે એમનાં આ સર્વ અવલોકનોનું મૂલ્ય સ્વયંસ્પષ્ઠ અને મહત્વનું છે.

આમ છતાં, કૃષ્ણવીરનું કામ કેવળ પત્રકારી નથી. પર્યોગશાના કે ચિકિત્સાના અંશો એમના આ વિવેચનમાં ભલે નથી પણ આગવાં કહી શકાય એવાં સુચિંતિત નિરીક્ષણો એમાં જરૂર જરૂરવાનાં. ઉપરાંત, આ સંપુટમાંનાં દોઢસ્થોએ અવલોકનો ચિંતન-વિચારનાં, કેટલાંક તો ઊંડા ચિંતનનાં, છે એ પણ કેવળ પત્રકારી સુકરતાને જ એ સેવતા રહ્યા નથી એ બતાવે છે. ખરેખર તો કૃષ્ણવીર પોતે જિજાસુ

વિચારક છે ને સર્જન-વિવેચન-ચિંતનના ગ્રંથોનાં અવલોકનોમાં એમની મૂલ્યનિષ્ઠ વિચારશક્તિનો પરિચય પણ સમાનતર મળતો જ રહે છે.

એમનાં લખાણોમાં વીગતોને જાળવવાની ચોકસાઈ જોવા મળે છે. પુસ્તક અને લેખકના આસપાસના ઐતિહાસિક ને તથમૂલક સંદર્ભોને એ અવલોકનોમાં વણતા રહ્યા છે એટલે એક આશ્રય એ થાય છે કે આ સંગઠના સર્વ લેખોને અંતે અપાયેલી તે તે પુસ્તકની લગભગ બધી જ જરૂરી વીગતોમાં, એના પ્રકાશનવર્ધની અત્યંત મહત્વની વીગત મૂકવાનું એ (કે એમના પ્રકાશક ?) કેમ ચૂકી ગયા હો ? એ જ રીતે આટલા બધામાંથી બહુ જ થોડા લેખોને છેડે લેખન/પ્રકાશનની તારીખો નોંધેલી છે - અને એ પણ એટલી બધી છૂટીછવાઈ રીતે આવી છે કે જાણો સરતચૂકથી જ રહી ગઈ હોય ! ખરેખર તો લેખોના પૂર્વપ્રકાશનની પૂરી વીગતો (ક્યાં ને ક્યારે પ્રકાશિત થયો એ) મુકાવી જોઈએ તો એક સ્પષ્ટ આલોખ ઊપરે એનું દસ્તાવેજ મૂલ્ય પણ ઓછું નથી.

એવી જ એક બીજી અ-સંગતિ નજરે પડે છે. 'સંસ્કૃતિ' સામયિક વિશે ('સંસ્પર્શમાં') વીસ પાનાંનો એક સમૃદ્ધ લેખ છે. પણ પુસ્તકસમીક્ષાના ગ્રંથોમાં એ આગંતુક લાગે છે. એનું જ, 'ચિંતન'માં કાલેલકર વિશેની બે નાની નોંધો પણ આગંતુક લાગે છે. ઉમાશંકર અને કાલેલકરના સમગ્રદર્શી પરિચયના આશયથી, એમનાં પુસ્તકોની સમીક્ષા સાથે, આ લેખ પણ મુકાયા હોવાનું સમજાય છે. પણ આ પ્રકારના, લેખકો-સામયિકો-પ્રવૃત્તિઓ વિશેના, ઘણા સરસ લેખ કૃષ્ણવીરે કરેલા જ છે. એનું પુસ્તકરૂપે પ્રકાશન થાય ત્યારે એમાં આ લેખોનો સમાવેશ સંગીતપૂર્ણ બની શકે.

એમનું ઘણું લેખન હજુ ગ્રંથસ્થ થતું બાકી છે. એમણો કાળજીપૂર્વક વિભાગવાર એની ફાઈલો બનાવી છે ને જતનથી જાળવી છે. એ લેખન-રચિતમાંથી પણ એમની જ પસંદગીપૂર્વકનાં લખાણો - આવા જ વર્ગીકૃત સ્વરૂપે - પ્રકાશિત થવાં ઘટે.

આ - અને અગ્રાઉના - સંપુટના પ્રકાશન માટે હંમેશ મોદીને અત્યનંદન આપીને પણ એટલું તો કહેવાનું રહે જ છે કે આ પ્રકારનાં પુસ્તકોનું નિર્માણ

(અનાં મુખપૃષ્ઠ અને લે-આઉટ) એની ગંભીર વિષયસામગ્રીને અનુરૂપ, વિશેષ ગૌરવયુક્ત ને વધુ સુધુડ થતું જોઈતું હતું, અલબજ્ટ, એમની સામે તો હજુ ઘણી તકો છે ને એમાંની એક તક તો હજુ ખુદ કુષ્ણાવીર આપી શકે એમ છે !



## ગુજરાતી સાહિત્યવિવેચન

### જ્યંત કોઠારી

પ્ર. લેખક, અમદાવાદ, વિ. ગુજર સાહિત્ય ભવન,  
આર. આર. શેઠની કંપની, ૧૯૮૪, કા. ૧૮૪, રૂ. ૫૦

### વિજય શાસ્ત્રી

### માર્ગિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ

ગુજરાતી વિવેચન વિશે રમૂજમાં એમ કહીએ કે વિવેચન મૂળે તો લખાવનારો લખતો હોય છે જેણા પર વિવેચક સહી કરતો હોય છે. પોતાના પુસ્તકનું અવલોકન કરાવનારા લેખકે પોતે જ મનોમન પોતાના પુસ્તકનું મનભાવંત વિવેચન કરી લીધું હોય છે અને પછી બીજા અવલોકનકારો અને જ શબ્દફેરે પોતાની સહી સાથે લખે એવી પ્રબળ અપેક્ષા તેમના પર સવાર થતી રહે છે, પરિણામે પોતે મનમાં લખેલા વિવેચનથી સામ્યો જુદ્દો પડે તો આવી બન્યું સામાનું ! આપટી વાત અહીં બધારથી અપ્રસ્તુત લાગે તેમ છે પણ જ્યંત કોઠારીના સંદર્ભે તે અત્યન્ત પ્રસ્તુત છે કેમ કે ગુજરાતી વિવેચનના ક્ષેત્રે જે વિરલ તટસ્ય અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિવેચન કરનારા બાકી બચ્યા છે તેમાંના તેઓ એક છે.

આ પુસ્તકમાંની સામગ્રી પૂર્વ ચિહ્નથી રીતે પ્રકાશિત થઈ ચૂકી છે જેની વિગતો પૃષ્ઠ ૧૬૫ ઉપર 'લેખો વિશે' મથ્થણા તળે મળશે. એ જોતાં અહીં તે એકનિત કરીને ફરી પ્રગત કરી છે તેને જરૂરી સગવડ ગણી શકાય. પ્રારંભનાં લગભગ ૮૮ પાનામાં ગુજરાતી સાહિત્યવિવેચનનો ઈતિહાસ મેળે છે. 'વિકાસ' 'ઈતિહાસ' 'સીમાચિહ્નો' જેવા શબ્દપ્રયોગો હવે તો ચર્ચિતોક્તિ બની ગયા છે પણ તેનો કોઈ સબળ વિકલ્પ જરૂર નહીં ત્યાં સુધી તેનાથી જ કામ ચલાવતું પડે.

જ્યંત કોઠારીના મતે મધ્યકાલમાં શામળા-અખા જેવા કવિઓ પાસેથી કવિવાણી વિશે કેટલાક ઉદ્ગારો પ્રામ થાય છે પણ ત્યાં 'કશે સાહિત્યનો સંદર્ભ નથી' (પૃ. ૨) તેથી તેને તેઓ વિવેચન ગણતા નથી. ત્યાર પછી અવાર્યીનું નમદિ-નવલરામના વિવેચનને તપાસતાં તેમની વિચારણામાં કયાં અને કેમ અપૂર્ણતાઓ તેમ જ તકદ્દોષો પ્રવેશી ગયા છે તેની દાખલાઓ ટાંકીને ચર્ચા કરી છે. મૂળ પુસ્તકમાં જિજ્ઞાસુને એ જોવા મળે તેમ છે છતાં નમૂના દાખલ નિનવિભિત નિરીક્ષણ ટાંકી શકાય :

કાવ્યના મૂળમાં કવિસંવેદન હોય છે એ મહત્વની હકીકતને નમદિ યોગ્ય રીતે આગળ કરી આપી છે. પરંતુ એ સંવેદન કયા પ્રકારનું હોય છે અને એમાંથી કાવ્યનો ધાર કઈ રીતે ઉત્તરે છે - બીજા શબ્દોમાં કહીએ તો ભાવ રસમાં કઈ રીતે પરિણામે છે - એનો તથા એમાં કલ્યાણવ્યાપાર કઈ રીતે ભાગ ભજવતો હોય છે તેનો વિચાર નમદિ - કે નવલરામે પણ - કયો જણાતો નથી.' (પૃ. ૫).

ટૂંકમાં કાવ્યસર્જનની સમગ્ર પ્રક્રિયાના વિવિધ તબક્કાઓની ચર્ચા નમદિ (અને નવલરામમાં પણ) જુદી નથી એવા લેખકના મત સાથે સંમત થઈ શકાશે.

પછી નવલરામની વાત કરતાં લખ્યું છે 'નવલરામ કેવળ જોસ્સા કે ભાવ કે રસને આધારે કાવ્યનું મૂલ્યાંકન નહીં કરતાં એની રચનાકળા અને એની સુભદ્રિષ્ટ અખંડ છાપ પર ભાર મૂકે છે !' (પૃ. ૬)

અહીં હું ઉપરનાં બંને અવતરણોને સાથે મૂકી જોઉં છું ત્યારે બીજા અવતરણમાંનો નવલરામનો રચનાકળાનો આગ્રહ એક વાત અને રચનાકળાની તપાસ એ બીજા વાત હોવાનું સમજાય છે. એટલે કે નવલરામ રચનાકળા જેવી બાબત પ્રત્યે સભાન છે ખરા, પણ એનો અભ્યાસ એમણે આપ્યો નથી એ ફિલિત થાય છે. રમણભાઈ નીલકંઠનો કાવ્યનો ઊર્ભિ સાથેના સંબંધનો આગ્રહ કયાં અને કેમ એકાંગી બની જાય છે તે દર્શાવી તેમાં પ્રગટ્યી સૂક્ષ્મ અસંગતિઓ એમણે પકડી પાડી છે અને રમણભાઈના કાવ્ય-વિવેચનમાં રહેલી એકાંગિતપાનું નિરસન આનંદશંકર વડે કઈ રીતે થયું તેની ચર્ચા 'કાવ્યમાં લૌંગિક લાગણીનું કઈક રૂપાંતર થાય છે એ આનંદશંકર

પકડી શક્યા છે' (પૃ. ૧૭) એ વાક્યથી અત્ત પામતી વીગતોમાં - સરસ થઈ છે. બળવંતરાય ઠાકેરના વિચારપ્રધાન કવિતાના આગછને - સંપત્તયને - એમજો વિગતે તપાસ્યો છે. 'વિચાર'નો અર્થ કોઈક સર્જકવ્યાપાર કે કલાકૃતિનો રચનાગત અંશ એવો એમને લાગે છે. 'આમ, 'વિચાર' એ કાવ્યનો વિધાયક આયોજક કલાવ્યાપાર બની રહે છે' (પૃ. ૨૮) એમ નોંધ્યા પછી ખુદ બળવંતરાય પોતે પણ કંઈક જુદા અને રૂઢ, સપાટ અર્થમાં જ વિચારને મૂર્ત કરતી રચનાઓ આપે છે એટલું જ નહીં ત્રીશીના બળવંતરાયપ્રભાવિત કવિઓએ પણ બળવંતરાયને અભિપ્રેત 'વિચાર'નો જે અર્થ હતો તેને જાઓ સેવ્યો કે પ્રગતાવ્યો નથી તે હકીકતની નોંધ એમજો લીધી છે તે જોતાં આધ્યાત્મિક વિચારનો આપેલાં જે ૧૯૫૦માં 'Studies in Gujarati Literature' નામે પુસ્તકરૂપે પ્રગટ થયાં એ જમાનામાં (અને આજે પણ) એમાંનાં અનેક નિરીક્ષણો તોકની છતાં ખાસ્યા વજૂદવાળાં લાગે તેમ છે. તેની નોંધ લેવાઈ હોત તો આપણી ગતાનુગતિક વિવેચનામાં ચીલો ચાતરીને ચાલનારા એક (માત્ર) અવાજની નોંધ લેવાઈ હોત.

૧૯૨૦ પછીના રામનારાયણ પાઠકના વિવેચના વિવિધ અને મહત્વના અંશોનું વિવરણ અહીં થયું છે. જેમાં 'રહસ્ય' સંશા, વ્યવહાર અને તેનાથી પર એવો કલાવ્યાપાર ઈત્યાદિની સ્પષ્ટતા કરી છે. 'બે ધૂવો વર્ચ્યેનો વિસ્તાર' શીર્ષકથી આરંભાત્મા પાંચમા વિભાગમાં તત્કાળે સળગતી ગણ્યતી 'પ્રગતિવાદ'ની ઉમાશંકરીય ચચ્યથી શરૂઆત થઈ છે અને કાવ્યસર્જન વિશેના વિચારોનો હવાલો આપીને જયંત કોઈારી એટલું વિધાન કરવા ઉદ્ઘત થયા છે કે 'ઉમાશંકરની સાહિત્યવિચારણામાં મૌલિકતા કે અસાધારણતા છે એમ ભાગ્યે જ કહી શકાય' (પૃ. ૫૮). આ ઉપરાંત સાહિત્ય અને સમાજનો જે સંબંધ શરૂની વિવેચનામાં ઉમાશંકરમાં દેખાય છે તે પાછળથી તૂટવાની અણી પર પહોંચે છે પણ તૂટતો નથી. આમ ઉમાશંકરના વિવેચના અંતરવિરોધો એમજો સમુચ્ચિત રીતે દર્શાવ્યા છે. સુરેશ જોખીની રૂપનિભિત્તિની વિભાવનાને એમજો સુરેશભાઈનાં જ અવતરણો વડે મૂર્ત કરી છે. અધ્યતન વિવેચનાએ કૃતિલક્ષી વિવેચનાનો જે મહિમા કર્યો અને કૃતિની સ્વાપ્યત સત્તા પર જે ભાર મુકાયો તેનો નિર્દેશ કર્યા પછી 'આ વિશ્વેષણાત્મક વિવેચનની દિશામાં કોઈ નક્કર ભૂમિકા આપણે ખરેખર કેટલી પ્રામ કરી છે તે વિચારવા જેવું છે' (પૃ. ૭૫) જેવી શંકા

એમને રહે છે અને તેનું કારણ પણ તેઓ વિસ્તારથી ચર્ચે છે. પૃ. ૭૫-૭૬-૭૭ પર તેની વીગતો જોઈ શકાશે. પરિશિષ્ટામાં મુકાયેલો 'ગાંધીયુગનું વિવેચન' લેખ આકાશવાણીના વાતાવાપરૂપે લખાયો હોઈ તેની લખાવટ અને ચચ્યાનું ધોરણ તદ્દનુરૂપછે. ગુજરાતી વિવેચનનો અત્યાર સુધીનો આ આલોખ છે એમાં જેહાંગીર એદલજી સંજાના જેવા વિલક્ષણ વિવેચકનો ઉદ્દેખસરખો નથી એનું અચરજ થાય છે. તેમજો ૧૯૪૨માં મુંબઈ યુનિના ઉપકમે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો આપેલાં જે ૧૯૫૦માં 'Studies in Gujarati Literature' નામે પુસ્તકરૂપે પ્રગટ થયાં એ જમાનામાં (અને આજે પણ) એમાંનાં અનેક નિરીક્ષણો તોકની છતાં ખાસ્યા વજૂદવાળાં લાગે તેમ છે. તેની નોંધ લેવાઈ હોત તો આપણી ગતાનુગતિક વિવેચનામાં ચીલો ચાતરીને ચાલનારા એક (માત્ર) અવાજની નોંધ લેવાઈ હોત.

કાલેલકરના વિવેચનનું મૂલ્યાંકન કરતાં તેઓ શરૂમાં જ જણાવી દે છે કે 'કાકસાહેબની દૃષ્ટિ... બહુધા શાસ્ત્રીય વિવેચકની નહીં પણ સંસ્કારસેવક - કેળવણીકારની રહી છે' (પૃ. ૮૮) આમ હોવા છતાં તેમનામાં કણાસૂઝની માત્રા નોંધપાત્ર બને છે તેની દાખલાઓ સાથે વાત થઈ છે. સૌન્દર્યનુભવમાં તટસ્થતાના પ્રકારો વિશે કાક અને મંજરીના પ્રસંગનું ટાંકેલું દૃષ્ટાંત એમની સૂક્ષ્મ અને તર્કપૂર્ત સિદ્ધાન્તચચ્ચનો સુનદર નમૂનો બને છે, તે જ પ્રમાણે મેધાણીની વિવેચનપ્રવૃત્તિને તેનો આગવો ડેતું છે, આગવી રીતિ છે અને આગવું પરિમાણ છે તે સ્વીકારવા છતાં તેની ઈષ્ટતા લેખક સર્વાંગે સ્વીકારતા નથી તેની પાછળ વિવેચનમાં હોવી જોઈતી શાસ્ત્રીયતા અને વૈજ્ઞાનિકતાનો, સિદ્ધાન્તલક્ષિતા અને તર્કપૂર્તતાનો તેમનો આગછ કરે છે, આવા આગછ વડે તેઓ નોંધોપ ફાયના વૈજ્ઞાનિક વિવેચનના આગછની ઘણી નજીક જાય છે તે મને બહુ જ મહત્વની વાત લાગી છે. 'રસાળ' વિવેચનને નામે જે ફંકાફંક ચાલે છે તે આ પ્રકારની શિસ્ત વડે જ અટકી શકશે. વાચનરસ કેળવવા માગતા મિત્રને મેધાણીએ આપેલા માગદર્શનમાં વાતાવાસિત્ય કરતાં વધુ વિવેચન, નિબંધ, કાવ્ય, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, ઈતિહાસ જેવા લખિતેતર શાનની સામગ્રીથી શાનકોશને, પુછ

કરવાની મેધાણીની સલાહ જ્યંત કોઠારીને શિરોમાન્ય બને છે. એ જમાનામાં આવી સલાહ જરૂરી હતી તો આજે સૌથી વધુ જરૂરી છે. મેધાણીની સાહિત્યરૂપિ 'ઉદાર' (પૃ. ૧૪૨) કયા કારણે કહી શકાય અને 'સૂક્ષ્મ' (પૃ. ૧૪૩) કયા કારણે તેની વીગતે થયેલી ચર્ચા રસપ્રદ છે અને સૂચક પણ છે. વિવેચક ભૂગુરાય'વાળો વેખ બહુધા ભૂગુરાયનાં કાન્તવિષયક જીવાં સંશોધનોને આગળ કરી ભૂગુરાયની મર્મગ્રાહી અને પર્યાષક વિવેચનાનું દર્શન કરાવે છે. કાન્તમાં કાલ્યો વિશે વીગતે કામ કરનાર ભૂગુરાયે કાન્તના ગાંધ વિશે ખાસ કશું પ્રદાન કર્યું નથી તેની નોંધ લેવાઈ છે. વીગત-પ્રચુરતા રસદર્શનની વિરોધી બનતી નથી તે પણ ભૂગુરાયનો એક મોટો ગુણ એમણે નોંધ્યો છે એટલે જ એક સરસ વિધાન નિર્ધાનરૂપે મળે છે કે 'ભૂગુરાય તથયશોધની ખાતર તથયશોધમાં અટવાયેલા વિવેચક નથી. એમની દૃષ્ટિએ તથનું મૂલ્ય દર્શન રચવામાં છે અને દર્શન રસશત્તાને સાચી દિશા આપે છે.' (પૃ. ૧૫૧) અહીં સમગ્ર પુસ્તકમાં પણ જ્યંત કોઠારીની ગતિ તથ્યોથી શરૂ થઈ મૂલ્યમાં થઈ રસશત્તા સુધી પહોંચે છે એની સુખદ પ્રતીતિ કોઈને પણ થઈ શકશે. □

### અખાજીકૃત 'ચિત્તવિચારસંવાદ'

સં. કીર્તિદા જોશી

પ્ર. લેઝક : વિ. ગૂર્જર સાહિત્યભવન, અમદાવાદ, ૧૯૮૨.  
પૃ. ૨૭૮ રૂ. ૮૦

પ્રમોદકુમાર પટેલ

### ઉંચી ગુજરાતીવાળું સંશોધનકાર્ય

મધ્યકાલીન ગુજરાતીની શાનમાર્ગી કવિતાધારામાં તત્ત્વવિચારના કવિ લેખે અખાજીનું ઘણું વિરલ સ્થાન છે. પ્રાચીન ડેવલાદૈતની વ્યાપક ભૂમિકા તેમના સાહિત્યમાં વિસ્તરી રહી છે : જો કે પરંપરાની બીજી કેટલીક દાશનિક વિચારણાઓ અને ભક્તિભાવનાના અમુક સંસ્કારોથ એમાં જોડાયેલા જોવા મળશે. તેમની 'પંચીકરણ' 'ગુરુશિષ્યસંવાદ' 'ચિત્તવિચારસંવાદ' 'અનુભવબિનિદ્ર' અને 'અખેગીતા' જેવી

તત્ત્વવિચારથી પ્રેરિત દીર્ઘ રચનાઓ, ઉપરાંત તેમના છ્યાઓ પછો આદિ પ્રકીર્ણ રચનાઓ, પ્રશિષ્ટ સાહિત્યનું ગૌરવ ધરાવે છે; અને આપણા મધ્યકાલીન સાહિત્યનો મોંઘોમૂલો વારસો બની રહે છે. એ કૃતિઓના સંકલનમુદ્રણની પ્રવૃત્તિ અર્વાચીન સમયમાં આપણા કેટલાક અભ્યાસીઓ દ્વારા આરેભાઈ પણ છે. પણ કઠોર શિસ્તબદ્ધ સંશોધન-સંપાદનનો લાભ, તેમની બે કૃતિઓ 'અનુભવબિનિ' અને 'અખેગીતા' ઉપરાંત છ્યાઓ અને પદોના સંગ્રહોને જ મળ્યો છે. આ પરિસ્થિતિમાં કીર્તિદા જોશી દ્વારા અખાજીની 'ચિત્તવિચારસંવાદ' જેવી એક ઘણી મહત્ત્વની કૃતિનું આ સંશોધન-અધ્યયન ઘણું ધ્યાન-પાત્ર બની રહે છે. 'ચિત્તવિચારસંવાદ'ની અવિકૃત વાચના તૈયાર કરવાની, અને તેનું સમીક્ષાત્મક અધ્યયન રજૂ કરવાની, તેમની સંનિષ્ઠ પ્રવૃત્તિ, આજના આપણા સંશોધનની ચિત્પાયેરક સ્થિતિમાં, એક મોટી આશાસનદારી બાબત વેખાય.

અખાજીની આ કૃતિનું સંશોધનસંપાદન, આમ તો ગુજરાત યુનિવર્સિટીની પીએચ.ડી.ની ઉપાધિ અર્થે હાથ ધરેલું કામ છે : પણ ઘણી ચીવટ અને ચોકસાઈ ભરી શોધવૃત્તિને કારણે અને ઉંચી ગુજરાતી પ્રામ થઈ છે. ગુજરાતની સાહિત્ય પરિષદે હાથ ધરેલા સાહિત્ય-કોશના પ્રોજેક્ટમાં સહયકસંશોધક તરીકે શોધ-પ્રવૃત્તિમાં - ખાસ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શોધકાર્યનો જે મૂલ્યવાન અનુભવ તેમને મળ્યો હતો તે આ કૃતિના સંશોધન-અધ્યયનમાં સીધો ઉપકારક બન્યો. હોય, તેમાં કશું આશ્વર્ય કરવા જેવું નથી. પણ, એથી ય કદાચ વધુ મહત્વની બાબત એ છે કે, તેમના માર્ગદર્શક જ્યંત કોઠારીનો મધ્યકાલીન સાહિત્યનો વિશ્લેષણ અભ્યાસ અને મધ્યકાલીન સાહિત્યના સંશોધનના કૂટ પ્રશ્નો વિશેની તેમની ઊરી સમજ તેમને સાંદ્રંત માર્ગદર્શક બન્યાં છે. સંશોધન-કાર્ય અર્થે જ્યંત કોઠારીએ સ્વીકારેલા ઉચ્ચ આદશો અને કઠોર શિસ્ત, આ સંશોધકના શોધકાર્યમાં ઊજણું પરિણામ લાવે છે, એમ કહેવું જોઈએ.

'ચિત્તવિચારસંવાદ'ના સંપાદિત પાઠની પૂર્વ કીર્તિદા જોશીએ અખાજીના જીવનકવન વિશે, તેમ એ કૃતિ વિશે, વિસ્તૃત અધ્યયન રજૂ કર્યું છે. એમાં પ્રતપરિચય અને પાઠસંપાદનની પોતાની પદ્ધતિ અંગે

ય રજૂઆત કરી છે. પ્રસ્તુત કૃતિની તત્ત્વવિચારણાના અનુબંધ રૂપે સંક્ષિમ એવી ભારતીય દર્શનોની ભૂમિકા ય આપી છે. તો, સંપાદિત પાઠને અંતે શબ્દકોશ અને પારિભાષિક તેમજ પૌરાણિક કોશ પણ સમાવ્યાં છે. ટ્રૈકમાં, કૃતિની અધિકૃત વાચના અને કૃતિના દાશનિક-કાલ્યાત્મક અંશોનું અધ્યયન - એમ બંને ય અભિગમથી આ કામ ઉપાડ્યું છે, અને અખાળના વિશાળ સાહિત્યના આવશ્યક સંદર્ભો વચ્ચે તેનું મર્મધટન કરાવવાનો પ્રશ્નસ્ય પ્રયત્ન કર્યો છે.

આ કૃતિની બાર જેટલી હસ્તપ્રતો તેમને જાણવા મળી, તે પૈકી આઈ પ્રતો તેમને ખપમાં આવી છે. એ મુદ્રિત કૃતિઓ ય તેમણે ધ્યાનમાં લીધી છે. હસ્તપ્રતોમાં યોગીન્દ્ર ત્રિપાઠી, વડોદરાની પ્રત કમાંક ૨૪, અને ભો. જે. વિદ્યાભવન અમદાવાદની પ્રત કમાંક ૫૨૬, તેમને વધુ શ્રેદ્ધ્ય પ્રતીત થઈ છે. આ બંને પ્રતો બાકીની ૬૭ પ્રતોને મુકાબલે વધુ 'ચોખ્ખા' પાઠો આપે છે, એટલું જ નહિ, 'કેટલાંક ચાવીઝુપ સ્થાનોએ' એમાં 'ખરા પાઠો' મળે છે એવું તેમનું અવલોકન રહ્યું છે. આ બેમાંય ક પ્રત (વડોદરાવાળી પ્રત કમાંક ૨૪)ને તેમણે મુખ્ય પ્રત તરીકે નિશ્ચિત કરી લઈ અન્ય પ્રતોના પાઠભેદો નોંધવાનું સ્વીકાર્યું છે. જો કે સંશોધકના મતે ક પ્રત પણ સો ટકા પ્રમાણભૂત નથી જ : એમાં કેટલેક સ્થાને સ્પષ્ટપણે લેખનદોષો રહી ગયા છે. અને એવા સ્થાને મુખ્ય પ્રતના પાઠને છોડી દેવો પડ્યો છે. પણ, એકદરે, એ પ્રતને જ મુખ્ય આધાર ગણ્યાને તેઓ ચાલ્યાં છે. અખાળની કૃતિના સંપાદનમાં વળી જોડણી અનુસ્વાર આદિની અરાજકતાને કારણે પાઠની ભાષામાં વ્યવસ્થા આણવાના ઘણા જટિલ કોયડાઓ પણ ઊભા થતા રહ્યા છે. એ સંદર્ભે જોડણી વિષયક કેટલાક નિષ્ણયો ય તેમને લેવાના આવ્યા છે. પાઠસંપાદન અંગે તેમણે આ રીતે જે ચોકસાઈ અને ચીવટાઈભયો અભિગમ સ્વીકાર્યો તેનું મારે મન મોહું મૂલ્ય છે.

પ્રાસ્તાવિક અધ્યયનમાં અખાના જીવનચરિત્રને લગતી વિગતો રજૂ થઈ છે. એમાં કોઈ નવી શ્રેદ્ધ્ય માહિતી ઉમેરતી નથી. પણ પ્રચાલિત જનશુદ્ધિઓની કઠોર તર્કપ્રાણિત ચકાસણી તરત ધ્યાન જેંચે છે. જનમસ્થાન, કુટુંબ, શાસ્ત્ર, શિક્ષણ, ધર્મમાર્ગ, ગુરુ-સ્વીકાર જેવી બિલકુલ પાયાની બાબતોમાં ય

પ્રચાલિત ઘ્યાલો ઘણા જુદા પડે છે. સંશોધકે આવી પ્રચાલિત શુદ્ધિઓમાં કશું તથ્ય છે કે કેમ તે અંગે સધન ચકાસણી કરી છે. અખાળની કૃતિઓના રચનાકમ અંગેય એ રીતે ચર્ચા હાથ ધરી છે.

'ચિત્તવિચારસંવાદ' કુલ ૪૧૧ કરીઓની સંણંગ રચના છે. એમાં અખાળની મુખ્ય વસ્તુ તે આત્માના મુક્તિ કે આત્માનું સ્વસ્વરૂપનું જ્ઞાન છે. પણ પોતાનું વક્તવ્ય તેમણે અહીં 'ચિત્ત' અને 'વિચાર' - પરમ બ્રહ્મના જ બે લિન કેટિના આવિષ્ણારો - વચ્ચેના સંવાદરૂપે રજૂ કર્યું છે. અખાળએ 'ગુરુશિષ્યસંવાદ' શીર્ષકની સંવાદરચના કરેલી છે. પણ, હકીકતમાં, સંવાદકૃતિ એક સ્વતંત્ર રચના રૂપે કે કોઈ દીઘ કૃતિના અંગરૂપે આપણા પ્રાચીન મધ્યકાલીન સાહિત્યમાં એક મહત્વપૂર્ણ પરંપરા બની રહે છે. શ્રીમદ્ ભગવદ્ગીતા એ પરંપરામાં એક અનુપમ સર્જન છે. અખાળએ 'ચિત્ત' અને 'વિચાર' વચ્ચે રચેલો સંવાદ એ પરંપરા સાથે અનુસંધાન કેળવે છે. 'ચિત્ત' અને 'વિચાર' વચ્ચેના સંવાદોનું મર્મગ્રાહી અવલોકન કરતાં જણાશે કે આ કોઈ જડ સ્થિતિચુસ્ત 'કરણો' કે 'સાધનો' નથી, બંને પરમ ચૈતન્યનાં જ લિન સ્કુરણો છે. બંને જે રીતે સંવાદ ચલાવતાં રહે છે, તેમાં તો 'ચિત્ત' માયા કે અવિદ્યાના આવરક નીચે ઢંકાયેલું પરમ બ્રહ્મનું સ્કુરણ હોવાનું સ્પષ્ટ થાય છે. 'ચિત્ત' પોતાના સંશયો રજૂ કરે છે, ગુંચવણાભર્યા પ્રશ્નો કરે છે, અને 'વિચાર' તેનું નિરાકરણ કરે છે. આ 'ચિત્ત' તે ખરેખર કોઈ એક દેહધારી જીવનો વૈયક્તિક ચિત્તાભાવ નથી : વિચની રચનામાં પરમ બ્રહ્મ જે સંકલ્પ દેહ ધારણ કર્યો તે વૈશિક ચિત્ત છે. બીજી બાજુ 'વિચાર' એ કોઈ તર્કજન્ય વિચાર નહિ, પિંડ અને બ્રહ્માંડના દૈતને અતિક્રમી જતી નિર્મિત પ્રજાદૃષ્ટિ માત્ર છે. એક રીતે, 'ચિત્ત' અને 'વિચાર' વચ્ચેનો સંવાદ એ કોઈ સાધકના આત્મામાં ઊઠતા સંશયો અને નિરાકરણનું સૂક્ષ્મ નાટ્યસ્વરૂપ માત્ર છે.

સ્વસ્વરૂપના જ્ઞાનની આ સાધના સાથે, ખરેખર તો પરંપરાનાં દર્શનોમાં મુક્તિના ભિત્રભિત્ર માર્ગો કે સાધનોના પ્રશ્નો જોડાઈ જાય છે. અખાળ અહીં, સાંખ્ય યોગ વૈશેષિક ન્યાય મીમાંસા આદિ દર્શનોમાં મુક્તિ વિશે જે ઘ્યાલો રજૂ થાય છે. તેની સમીક્ષા ય સંક્ષેપમાં ગુંધી લે છે. ઈશ્વર અને પરમ બ્રહ્મ વચ્ચે ય

સૂક્ષ્મ ભેદ કરે છે. ગુરુ અને બહા વચ્ચે ય તત્ત્વિક ઐક્ય દર્શાવે છે. અખાજીની વિચારણામાં સ્થાન પામેલા અન્ય દર્શાના સંસ્કારો તેમની આ તત્ત્વચર્ચાને કઈક વિશિષ્ટ મરોડ પણ અપે છે. જેમકે, જૌડપાદચાર્યના 'અજાતવાદ'નો આ સંવાદમાં અમૃક પ્રભાવ છે. સંશોધકે એ પ્રભાવ શોધી બતાવ્યો છે. કહી ૧૭૪ની સમજૂતી એ પ્રભાવનો સુપેરે નિર્દેશ આપે છે. સંવાદની તત્ત્વચર્ચામાં પડેલા કેટલાક મુદ્દાઓ છપ્પાઓ કે અન્ય કૃતિઓમાંથી સંદર્ભો આપી સ્પષ્ટ કર્યા છે. જો કે અખાજીનો માર્ગ કોઈ ચુસ્ત તાર્કિક ચિંતનનો નથી. જે કંઈ પરમ જ્ઞાનની પોતાને અંગી થઈ તેનું તેઓ સહજ ચિન્તાત્મક બયાન આપવા પ્રેરાયા છે. એમાં ચિંતનના કેટલાક તંતુ છૂટા રહી જતા દેખાશે, ક્યાંક ઉપલક નજરે વિચારની ગૂંચ પણ લાગશે, પણ તેમના સમગ્ર ચિંતનમાં દૃઢ પ્રતીતિનું બળ વરતાય છે, પ્રતિભાનો સહજ ઉદેક છલકાય છે.

‘ચિત્તવિચારસંવાદ’માં અખાજી પોતાના ચિંતનને લગભગ સતત રીતે મૂર્ત ચિન્તોરૂપે વર્ણવિવા પ્રવૃત્ત થયા છે. પોતાના વિશાળ અનુભવ અને જ્ઞાનના ભંડારમાંથી તેઓ સમુચ્ચિત દૃષ્ટાંતો લઈ વસ્તુ-વિચારને વેધક બનાવી દે છે. આવાં દૃષ્ટાંતોના પ્રસ્તુતીકરણમાં તેમની કવિપ્રતિભાની ઘૃતિ ચમકી ઉઠે છે. અહીં કેટલીક કરીઓમાં વિચારતત્ત્વની પ્રૌઢિ અને ગહરાઈ ઉપનિષદ્ધની વાણી જેવો રણકો જગાડે છે. કહી ૧૮૪-૧૯૦ની વસ્તુવર્ણના એ દૃષ્ટિએ ખાસ ઉદ્દેખનીય છે.

સંશોધક કૃતિદા જોશીએ પાઠસંપાદન પૂર્વે પ્રસ્તુત કૃતિનું જીણવટભર્યું અધ્યયન રજૂ કર્યું છે તેમાં અગાઉ નિર્દેશ કર્યો છે તેમ કૃતિના ચિંતનનો મર્મ પકડવામાં સહયોગી થાય એ રીતે પ્રાચીન ભારતની દાશનિક વિચારણાઓનો પરિચય આપ્યો છે, તો કૃતિની સંયોજનરીતિ, પદ્ધતિ, ભાષાભિવ્યક્તિ અને દૃષ્ટાંતકળા જેવી સાહિત્યિક બાબતોનો ય સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કર્યો છે. વસ્તુવર્ણનમાં યોજાયેલાં રૂપકો ઘણુંખરું અર્થસમૂહ છતાં તેમાંની રૂપક્યોજના હેતેશાં સર્વશી સંવાદી બની આવી હોય એમ વરતાતું નથી. કૃતિદા જોશીએ આવાં વિસંવાદી સ્થાનોની

નોંધ લઈ એવું અવલોકન રજૂ કર્યું છે : ‘દૃષ્ટાંતચિત્રો આપવામાં અખાજી કવિ-આવેશાથી ચાલે છે. તેથી તેમણે ચુસ્ત આકૃતિની કેમ પરવા કરી નથી, તેમ સુસંગતિની પણ પરવા કરી નથી.’ કૃતિના પદ્ધતિની અને ભાષાભિવ્યક્તિની તેમની તપાસ પણ એટલી જ ઘનિષ્ઠ છે.

અખાજીની કૃતિઓના અભ્યાસીને તેમની ભાષા ઉકેલવાના અને ખાસ તો અજાજાજ શબ્દોના અર્થબોધના ફૂટ પ્રશ્નોનો સામનો કરવાનો આવે જ છે. કૃતિદા જોશીને પણ આવા ફૂટ પ્રશ્નો અનેક સંદર્ભો ઉકેલવાની મથામજા કરવી પડી છે. પ્રાસ્તાવિક ચર્ચામાં ‘કેટલીક શબ્દચર્ચા’ ખંડકમાં ‘અજમાલ્ય’ ‘અંથ’ ‘તત્ત’ ‘નાટ’ ‘ન્યત્ર્ય’ ‘પ્રાયઃ’ ‘બાધી’ ‘ઝંસ/રૂસલ્ય’ ‘વરતાયય’ ‘વીચેવીચપણું’ ‘શંભ’ ‘સમોગુણા’ ‘સારોધ્યાર’ ‘સૂરતિ’ અને ‘હૂસ’ શબ્દોના અર્થબોધ માટે આદરેલી તપાસ ઘણી રસપ્રદ છે. જો કે કેટલાક શબ્દોના સુનિશ્ચિત અને અસંદિગ્ધ અર્થ સુધી પહોંચવાનું અતિ મુશ્કેલ બની રહ્યું છે. એ રીતે આ કૃતિના રહસ્યબોધમાં કેટલાંક અંધારબિંદુઓ રહી પણ ગયાં છે. કૃતિદા જોશીએ સંપાદિત પાઠને અંતે રજૂ કરેલો શબ્દકોશ - પારિભાષિક અને પૌરાણિક કોશ સમેત - કૃતિના અર્થગ્રહણમાં સીધો \*ઉપકારક બને છે.

‘ચિત્તવિચારસંવાદ’નું આ સંશોધનસંપાદન, આમ, ઘણી રીતે નોંધપાત્ર બને છે. પાઠસંપાદનની ચોક્સાઈ, ચીવટાઈ, અને પદ્ધતિસરની તપાસ, ઉપસ્થિત વિગતોની શ્રદ્ધેયતાની ચકસણી, તાર્કિક પ્રતિપાદન અને અભ્યાસસામગ્રીની વ્યવસ્થિત રજૂઆત - આ બધી બાબતોને લીધે આ સંપાદન શ્રદ્ધેય પ્રતીત થાય છે. બીજી બાજુ, કર્તા અને કૃતિ વિશેનું જીણવટભર્યું અધ્યયન, કૃતિનાં સાહિત્યિક પાસાંઓનું જીણવટભર્યું અવલોકન અને કૃતિમાં રજૂ થયેલા તત્ત્વવિચારને પકડવામાં ઉપયોગી બને એવી ભારતીય દર્શાનોની ભૂમિકા આ અધ્યયનને ઘણું ફળપ્રદ બનાવે છે. આ સંપાદન એ રીતે આપણા સંશોધિત સાહિત્યમાં એક ઘણો મૂલ્યવાન ઉમેરો બની રહે છે. □

## બૃદ્ધિએ અવલોકનો

બટુભાઈ ઉમરવાડિયા : સમગ્ર સાહિત્ય  
સંપા. જશવંત શેખડીવાળા, રવીન્દ્ર ઠાકોર

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૧૯૮૪  
૩. પૃ. ૮૫૦, ર. ૧૫૦.

ગુજરાતીના પ્રથમ એકાંકીકાર ગણ્યાયેલા તથા લેખક-પત્રકાર તરીકે વિલક્ષણ વ્યક્તિત્વથી ધ્યાન ખેંચનાર બટુભાઈ ઉમરવાડિયા (૧૯૮૮-૧૯૮૦)ના આ સમગ્ર સાહિત્ય સંચયમાં એમનાં એકાંકીઓ, અનેકાંકીઓ, વાતાઓ, ગાંધકાવ્યો, રાસગીતો તથા પત્રવિવેચનો ('કાર્તિકાને કમળના પત્રો') - મળીને ૮૧ કૃતિઓ પ્રગટ કરવામાં આવી છે. જૂનાં પ્રકાશનો અપ્રાય બનતાં જાય ત્યારે લેખકનાં સર્વ પ્રકાશનોનો સંકલિત સંગ્રહ પ્રકાશિત કરવાનું કામ આવકાર્ય ગણ્ય. જોવાનું એટલું રહે કે કયા લેખકોના સમગ્ર સાહિત્યને પ્રકાશિત કરવું ને મહત્વના લેખકોમાંથી પણ અગ્રતાક્રમ કોને આપવો - ખાસ કરીને જયારે એ પ્રકાશન સાહિત્યસંસ્થા તરફથી થતું હોય ત્યારે.

નાની વયે સાહિત્યિક પત્રકારત્વમાં ને સર્જનમાં તરલ-તેજસ્વી સક્રિયતા દાખવનાર બટુભાઈએ થોડાંક વષોની લેખન-કારકીર્દીમાં વિવિધ સ્વરૂપોમાં કલમ ચલાવી પણ એમનું યશોદાયી કામ તો પાત્ર-ઘટના-નિરૂપણની વિશેષતા દાખવતી કેટલીક સમસ્યામૂલક એકાંકી રચનાઓ અને માર્ગિક હળવાશથી કરેલી કેટલીક કૃતિઓની ચિકિત્સક આલોચનાવાળાં વિવેચનો જ ગણ્ય. જોકે, નાટ્યક્ષેત્રે એમનું અર્પણ ઐતિહાસિક રીતે સૌથી વધુ ધ્યાનપાત્ર લેખાય છે.

એમની કૃતિએજું આ સંકલન સંપાદનના કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. બધું એકદું કરીને છપાવી દેવું એમાં સંપાદકની ભૂમિકા કરી? બટુભાઈના સાહિત્ય-કાર્યને મૂલવતા એક નક્કર સંપાદકીય અભ્યાસ-લેખની સહજ જ અપેક્ષા રહે - એની ગેરખાજરી છે! એને બદલે આરંભે પ્રા. મધુરી ઉમરવાડિયાનો 'સ્વ.

બટુભાઈ ઉમરવાડિયાનું જીવન અને કવન : એક દૃષ્ટિપાત્ર નામનો લેખ મુકાયો છે. એ સંસ્મરણપત્રક ને ઉખાભયાર્થ રેખાચિત્ર જેવો છે. એમાં સ્તુતિ છે ને મૂલ્યાંકન નથી. અલબાત્, મૂલ્યાંકન કરવાનો એમનો આશય પણ નથી પરંતુ જીવન ને કવન વિશેની અંગત વિગતો પણ જરા સરખી રીતે આયોજિત કરીને તો મૂડી શકાઈ હોત.

નાટકો, વાતાઓ, વિવેચન એવા ખંડોની શરૂઆતમાં આ સંકલિત કૃતિઓ વિશે સંપાદકોએ સંક્ષિપ્ત લખાણ કર્યા છે એમાં સંગ્રહોના પૂર્વ-પ્રકાશનનાં વર્ષો નોંધાયાં છે એ સારું છે. અર્દી પણ, કૃતિઓ વિશેની કોઈ મૂલ્યાંકનલક્ષી નોંધસુધ્યા મળતી નથી. કૃતિઓનો કમ નાટ્યસંગ્રહો આદિમાંના કૃતિક્રમ મુજબ નહીં પણ સ્વરૂપવાર અકારાદિકમે કર્યો છે એટલું એમનું, ગણો તો, સંપાદનકાર્ય.

વિગતો અને તથ્યોને જાળવવાની કણજી આપણે જાગી રાખતા નથી. એમાંથી કેટલાક પ્રશ્નો થાયઃ બટુભાઈના દરેક પુસ્તક આગળ મુકાયાં હશે એ લેખકનાં નિવેદનો અર્દી કેમ બાકાત કરવામાં આવ્યા છે? (ઉમાશંકર જોશીએ 'સમગ્ર કવિતા'માં બધા સંગ્રહો સમાવ્યા ત્યારે પણ પ્રસ્તાવનાઓ - નિવેદનો તો જાળવેલાં જ). સામયિકોમાં પ્રકાશિત એમના પ્રકીર્ણ લેખો, એમની અધૂરી નવલક્ષ્ય 'મધુસૂદન' તથા 'આપણા કેટલાક મહાજનો' નામે લેખક પ્રકાશિત કરવાના હતા એ રેખાચિત્રો આ 'સમગ્ર સાહિત્ય'માં કેમ સમાવાયાં નહીં કે એના કશા ઉદ્દેખ પણ થયા નહીં? આ મરણપોતર સંચયમાં બટુભાઈના જન્મ-મૃત્યુનાં વર્ષોનો નિર્દેશ પણ નહીં?

સંપાદન-પ્રકાશનની આટલી પ્રાથમિક આવશ્યકતાઓ પળાઈ નથી તો પછી, બટુભાઈના ગ્રંથોની અલગ એકવગી સૂચિના અને બટુભાઈ પરનાં આજલગીનાં વિવેચનોની સંદર્ભસૂચિના સમાવેશનાં તો અપેક્ષા જ શી રીતે ગાંઝી શકાય?

- રમણ સોની □

## ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ ૧૯૫૭

૧૯૮૧ : સંપા. અને પ્રકા. પ્રકાશ વેગડ

વિતરક : રામાદે પ્રકાશન, અમદાવાદ, ૧૯૮૪;  
કા. પૃ. ૧૧૬ રૂ. ૩૧.

સૂચિકાર તરીકે પ્રકાશ વેગડના નામથી હવે ભાગથે જ કોઈ અજાણ હશે અને ભાગથે જ કોઈ અભ્યાસી-સંશોધક એવો હશે જેણે કોઈ ન કોઈ રૂપમાં અમની પાસેથી સંદર્ભ-સંખય નહીં મેળવી હોય. વર્ષોથી એ પુસ્તકો સામયિકો આદિ ખૂબ ઓટોમાંથી નિયમિત રીતે માહિતી સંચિત કરતા રહ્યા છે ને એને ચોક્સાઈ-પૂર્વક શાસ્ત્રીય વ્યવસ્થામાં વગ્નિકૃત કરતા રહ્યા છે એટલે કોઈપણ સંસ્થાએ કે વ્યક્તિ એ કોઈ ગ્રંથકાર-વિશેષ કે સ્વરૂપવિશેષ પર કામ આરંભ્યું હોય કે પ્રકાશન કર્યું હોય. પ્રકાશ વેગડ પાસેથી એને લગતી અધતન (અપ ડેટ) સૂચિ મળી જ રહે. ગુજરાતી સાહિત્યના મૌય પરિક્ષેત્રને સમાવે એવી વિવિધલક્ષી ગ્રંથ-સંદર્ભ-સૂચિ (બિલ્બિઓગ્રાફી) સંપાદિતી શકે એટલી બહોળી સામગ્રી અમની પાસે છે. પણ સંશોધકો-અભ્યાસીઓનો સમય બચાવનારી અને એમને ખૂબ ઉપયોગી નીવડનારી આવી સૂચિઓ પ્રકાશિત કરવાની કોને પડી છે? ધંધાદારી પ્રકાશકો હોય કે સાહિત્યસંસ્થાઓ હોય, કોઈને આવા સૂચિ-સંગ્રહોના પ્રકાશનને મહાત્વ કે અચિમત્તા આપવાનું મનમાં વસ્તું નથી.

૧૯૭૮માં એમણે ગુજરાતીમાં ૧૯૭૭ સુધીમાં સ્વીકારાયેલા મહાનિબંધોની જે વગ્નિકૃત સૂચિ પ્રગટ કરેલી એને હવે ૧૯૮૧ સુધીમાં સ્વીકારાયેલા નિબંધો સુધી વિસ્તારીને તૈયાર કરેલી આ સૂચિ, ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સંહાય મેળવીને, એમણે પ્રકાશિત કરી છે. પરિશાસમાં, ૧૯૮૪ સુધી સ્વીકારાયેલા કેટલાક નિબંધોનો સમાવેશ પણ એમણે કરી લીધો છે.

૧૯૮૧ સુધીના ૪૬૪ (અને પરિશાસના ઉમેરતાં પોણા પાંચસો જેટલા) નિબંધોને એમણે વિષય-દૃષ્ટિએ મધ્યકાળીન (૧૯૫૦ સુધી) અને અવર્યીન એવા બે મુખ્ય સમયખંડોમાં વહેંચીને તથા એમાં પણ વિષય, કૃતિ, સર્જક, સ્વરૂપ, સિદ્ધાન્ત, ભાષા-

વિજ્ઞાન આદિ પેટાવિભાગો કરીને નોંધ્યા છે એથી મહાનિબંધોના વિષયવૈવિધ્યનું સ્પષ્ટ વગ્નિકૃત ચિત્ર તીવ્રતી રહે. વળી એની વિગતોમાં અકારાદિકમે સંશોધકનામ, એનું (મળ્યું ત્યાં) જન્મવર્ષ, મહાનિબંધનો વિષય, યુનિવર્સિટી, સ્વીકારાયાનું વર્ષ ને ગ્રંથરૂપે નિબંધ પ્રકાશિત થયો હોય તો એનું પ્રકાશનવર્ષ એવી આંતરવ્યવસ્થા પણ કરી છે. આ મુખ્ય વિભાગ પણ એમણે સંશોધકસૂચિ અને વિષયસૂચિ પણ આપ્યાં છે જેથી આવશ્યક માહિતી તરત શોધવામાં મદદ મળે.

આ સૂચિ બે રીતે ઉપયોગી થઈ શકે. પીએચ.ડી. કરવા ઈચ્છતા અભ્યાસીઓ અને એમના માર્ગદર્શકોને વિષયોના વૈવિધ્યનો ને વ્યાપનો ઘ્યાલ આવે ને અનાવશ્યક પુનરાવર્તન ટાળી વિષય પસંદ કરવામાં મદદ મળે. બીજો ઉપયોગ એ છે કે ગુજરાતી ભાષા-સાહિત્યમાં પીએચ.ડી. નિમિત્તે જે સંશોધન-કાર્ય થયું છે એનો વિષયલક્ષી અભ્યાસ કે સર્વેક્ષણ કોઈ તૈયાર કરી શકે. જેમકે કેવા પ્રકારના વિષયો તરફ અભ્યાસીઓનો જોક રહ્યો છે, અનુગતિકતા અને સુકરતાનો માર્ગ લેવાનું વલણ કેવું રહ્યું છે ને નવી દિશાઓ શોધવાનાં સાહસ-પડકાર કેવાંક જિલાયાં છે, કયાં સ્વરૂપ કે સર્જક પર સર્વાધિક નિબંધો થયા છે (જેમ કે મીરાં વિશે ૧૪ મહાનિબંધો – જેમાંના ૧૦ લિંગીમાં થયેલા છે) ને કયા પ્રદેશો અધખેડ્યા કે અક્ષુણ્ણ રહ્યા છે – એનો અંદાજ મેળવીને આપણાં સંશોધનોની ઈયતા અને વિવિધતાનો ઘ્યાલ બાંધી શકાય. પ્રકાશ વેગડે પોતે પણ, એમના ટૂંકા નિવેદનમાં, કેટલાંક નિરીક્ષણો સંક્ષેપમાં નિર્દેશ્યાં છે, જેમકે, કુમશઃ પીએચ.ડી.ના મહાનિબંધોની વૃદ્ધિ થતી જ રહે છે, ‘આ વૃદ્ધિ દ્વારા સિદ્ધ થાય છે કે આપણો સંશોધનપ્રેમ રોકેટગતિએ ફાલ્યો-કૂલ્યો છે! અને જો આપણા આ મહાનિબંધો ગુણવત્તામાં પણ એવી જ સમૃદ્ધ દર્શાવતા હોય તો આ બાબત ખરેખર અભિનંદનીય ગણ્યાય’ એમણે માર્ગિક રીતે અર્થી, ગુણવત્તા વિશેનો સંશેષ વ્યક્ત કયો છે. આગળ પણ એમણે નોંધ્યું છે કે એક જ વિષયનાં પુનરાવર્તનો થાય છે એમાં નવું પ્રતિપાદિત કરવાની દૃષ્ટિ ન હોય તો ‘ધ્યાશીધ રિચ્રી મેળવીને આર્થિક લાભો સંચિત કરવાની વ્યાપારી વૃત્તિ’ જ એની પાછળ હોવાનું

ફરિત થવાનું. આ તો વિષયસૂચિએ સંપદાવેલાં નિરીક્ષણો છે પણ આ સર્વ મહાનિબંધોની સામગ્રી-માંથી કોઈ પસાર થાય તો એને ઘણી મોટી નિરાશામાં દૂબવાનો વારો આવે ને ઘણાં આકરાં વિધાનો કરવાનાં થાય. અલબટ, એ આજો અલગ જ મુદ્દો છે.

આ સૂચિ નિઃશંકપણે શાસ્ત્રીય છે ને ઉપયોગી છે પણ એમાં કેટલાક અનવધાનો ને અનવસ્થા રહી ગયાં છે એનો નિર્દેશ, ભવિષ્યની આવૃત્તિમાં સુધરી શકે એ આશયથી, કરવો જરૂરી લાગે છે.

નિરેદનમાં એક બામક વિગત આવી ગઈ છે. એમણે નોંધ્યું છે કે ૧૮૫૭થી ૧૮૭૭ સુધીનાં ૧૨૧ વર્ષમાં ૨૩૮ નિબંધો થયેલા ને એ પછીનાં ૧૪ વર્ષમાં ૨૨૫ ઉમેરાયા છે એટલે 'સરેરાશ રૂપો ટકાની વાર્ષિક વૃદ્ધિ થઈ છે !' પરંતુ ૧૮૫૭ એ પહેલી યુનિવર્સિટીની સ્થાપનાનું વર્ષ છે, પહેલા મહાનિબંધની સ્થીકૃતિનું નથી. આ યાદીમાં જુનામાં જુનો નિબંધ (ટી.એન. દવેનો) ૧૮૭૧માં સ્થીકારાયેલો છે એટલે ત્યાંથી માંડીને ૧૮૭૭ સુધીનાં પચાસેક (નહીં કે ૧૨૧) વર્ષ પીએચ.ડી. સંશોધનની પ્રવૃત્તિનાં ગણાય. (ને તો પેલી 'વાર્ષિક વૃદ્ધિ' ૩૦૦ ટકા જેટલી થાય). આમ સંશોધનકાર્યની પૂર્વમર્યાદા ૧૮૫૭ ગણવી બામક લેખાશે.

પેટા વિભાગો ને ઉપશીર્ષકોમાં વળાકૃત કરવામાં કેટલાક નિબંધો બબ્બે જગ્ગાએ નોંધાયા છે. ભરત નાયકનો ગુજરાતી નવલકથામાં મેલોડ્રામાની રૂપરચનવાળો નિબંધ નવલકથા ઉપરાત નાટકમાં પણ નોંધાયો છે ! એને સંપાદકનો સમજદોષ ગણીએ તોપણ શાસ્ત્રીય વ્યવસ્થાની દૃષ્ટિએ તો એમણે પ્રતિનિર્દેશ (કોસ રેફરન્સ)ની પદ્ધતિ જ યોજવી જોઈતી હતી. એ જ રીતે જ્યા મહેતાનો નિબંધ હાસ્યકવિતા અને હાસ્યનિરૂપણ એવા બને વિભાગમાં નોંધાયો છે ને શ્રદ્ધા ત્રિવેદીનો નિબંધ કથાસાહિત્ય અને બાલસાહિત્ય એ બને વિભાગોમાં નોંધાયો છે - કથાસાહિત્ય વિભાગમાં આનો સમાવેશ ઉચિત નથી લાગતો.

નિરૂપણની એકવાક્યતા પણ એક બાબતમાં જોખમાઈ છે. લગ્ન પછી અટક બદલાઈ હોય એવાં સ્ત્રી-સંશોધકોન્ય નિર્દેશની વ્યવસ્થા બરાબર થઈ

નથી. શાહ પૂર્ણિમાના નિબંધની વીગત નીચે નોંધ છે : 'ચંદ્રશંકર પુ. બહુનાં પત્ની' તો શેઠ, સરયૂના નિબંધની વીગત નીચે 'લગ્ન પછીનું નામ ઓસ.આર. મહેતા' અને દેસાઈ, ઊર્મિના નિબંધની વીગત નીચે 'ઊર્મિ કામેશ્વર વ્યાસના નામે માન્ય થયેલ મહાનિબંધ' એવી નોંધ છે. પાછળ સંશોધકસૂચિમાં (આવી અલગ નોંધને કારણે હશે ?) આ સૌના નામોના પ્રતિનિર્દેશો આપ્યા નથી જ્યારે નિબંધની વીગત પૂર્વ 'મહેતા, હીના પ્રતીક (વૈષ્ણવ હીના બી)' એવા નામોહેબ છે ત્યાં, સંશોધકસૂચિમાં, 'વૈષ્ણવ હીના બી - જુઓ મહેતા હીના પ્રતીક' એવા પ્રતિનિર્દેશો છે. મહેતા હીના વગેરેમાં જે પદ્ધતિ અપનાવી છે એ જ શાસ્ત્રીય, સુસંગત અને શબ્દો બગ્યાવનારી છે. વર્ણનાત્મક નોંધોવાળી પદ્ધતિ રાળવી જોઈતી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાય, લોકગીત, લોકકથા, લોકસાહિત્ય આદિ વિષયો પરના (દસેક) નિબંધોને એમણે, ૧૮૫૧-૧૮૮૧વાળા (અવચીનના) સમય-ખંડમાં કેમ સમાવ્યા હશે એનું આશ્ર્ય થાય છે - ખરેખર તો વિષયપૂર્ણાં એ ૧૮૫૧ પૂર્ણો વિગતોમાં આવે.

વ્યવસ્થાની આવી ન-જેવી જ્ઞતિઓ (જે સરળતાથી સુધરી શકે એમ છે) સિવાય આખું કામ સુવ્યવસ્થિત છે. પીએચ.ડી. કરવા ઈચ્છા દરેક અભ્યાસી પાસે, કોલેજોનાં ગ્રંથાલયો ને યુનિવર્સિટીઓના વિભાગોમાં આ સૂચિ આવશ્યક-

**ગાંધીના ક-ખ-ગ : સં. મહેન્દ્ર મેધાણી**

લોકમિલાપ, ભાવનગર, ૧૯૮૪

કા. પૃ. ૪૮ દ. ૪.

પણ હોવી ધટે.

- રમણ સોની



મહાત્મા ગાંધીનાં અનેક લખાણોમાં વ્યક્ત થયેલા, જુદાજુદા વિષયો પરના લાક્ષણિક, આગવી મુદ્રાવાળા, પ્રેરક, સુચિત્ત એવા વિચારોમાંથી સૂત્રાત્મક શૈલીના સંક્ષિપ્ત અંશોને તારવીને, મહેન્દ્ર મેધાણીએ આ નાનકડી પુસ્તિકામાં વિષયના

અકારાદિકમે ગોઠવીને મૂક્યા છે. નિરેદનમાં એમણે લખ્યું છે કે 'નાખી નજર પહોંચે ત્યા સુધી જાણે કે મબલક પાકની ફસલ આપણી સામે 'કલેક્ટર વકર્ત' અને 'ગંધીજીનો અક્ષરદેહ'ની ગ્રંથશ્રેષ્ઠીરૂપે પડેલી છે તેમાંથી એકાદ હુંડા જેટલા દાણા અર્હી ભેણ કર્યા છે.' એમના મતે 'આર હજાર જેટલા જુદ્ધજુદા વિષયો પર ગંધીજીના વિચારો પથરાયેલા છે.' એમાંથી એમણે અર્હી સંક્ષેપમાં સવાસો જેટલા વિચારોની સંક્ષિમ તારવણી કરી છે.

આમ કરવામાં એમને મહેનત ઘણી પડી હો પણ સંપાદન-સંકલનના કામમાં મહેન્દ્ર મેઘાણી અત્યંત કુશળ છે. વળી આ રીતે વિષયના અકારાદિકમે ગંધીજીના ટૂંકા વિચાર-અંશોને ઉત્તરવાની આ યોજના જ ખૂબ કલ્યાણશીલ ને આકર્ષક લાગે છે - ગંધીજીના અલિપ્રાયોને જાણવા માટેના એક નાનકડા ખાથવગા સંદર્ભ તરીકે આ પુસ્તિકા, એનામાં રસ ધરાવનારને, ઘણી જ ઉપયોગી નીવડે એવી છે. આ પદ્ધતિએ બીજા પણ કેટલાક ચિંતકો-વિચારકો-સર્જકોની વિચારણાને એમણે ખાથવગી કરી આપવી જોઈએ એવી અપેક્ષા રહે છે. તૈયાર પરિચય-સૂચિ તરીકે એ મૂલ્યવાન બની શકે.

મહેન્દ્ર મેઘાણીના દરેક પ્રકાશનમાં હોય છે એમ, આ પુસ્તકને અંતે પણ એમનો વિધિ-સુધાર વિશેનો નાનકડો લેખ મુકાયો છે ને આ પુસ્તકના મુદ્રણમાં

**છીરક કેસૂડાં :** સંપા. રમણીક મેઘાણી, જ્યંતીલાલ મહેતા, જ્યોતિ ભાલરીઆ, શ્યામ આશર, દિલીપ ગણાગ્રા

પ્ર. સાહિ.પરિષદ કલકત્તા અધિ. સ્વાગત-સમિતિ, ૧૯૮૮, દિ. ૨૬૬, ફ. ૭૦.

પણ પોતાની એ જોડણીપદ્ધતિ એમણે સ્વીકારી છે.  
— રમણ સોન્ની



કલકત્તા ગુજરાતી સાહિત્ય મંડળ વતી બહાર પહુંઠું 'કેસૂડાં' અની સાહિત્યિક પ્રવૃત્તિથી ધ્યાન ખેંચતું રહ્યું છે. આ અગ્રાઉ 'કેસૂડાં'ના અમુક અંકો અને પુસ્તક-રૂપે પ્રસિદ્ધ થયેલાં નવલિકા, કવિતા, એકાડીમી વગેરે ધ્યાનાર્દ રહ્યાં છે.

ગત વર્ષ સાહિ. પરિષદના અધિવેશન પ્રસંગે પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકમાં કલકત્તામાં 'કલકત્તી ગુજરાતીઓ' દ્વારા થતી સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક તેમજ પત્રકારત્વ, નાટ્યક્ષેત્રે થતી/થયેલી પ્રવૃત્તિનો ઐતિહાસિક આલેખ છે. પુસ્તકને ત્રણ ભાગમાં વહેંચ્યું છે.

- (૧) કલકત્તામાં ગુજરાત (૨) કલકત્તાના સર્જકો
- (૩) કલકત્તાના પત્રકારો.

કલકત્તામાં ગુજરાત - એ નામનો દીર્ઘ લેખ અલગ-અલગ સ્પાત પ્રકરણોમાં વિભાજિત છે. એમાં ઇ.સ. ૧૭૫૭થી શરૂ કરીને છેક ૧૮૮૮ સુધીનાં ૨૩૭ વર્ષના લાંબા સમયપટ પર 'કલકત્તી ગુજરાતીઓ'ના ઈતિહાસનું વિહંગપાવલોકન છે. જેમાં - કલકત્તા જનર પ્રથમ ગુજરાતી, એમનાં સંઘર્ષ, વિદ્યાર્થીતિ, ગુજરાતી સંસ્થાઓની સ્થાપના, કેળવણીક્ષેત્રે ગુજરાતી-પારસી મહાનુભાવનું પ્રદાન, દેપારક્ષેત્રે વર્ચસ્વ, બંગાળ-ગુજરાતના સંબંધો, સાહિત્યમંડળની સ્થાપના, નાટ્યપ્રવૃત્તિ, સેવાકાર્ય, રાજકીય પરિસ્થિતિ, ગુજરાતીમાંથી બંગાળીમાં અનુવાદ જેવા મુદ્દાઓને તત્કાલીન સમય સાથે સાંકળી લઈને એક ઈતિહાસ-રેખા પૂરી પાડવાનો પ્રયાસ છે. એમાં વર્ચેવર્ચે, 'નવી પેઢીના યુવાન વગનો ગુજરાતી ભાષાસાહિત્ય સાથેનો સંપર્ક તૂટતો જાય છે. કારણ કે તેમની શાળામાં માધ્યમ ઉદ્દૂ છે.' જેવી ચિંતા પણ હોકિયું કરી જાય, તો ગુજરાતીઓની મર્યાદા જેવી ટકોર પણ દેખાય એક બીજી નોંધ પણ મહાત્વની જ્ઞાય છે : ૧૭૫૭થી ૧૮૮૮ સુધીનાં ૨૦૨ વર્ષનો કલકત્તી પારસીઓનો ઈતિહાસ સાચવવામાં તે કોમે જેવી ચીવટલરી ઈતિહાસ-દૃષ્ટિ સાચવી છે તેવી ઈતિહાસદૃષ્ટિ અન્ય ગુજરાતી કોમોએ જાળવી નથી.'

બીજા વિભાગના 'કલકત્તાના સર્જકો' નામના પ્રકારણમાં કલકત્તાસ્થિત પાંત્રીસ જેટલા ગુજરાતી સર્જકોનો પરિચય આપવામાં આવેલો છે. જેમાં - ચાંપશરીભાઈ ઉદેશી, ગગનવિલારી મહેતા, શિવ-કુમાર જોશી, ચંદકાંત બક્સી, મધુ રાય, સુનીલ કોઠારી જેવા જ્યાતથી માર્ગી અત્યારે કાર્યરત એવા અલ્ય-જ્યાત નવા સર્જકોનો અને તેમના સાહિત્યનો વીગતે પરિચય કરાવ્યો છે. આ પરિચયો વીગતપૂર્ણ છતાં

પ્રાસાદિક ને રસપ્રદ છે.

તીજા વિભાગના, કલકત્તાના પત્રકારો નામના પ્રકરણમાં કલકત્તાસ્થિત પારસી-ગુજરાતી પત્રકારો અને પત્રકારત્વ વિશે વાત થયેલી છે. જેમાં 'નવરોજ'ના સ્થાપક એદલજી કંગારી શરૂ કરીને નવોદિત સંજ્ઞય શાહ જેવા યુવાન પત્રકારોનો પરિચય અપાયો છે. 'નવરોજ' આજે ૭૮ વર્ષથી સતત ચાલે છે, આ ઉપરાંત ચાર-ચાર પાકિસ્તાની અને માર્ગિની કલકત્તાથી પ્રસિદ્ધ થાય છે.

'નવરોજ'ની ૭૫ વર્ષની જઈલમાં કલકત્તામાં ગુજરાતને આખ્યો ઈતિહાસ સંબંધયેલો છે.

આમ, એક દસ્તાવેજ પુરાવા તરીકે 'હીરક કેસૂડા' પુસ્તકનું મૂલ્ય ઘણું છે. આપણે ત્યાં 'સ્વાંત્ર્યોત્તર ગુજરાત' અને 'ગુજરાત ગાથા' જેવાં પુસ્તકો દ્વારા થયેલો આવો પ્રયાસ ગુજરાતની બધાર પજી થાય છે એ આવકાર્ય છે - સંપાદકોને અભિનંદન.

- અજ્યા રાવલ

### મેધાંદી-સાહિત્ય

#### લોકસાહિત્ય - સંપુટ

૧

દાદાજીની વાતો

રંગ છે, બારોટ !

લોકજીને વરેલી સૌરાષ્ટ્રની પરીકથાઓ .  
અભ્યાસી પ્રવેશકો સાથે

સોર્ટી ગીતકથાઓ

૪૫૦ દુલ્હાઓમાં વણપૈલી કરુશ  
પ્રેમકથાઓ . પ્રવેશક સાથે

સોર્ટી સંતો □ પુરાતન જ્યોત  
સંતોની જ્યલનકથાઓ . પ્રવેશક-સાથે

સોર્ટી સંતવાસી

ભજન-સંગ્રહ . પ્રવેશક સાથે

છાલરડાં [લોકગીતો]

સૌરાષ્ટ્રનાં ખરેરોમાં

અરથી સરી પહેલા લોકસાહિત્યની  
ખોજમાં કરેલા રાળપાટનું બયાન

આડ પુસ્તકોની કુલ કીમત : રૂ. ૧૮૫  
પણ, તા. ૩૧-૧૨-૮૪ સુધી

માત્ર રૂ. ૧૨૦

રંજિ. ટપાલ-રવાનગી : રૂ. ૧૫

૨

સૌરાષ્ટ્રની રસધાર

૫ ભાગ : કાચાં પૂંડાં

કીમત : રૂ. ૧૦૦

પણ, તા. ૩૧-૧૨-૮૪ સુધી

માત્ર રૂ. ૭૦

રંજિ. ટપાલ-રવાનગી : રૂ. ૧૨

૩

રઢિયાળી ચાત

મૂળ ચાર ભાગમાં સંગૃહિત

૪૦૦ લોકગીતો

હવે ૩૨૮ પાનાંના પાકા પૂંડાના એક  
ગ્રંથમાં સંકલિત

કીમત : રૂ. ૭૫

પણ, તા. ૩૧-૧૨-૮૪ સુધી

માત્ર રૂ. ૫૦

રંજિ. ટપાલ-રવાનગી : રૂ. ૧૦

ઉપરના ત્રણીય સંપુટ સામન્ય મગાવનારે

માત્ર રૂ. ૨૪૦ મોકલવાના : રવાનગી માફ

અમર યુરોપીય ચિત્તારા વિન્સેન્ટ  
વાન ગ્રેગનું કરુણાલભ જીવન  
આલેખની પ્રસિદ્ધ નવલકથા

'લસ્ટ ફોર લાઇફ'નો  
સંપૂર્ણ અનુવાદ

\*

સણગતાં સૂરજમુખી

અરવિન્દા સ્ટેન  
અનુવાદક વિનોદ મેધાંદી

વાન ગ્રેગનાં સંખ્યાબંધ  
ચિત્રો-રેખાંકનોથી સુશોભિત,  
ચિત્રકૃતિઓ - ચિત્રકારો વિશેના  
માહિતીપ્રદ ટિપ્પણ સાથે

રિમાઈ કદનાં ૫૧૧ પાનાંની  
'રિલક્ઝ' આવૃત્તિ

કીમત : રૂ. ૧૫૦ પણ,  
તા. ૩૧-૧૨-૮૪ સુધી  
માત્ર રૂ. ૧૦૦

રંજિ. ટપાલ-રવાનગી રૂ. ૧૫

: નજીકના પુસ્તક-બંડારમાંથી ન મળે તો લખો :

પ્રસાર પુસ્તકોની નાનકડી દુનિયા

૧૯૯૮ આત્મભાઈ એવન્યુ, ભાવનગર ૩૬૪ ૦૦૨ □ ફોન : (૦૨૭૮) ૨૮૪૫૨

TO SIR, WITH LOVE – E. R. BRAITHWAITE,  
The New English Library Limited, Barnard's Inn, Halborn, London - 1959.  
Published in Ace Books Edition in 1961; PP. Crown 142

New York Times જે પુસ્તક માટે 'A book that the reader devours quickly, ponders slowly and forgets not at all' એવું લખે, જેના પરથી અતિ સફળ ફિલ્મ ઉત્તરી ચૂકી છે એમાં એવું તે શું હશે – એવી કુતૂહલવૃત્તિથી મેં ઈ.આર.બ્રેઠથવેઈટની 'દુ સર, વિથ લવ' વાંચવાની શરૂ કરી હતી. એક જ બેઠકે આ પુસ્તક પૂરું કરીને ઉભી થઈ ત્યારે 'આ ચોપડી ક્યારેય નહીં ભૂલી શકાય' એવી લાગણી મને ઘેરી વળી. બ્રેઠથવેઈટ અહીં જાત-અનુભવો આદેખ્યા છે. અહીં ભાષાની વરણાગી, સંવાદોનો જાદુ, રોમાન્સના વેવલાવેડ, હીરો-વિલનનો સંઘર્ષ, સમાજને પલટાવી દેવાની વાતો...વગેરે વગેરે કશું જ નથી. અને છતાંય આ પુસ્તકમાં એવું કંઈ છે જે વાચકને અંદરથી હલાવી મૂકે છે.

લાયકાત હોવા છતાં કાળા રંગને કારણે મિ. બ્રેઠથવેઈટને નોકરી મળી ન હતી. છેવટે લંડનની એક ઝૂંપડપદ્ધીની નિશાળમાં તેમને નોકરી મળે છે. આ નિશાળમાં તેમને થતા અનુભવોની કથા એટલે 'To Sir, with love'ની કથા. તેમને જે વર્ગ સોંપાયો છે તે વર્ગનાં બાળકો વિશિષ્ટ છે. એવાં વિશિષ્ટ કે તેમને ભષ્ણાવનાર શિક્ષક કાં તો વર્ગ છોડી દે અથવા શાળા છોડી દે. અઠવાડિયે માંડ એકાદવાર નહાતા, વાળ-કપડાં કશાના ઠેકાણા વગર જ નિશાળે આવતા, એકબીજાને ગ્રાળથી જ બોલાવતા, મોટા થઈ ગયા છતાં નાના બાળક જેટલી સમજ ધરાવતા આ ઉદ્ઘત અને તોછા છોકરાઓ શિક્ષકનું મોઢા પર જ અપમાન કરતાં જરાય ખચકાતા નથી. શાળાની કોરીડોરમાં જ તેઓ એકબીજાને વળણીને ઉભા રહે છે, ચુંબન કરે છે. આ બધાનું અનુકરણ નાનાં બાળકો પણ કરે છે. અને એ પણ એટલી હંડે કે એક નાનકડો છોકરો છોકરીઓના બાથરૂમ પર ચઢી ડેક્ટિયાં કરવા જતાં પડે છે અને ઘાયલ થાય છે. લેખક એક પછી એક પ્રસંગથી આ વિદ્યાર્થીઓની ઉદ્ઘતાઈ, નફકટાઈનું પ્રત્યક્ષીકરણ કરાવતા જાય છે. એક પછી એક પ્રસંગથી વાચક થીજતો જાય છે. કઈ રીતે આ લોકો સાથે કામ કરી શકાય ?

પ્રથમ દિવસે જ લેખકના કાન Bloody અને Bastard શબ્દથી ત્રાસી ગયા કોઈ વિદ્યાર્થીને 'Sir' કહેવાની જરૂર તો લાગતી જ નથી. આમ તો આ વિદ્યાર્થીઓ સ્ત્રી-પુરુષ કહી શકાય એટલી ઉમરે પહોંચી ગયેલાં છે. એમને બાળકો કહી શકાય એમ નથી. ચાલુ વર્ગો આ ઉદ્ઘત છોકરાઓ જાત-ભાતનાં તોકાન કરે છે. સ્ત્રીના પૂત્રના સાથે ગંદી ચેષ્ટાઓ કરી હસે છે અને બ્રેઠથવેઈટ પ્રથમ દિવસે જ ગુસ્સે થઈ એ બધાની દુશ્મની વહોરી લે છે. જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ અસહકારનું શરણું લીધું. હસવાનું-બોલવાનું સાવ બંધ માત્ર આગારતી નજરે જોયા કરવાનું. અસહકાર પછીનો બીજો તબક્કો અવાજ કરવાનો હતો. બ્રેઠથવેઈટ ભષ્ણાવતા હોય ત્યારે આ બધા વાતો કરે છે, અવાજ કરે છે, ધરાર એમને સંભળતા નથી. પણ એક પ્રસંગ આપ્યો તખ્તો પલટી નાખે છે. એકવાર રિસેસ પછી બ્રેઠથવેઈટ જ્યારે વર્ગમાં આવે છે ત્યારે આખો ઓરડો ધુમાડાથી ભરાઈ ગયો હોય છે. અને ધુમાડાની જરાય પરવા કર્યા વગર છોકરા-છોકરીઓ સગડી (ઝાયર પ્લેસ)ની આસપાસ ઠણ્ણમણકરી કરતા ઉભા હોય છે. ધુમાડાનું કારણ જાણવા બ્રેઠથવેઈટ યોળાની વર્ચ્યે

ઓક્સિયુ કરે છે અને સ્તરથી થઈ જાય છે. બીજી જ પણ ગુસ્સામાં પાગલ થઈ જાય છે. કોઈએ વાપરેલો સેનિટરી નેચિન સગડીમાં નાખ્યો હતો. અને બેઈથવેઇટ મગજ ગુમાવે છે. છોકરાઓને બહાર કાઢી મૂકી તે છોકરાઓ પર વરસી પડે છે. અને તેના પોતાના આશર્ય વચ્ચે આ લોકો પહેલી વાર પોતાના વર્ત્તિવ બદલ શરમાય છે. અને હવે બેઈથવેઇટ પરચો બતાવે છે. તેમના વર્ગમાં ગેરશબ્દ નહીં ચાલે, અવાજ નહીં ચાલે, બધાએ એકબીજાને માનાર્થે બોલાવવા પડશે વગેરે વગેરે નિયમો મોટાભાગના વિદ્યાર્થીઓ દલીલો પછી સ્વીકારી લે છે પણ તોકાન અને તોછાપણામાં અગ્રેસર રહેતો ઉનહેમ મનથી આ સ્વીકારી શક્યો નથી. એક દિવસ કસરતના વર્ગમાં ઉનહેમ બેઈથવેઇટને બોંડિસગ માટે આમંત્રે છે. થોડીક આનંકાની પછી બેઈથવેઇટ તેની સાથે લડવાનું સ્વીકારે છે અને પણવારમાં જ તે ઉનહેમનો ઈરાદો સમજી જાય છે. મોઢા પર વાગેલ મુક્કાથી લોડી વહેતું જોઈને બેઈથવેઇટ મગજ ગુમાવે છે અને એક જ મુક્કામાં ઉનહેમને તેના બધા જ ગર્વ સાથે ધોખીપણાડ ખવડાવે છે. અને હવે આ વિદ્યાર્થીઓ અને બેઈથવેઇટ વચ્ચેના સાચા સંબંધની શરૂઆત થાય છે. બેઈથવેઇટ જે કઈ અને જેટલું પણ કહે તે બધું જ કરવા તેઓ હવે તૈયાર છે. બેઈથવેઇટ આ ઉદ્ઘાત ટોળાને જ્યારે મુલ્લિયમ જોવા લઈ જાય છે ત્યારે આસપ્લસના વિસ્તારમાં તોકાન થશે એવી બધાને આશંકા હતી. આવું કઈ થવાને બદલે શિસ્તબદ્ધ વર્તનથી આ વિદ્યાર્થીઓએ બધાને આશર્યનો ઝટકો આપ્યો. આ જ પ્રસંગે બેઈથવેઇટ અને મીસ ગિલિયન વચ્ચે પ્રેમના અંકુર ફૂટે છે.

આ બધા પ્રસંગે વચ્ચે જરાય બોલકા બન્યા વગર લેખક કાળા-ગોરા વચ્ચેના બેદભાવને પણ વાચ્યા આપતા રહ્યા છે. પોતે કાળા છે એટલે જ યોગ્યતા હોવા છતાં નોકરી મળી ન હતી. હોટલમાં પણ કાળા હોવાને કરણો મીસ ગિલિયનની હાજરીમાં વેઠટર તેમનું અપમાન કરે છે. કોઈ એમને રહેવા માટે ઘર આપવા પણ તૈયાર નથી. આ બધી મુશકેલીઓમાં મોટાભાગે તો મિ. બેઈથવેઇટ શાંત રહે છે પણ ક્યારેક પાગલની જેમ ગુસ્સે થઈ જાય છે. શાળામાં પણ કાળો રંગ તેમનો પીછો નથી છોડતો. એકવાર વર્ગિંગમાં એમના હથે કિર્દિક વાગે છે ત્યારે પોટર નામનો છોકરો આશર્યથી બૂમ પાડી ઉડે છે... ‘હેય, લાલ રંગ !’ અને બેઈથવેઇટ પ્રત્યે ફૂલો ભાવ ધરાવતી પામેલા તેર નામની ખૂંખાર છોકરી પોટર પર તૂટી પડે છે – ‘તેં શું એવું ધારેલું કે શાહી નીકળશે ?’ કાળાગોરા વચ્ચેના બેદભાવનો બીજો એક પ્રસંગ લેખકની સાથે આપણી અંખ પણ બીજીવી જાય છે. લેખકના વર્ગમાં સિલેસ નામનો એક કાળો છોકરો ભણે છે. તેની માતાના મૃત્યુપ્રસંગે તેના બધા સહપાઠી શોક વ્યક્ત કરવા ફણો ઉઘરાવી ફૂલો આપવાનું નક્કી કરે છે. ‘ફૂલ આપવા કોણ જશે ?’ એવા બેઈથવેઇટના પ્રશ્નના જવાબમાં વર્ગિંગ સ્મશાન જેવી શાંતિ પથરાઈ જાય છે. બેઈથવેઇટના ગુસ્સા સામે મીસ જોસેફ જવાબ આપવાની હિંમત કરે છે – ‘અમે નહીં જઈ શકીએ. કાળા લોકોના ઘરમાં જઈએ તો લોકો શું કહે ?’ અને બેઈથવેઇટ સાવ ભાંગી પડે છે. વાતો, દૃષ્ટાંતો, ભણતર બધું જ નકામું નીવહ્યું. આ લોકો એના એ જ રહેવાના. માત્ર ચામડીનો રંગ જોનારા, માણસની અંદર તેઓ કદી નહીં જોવાના...આવું આવું વિચારતા તે વર્ગ છોડીને ચાલ્યા જાય છે. શાળાના હેડ મિ. ફ્લોરિયન તેમને સમજાવે છે. સિલેસ આ લોકો સાથે જે ઉછયો છે, મોટો થયો છે. બધાને એના પ્રત્યે લાગણી પણ છે. છતાં એ લોકો એક સૂગથી, રૂઢિથી બંધાઈ જયેલા છે.’ આમ પણ મિ. ફ્લોરિયનને આ બાળકોમાં ગજબનો વિચાંસ છે. આ બાળકો પ્રત્યે તેમને સહનુભૂતિ છે. બાળકોને કોઈ જાતની સજી કરવામાં તે નથી માનતા. બાળકોને તેઓ માત્ર શાળાનાં ધોરણોથી નથી માપતા. આ બાળકો જે ઘરમાંથી આવી રહ્યા છે ત્યાં ખાવા-પીવાના, કપડાંના સાંસા છે. એક જ ઓરડામાં રહેતાં આ બાળકો સમજણાં થાય એ ઉમરે પણ એમનાં બીજાં ભાઈબહેન જન્મતાં હોય છે. આવી સ્થિતિમાં આ બાળકો પાસેથી તમે બીજી કઈ અપેક્ષા રાખી શકો ? પોતાની આ માન્યતાઓનું લાંબું ભાષજા મિ. ફ્લોરિયન બેઈથવેઇટને શાળાના પ્રથમ દિવસે પણ આવું જ હતું. મિ. ફ્લોરિયનની સમજાવથી કંડા પડી

બેઈથવેઈટ વર્ગંડમાં પાછા ફરે છે ત્યારે પામેલા ડેર એ કૂલો આપવા જવાનો પહુંચાર સીકારે છે. સિલેસના ઘરે જતી વખતે પણ લેખક મનોમન આવું જ વિચારે છે : વેશ્યા હોય કે દલાલ હોય, કે ખૂની હોય પણ જો ચામડી સફેદ હોય તો ચાલે. પણ ગમે તેટલા સજજન, વિવેકી, બુદ્ધિશાળી હોવા છતાં ચામડી કળી હોય તો ! જાડો આપોઆપ જ તે વક્તિ વિકારવાયોગ્ય બની જાય છે. આ બધા વિચારોથી બેઈથવેઈટનું મોં કઉવાશથી ભરાઈ જાય છે. પણ જ્યારે તે સિલેસના ઘરે પહોંચે છે ત્યારે સત્ય થઈ જાય છે. તેના વર્ગનાં બધાં જ છોકરાછોકરીઓ ત્યાં કટારબદ્ધ હાજર હોય છે. અને જરાય શરમાયા વગર બેઈથવેઈટ આંખમાં છલકાઈ ગયેલાં આંસુ વૂછે છે.

આ પુસ્તકનો દરેક પ્રસંગ આ અનુભવકથાને એક નવો વળાંક આપે તેવા સંતેદનથી ભરેલો છે. પ્રસંગોની સાથે જ પાત્રો ઉઘડતાં આવે છે. લેખકના કોઈ આયાસ વગર પણ અહીં દરેક પાત્રને તેનો આગવો રેંગ પ્રદાન થઈ શક્યો છે. આ બાળકોમાં જરાય વિશ્વાસ નહીં ધરાવતા મિ. વેસ્ટનની સામે બાળકોમાં અપૂર્વ શ્રદ્ધા ધરાવતા મિ. ફ્લોરિયન છે. પામેલા ડેર અને તેની માતાના પ્રસંગ દ્વારા અને ફન્મેનના જેલ જવાના પ્રસંગથી લેખક આ લોકોનાં જીવન નજીકથી દેખાડે છે. પામેલા ડેરનો 'સર' પ્રત્યેનો પ્રેમ ઉંઘાંઘણો નથી. બેઈથવેઈટ-જિલ્લિયનના પ્રેમ વચ્ચે પણ તે નથી આવતી. શાળાના છેલ્લા દિવસે માત્ર તે સર સાથે અન્સ કરવાની માગણી કરે છે. પામેલા ઉપરાંત ડેન હેમ, સિલેસ, ફન્મેન...આમાંથી એક પણ પાત્રને વાચક ધારે તો પણ ભૂલી નહીં શકે.

આ બાળકો કોઈ એક દિવસે આહ્યા બનશે એવી કોઈને પણ શ્રદ્ધા ન હતી ત્યાં બેઈથવેઈટ તેમનામાં ચ્યામ્પારિક પરિવર્તન લાવી શકે છે. શાળા છોડતી વખતે આ બાળકો કબૂલે છે કે સર, તમે જ અમને માણસ બનાવ્યા. અને તેમને સાચા હદયનો પ્રેમ અને આભાર વ્યક્ત કરવા મિ. ફ્લોરિયનની હાજરીમાં એક મોહું પાર્સલ તેમને ભેટ આપે છે. જેના પર લખ્યું હતું 'To Sir, with love.' અને જેમની સાથે ખરેખર જ પ્રેમનો નાતો બંધાઈ ગયો હતો તે વિશ્વાસીઓ પ્રત્યે બેઈથવેઈટ આત્મસંતોષભર્યું સિત ફરકાવે છે.



'દુસર વીથ લવ'ના અનુસંધાને લખાયેલી બેઈથવેઈટની બીજી અનુભવકથા 'PAID SERVANT'-માં (New English library London, 1962) પણ માણસાઈની એવી જ અનેરી હુંક અનુભવાય છે. નવ વર્ષ શાળામાં કામ કર્યા પછી મિ. બેઈથવેઈટને ડિપાર્ટમેન્ટ ઓફ ચાઈલ્ડ વેલ્કેરમાં વેલ્કેર ઓફિસર તરીકે નીમવામાં આવે છે જ્યાં તેમનું ખાસ કામ અનાથ કાળાં બાળકો માટે પાલક માત્રપિતા શોધવાનું છે. કાળા-ગોરા વચ્ચેનો ભેટ આ પુસ્તકમાં વધુ આકોશભરી રીતે વ્યક્ત થયો છે. ગોરા તો ઠીક પણ ખુદ કાળા લોકો પણ વેલ્કેર ઓફિસર તરીકે તેમને કચવાતે મને અને કચણે મોઢે જ આવકારે છે. એમની ઉપરી ઓફિસર પણ કાળા-ગોરાના રૂઢિગત પૂર્વગ્રહોથી પિડાઈ રહી છે. દરેક પગલે, પ્રસંગો - સહકાર્યકરો પાસેથી પણ - બેઈથવેઈટને 'Yours People' સંભળતું પડે છે જે એમને અકળાવી મૂકે છે. દરેક પગલે એમને સંઘર્ષ કરવો પડે છે, ક્યારેક તેઓ મગજ ગુમાવી પણ બેસે છે પણ અંતે તેમનાં અખૂટ ધીરજ, અંત અને નિષ્ઠા તેમને દરેક કાર્યમાં સફળતા આપાવે છે.

આ બંને પુસ્તકો સાથે વાંચનાર એક બાબતે જરૂર સંમત થશે કે બેઈથવેઈટની અનુભવકથાઓ આપણાને નવલકથા જેવી વધુ લાગે છે. (ધારાં પુસ્તકાલયોએ તેનું વર્ગાકરણ નવલકથા તરીકે કર્યું છે !) કોઈ એકાદ પાત્રને અનુભવકથાની ધરી બનાવી તેની આસપાસ અન્ય પ્રસંગો ગૂંધ્યે જતા લેખકની દૃશ્ય અને સંવાદોની સંકલનામાં એક સફળ નવલકથાકરણનાં દર્શાન થાય છે. રોડી નામના કાળા અનાથ બાળકની આસપાસ લેખક પોતાના અન્ય અનુભવો ગૂંધતા ગયા છે. પુસ્તકના આરંભે જ લેખકને અથડાઈ જતી અજ્ઞાની યુવતીની પીડા આપણાને વિજાતી હો છે. બાપ સાથેના

અણાબનાવને કરણે ઘર છોડતી આ છોકરી ધ્યેયપૂર્તિ માટે પોતાનું સંઘળું હોડમાં મૂકે છે. અને એક સંઝે તેનો બાપ જ તેનો આહક થઈને આવી ચેત છે. એકબીજા સામે ક્ષણભર તાકી રહ્યા પછી ભાગી છૂટતા બાપનો પગલાંનો અવાજ દિવસો સુધી પેલીનો પીઠો નથી છોડતો. સાથ જ અજાહી વાક્તિ પાસે બધું જ કહીને હળવી થતી યુવતી આપણને ભારેખમ બનાવી મૂકે છે. રોડીની મા સાથેની લેખકની મુલાકાત, એક વર્ષની બે છોકરીઓને લેવા જતા લેખકને ટેકસી ડ્રાઇવરે કરેલી મદદ જેવા પ્રસંગો કે અંતે એક સુખી કુટુંબમાં ગોઠવાયેલા રોડીને જોઈને બ્રેઇથવેઈટને થતો આનંદ... આ પીડા, હળવાશ કે આનંદમાં વાચક પણ લેખક જેટલો જ ઓતપ્રોત થઈ જાય છે.

આ બંને પુસ્તકોમાંનું હલાલી નાખનાનું વાસ્તવજગત અને અસરકારક બનતી લખાવટ આપણા મન પર એક અમીટ છાપ છોડી જાય છે. □

### ધૂમકેતુ નવલિકા પુરસ્કાર

ધૂમકેતુ પરિવાર અને ગૂર્જર પરિવાર તરફથી છેલ્લાં ત્રણ વર્ષના દુંકી વાતનિં શેષ સંગ્રહને રૂ. ૫૦૦૦નું પારિતોષિક આપવાની યોજના અન્વયે, ૧૯૮૪માં આ પારિતોષિક આપવા માટે ૧૯૮૧, '૮૨, '૮૩માં પ્રગત થયેલ નવલિકાસંગ્રહો પૈકી ઉત્તમ નવલિકાસંગ્રહ તરીકે શ્રી હિમાંશી શેલતકૃત 'અંધારી ગલીમાં સફેદ ટપકાને પસંદ કરવામાં આવેલ છે.

કોઈપણ સાહિત્યકૃતિનું અસ્તિત્વ સ્વાયત્ત હોય છે એમાં શંકા નથી. મારો પોતાનો પક્ષપાત સાહિત્યકૃતિને એક સ્વાયત્ત પદાર્થ ગણી એની કૃતિ-આકૃતિલક્ષી તપાસ કરવા તરફ છે. પરંતુ હું એ વાત વીસરી શકતો નથી કે કોઈપણ સાહિત્યકૃતિ અવકાશમાં સજીતી નથી. એનું સર્જન કરનાર એક મન હોય છે, એ મનને એનું જીવન હોય છે, જીમાજ હોય છે, સંદર્ભો હોય છે. તો આ બધાની આણકારી સાહિત્યકૃતિની સમજમાં, એના આસ્વાદમાં આપણાને સહાયરૂપ ન થાય? આપણા આસ્વાદને સમૃદ્ધ ન બનાવે? ... આ જાતની વિવેચનાનાં ભયસ્થાનો હું જાણું છું. આવી વિવેચના આપણાને મૂળ કૃતિથી દૂર લઈ જાય. આપણા મનમાં પૂર્વગ્રહનું પોતલું પણ બંધાવી આપે, પણ આવાં જોખમોથી તરીને વિવેચનની આ દિશા બંધ કરવા જેવી ખરી? એમ જોવા જઈએ તો તો વિવેચન પોતે જ એક જોખમ છે. પછી તો આપણો વિવેચનના નિષ્પયોજનનું જ સમર્થન કરવાનું રહે.

[‘ગુજરાતી સાહિત્યવિવેચન’ (૧૯૮૪)માંથી]

—જ્યંત કોઠારી

સણગતાં સૂરજમુખી - અનુ. વિનોદ મેધાશ્રી, ૧૯૮૪. ઢ. ૫૧૨, રૂ. ૧૫૦. ચિત્રકલાકાર વાન ગોગનું જીવન આદેખતી અરવિંગ સ્ટોનની નવલકથા 'લસ્ટ ફોર લાઈફ'નો અનુવાદ

#### □ અન્ય પ્રકાશકો

ભવાઈ તત્ત્વચર્ચા - સં. લવકુમાર દેસાઈ, મહેશ ચંપકલાલ. અક્ષરા પ્રકાશન, વડોદરા ૧૯૮૩. ઢ. ૮૮૮, રૂ. ૪૦. ભવાઈ વિશે અભ્યાસીઓ પાસેથી પ્રામ કરેલા લેખોનું સંપાદન.

મા, તારે ચરણ-કુમદે - ધીરજલાલ ઠક્કર, ૧૯૮૪ પ્રકા. લેખક, ન્યૂજર્સી, ઢ. ૭૮, રૂ. ૩૦. કાલ્યસંગ્રહ

ડૉ. જ્યંત ખર્ચી : સમગ્ર વાર્તાઓ, એસ.એન.ડી.ડી. યુનિવર્સિટી, મુંબઈ-૨૦, ૧૯૮૪. ઢ. ૫૨૮ રૂ. ૨૦૦. સુરેશ દલાલના અભ્યાસલેખ સાથેનો સમગ્ર સંચય

૧૯૮૧ની સાલનું ગ્રંથસ્થ વાક્ય - સમીક્ષક : મધુસૂદન પારેખ, ગુજરાત સાહિત્યસભા, ૧૯૮૩. ઢ. ૧૮૯, રૂ. ૫૦. ૧૯૮૧ના વર્ષમાં પ્રકાશિત પુસ્તકોમાંથી સાહિત્યસભાને મળેલાં પુસ્તકોની સમીક્ષા.

ઉગતા સૂરજનાં તેજ અપાર - ઈચ્છર પરમાર, પ્રવીજી પુસ્તક બંડાર, રાજકોટ, ૧૯૮૩. ઢ. ૧૧૪, રૂ. ૪૦. બાળકો-દિશોરોને પ્રેરક બને એવાં રસપ્રદ ને ટૂંકાં ચરિત્રોનો સંગ્રહ.

નરસિંહ મહેતા - જ્યંત કોઠારી, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, ૧૯૮૪. ઢ. ૮૬, રૂ. ૧૫. નરસિંહ વિશેનો લઘુગ્રંથ-

હૂઠી જમીન, તર્થું જીવન - દિલીપ રાણપુરા, ઉત્તમ સાહિત્ય પ્રકાશન, સુરેન્દ્રનગર, ૧૯૮૪. ઢ. ૧૩૨, રૂ. ૫૦. જ્યાશય યોજનામાં વિસ્થાપિતોને થતા ઉચિત ન્યાયને આદેખતું પુસ્તક

ભવાઈ : નટ, નર્તન અને સંગીત - ફુલ્ઝકાળ કડકિયા, યુનિવર્સિટી ગ્રંથનિર્મળ બોર્ડ, અમદાવાદ, ૧૯૮૪. ઢ. ૨૩૬, રૂ. ૫૮. ભવાઈ વિશેનો અભ્યાસગ્રંથ.

રચના શિલ્પની દૃષ્ટિએ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ટૂંકી વાર્તા - સુધા આર. કાકા, પૂર્વી પુસ્તક બંડાર, અમદાવાદ-૧૫, ૧૯૮૪. ઢ. ૫૦૪, રૂ. ૧૫૦. પીએચ.ડી.નો શોધનિબંધ.

કાયદામાં હસીભુશી - સંકલનકર્તા એ.એન. કારીઆ, સી. જમનાદાસની કંપની, અમદાવાદ, ૧૯૮૪. ઢ. ૪૮, રૂ. ૮. કાયદાવિષયક ટુચકાઓનો સંચય

વક્તુત્વ : એક કસબ - એ. એન. કારીઆ, ગુર્જર,

અમદાવાદ, ૧૯૮૪. કા. ૭૨, રૂ. ૧૫. વક્તુત્વ-કળાની છાણાવટ કરતું માર્ગદર્શક પુસ્તક.

મસ્તીની પળોમાં - રત્નિલાલ 'અનિલ', કંકાવટી પ્રકાશન, સુરત, (ગૃહી આ.) વર્ષ લખ્યું નથી. કા. ૧૧૦, રૂ. ૨૫. મુક્તકસંગ્રહ.

સિંહસનબત્તીશી (શામળ) - ગ્રંથ : ૧ સં. અંબાલાલ બુ.

જાની, કાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૮૪ (ગૃહી આ.) કા. ૭૬૮, રૂ. ૨૦૦. સિંહસન - બતીસીની પહેલી ૧૫ વાર્તાઓનું સટીપ્પજ શાસ્ત્રીય સંપાદન

સાક્ષીભાવ - હરેશ 'તથાગત', ગંગલ પરિષદ, રાજકોટ-૩, ૧૯૮૪. કા. ૮૦, રૂ. ૩૭. ગંગલ સંગ્રહ.

લીનું આકાશ - પ્રદીપ પંડ્યા, અમી પલ્લિકેશન, અમદાવાદ. વિકેતા નવભારત, ૧૯૮૪. કા. ૨૭૫, રૂ. ૫૩. નવલકથા

સંધિકાળ - રવીન્દ્ર પારેખ, સાહિત્યસંકુલ, સુરત-૩, ૧૯૮૪. કા. ૧૪૨, રૂ. ૩૩. ટૂંકીવાર્તાઓનો સંગ્રહ.

સાહિત્ય-અમૃત - તુલસીભાઈ પટેલ, પ્ર. લેખક, વિતરક મુદ્રા પ્રકાશન, મહેસૂદાણ, ૧૯૮૪. કા. રૂ. ૪૦. 'સાહિત્યની પ્રસ્તુતતા' નામના ભૂમિકાલેખ સરેત ગ્રંથસમીક્ષાઓનો સંગ્રહ.

અખાના શ્રેષ્ઠ છિપ્પા - સં. શિવલાલ જેસલપુરા, નવભારત અમદાવાદ, ૧૯૮૪. કા. ૮૬, રૂ. ૨૫. પસંદ કરેલા ૧૫૭ છિપ્પાના અર્થ, અભ્યાસલેખ સાથે.

નેમિનાથ રાજિમતી બારમાસા - સં. શિવલાલ જેસલપુરા, સાહિત્યસંશોધન પ્રકાશન, અમદાવાદ, ૧૯૮૪. કા. ૬૦, રૂ. ૧૫. જ્યવત્તસૂર્યિકૃત બારમાસાનું અર્થ ટિપ્પજ સાથે સંશોધિત સંપાદન.

ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ - પ્રમોદકુમાર પટેલ, પ્ર. લેખક, વલભવિદ્યાનગર, ૧૯૮૩. ઢ. ૨૫૪+૮, રૂ. ૮૮. આધુનિકતાવાદ અને કફિતાઓ પરના લેખોનો સંગ્રહ.

સુષ્ણોરે ભાઈ સાદ - અતુલ શાહ (મુનિહિતરુચિવિજ્ય) વિનિયોગ પરિવાર, મુંબઈ, સં. ૨૦૪૭ (૧૯૮૨). પ્રામિસ્થાન : આર. આર. શેઠ, નવભારત, મુંબઈ...વગેરે.] ઢ. ૮૨, રૂ. ૨૦. વિચારકેન્દ્રી ને જીવનપ્રબોધક લેખોનો અમૃત શર્માએ સંપાદિત કરેલો સંગ્રહ.

સાત્ત્વિદ્ય - બાલકુમાર ગોર 'ભૈરેય' પ્ર. લેખક, મુંબઈ

૧૯૮૪. કા. ૧૦૪, રૂ. ૨૦. કાવ્યસંગ્રહ.

પૃથ્વીગતિનો છંદોલય - ઉશનસ્કુ ગુજરાત વિદ્યા-  
સભા-અમદાવાદ ૧૯૮૮. અધ્યક્ષમાઠ પૃ. ૪૦, રૂ.  
૧૦. સૌનેટમાળા રૂપ ૨૭ કાવ્યોનો સંગ્રહ.

વિજ્ઞાન-અનુરાગ - રમેશ પટેલ, વિ. નવભારત.

મુખ્ય-અમદાવાદ, ૧૯૮૮. કા. ૨૦૦, રૂ. ૩૮.  
શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉપયોગી વિજ્ઞાન-  
વિષયક સર્વભોગ્ય લેખાનો સંગ્રહ.



### વાસ્તવનું બલિદાન લેતી કલા : બેઝ

હું એન્નિયાસ સ્ટ્રાયાખરનું 'શીલજ ફ્લાઇટ ફોમ સ્કુરગાઈ' વાંચી રહ્યો છું. એરિસ્ટોટલની રંગભૂમિ અને તેથી બિન એવી રંગભૂમિઓ વચ્ચેના તણવત જેનાં મૂળ છે, તેવી રચનાપદ્ધતિની હું નોંધ કરું છું. સ્ટ્રાયાખર નાટ્યાત્મક દૃશ્યો તથા એકોકિંચાની યોજનાનુસાર રચના કરે છે, કૃતિના 'રંગન-રસીલા ખંડો' (પર્વલ પેસેજિઝ)ને તે ખાસ મહત્વ આપે છે, અને જ્યાંજ્યાં અસરો પણી હોય ત્યાંના પ્રવેશકોની તે બરાબર સંભાળ રાખે છે. પ્રત્યેક વસ્તુ ઉત્સાહ પ્રગતાવવાની યોજનાને વશ વર્તતી હોય છે, જે તમને સચોટ પકડમાં રાખે છે, તમને નેતૃક તેમજ રસની દૃષ્ટિએ આનંદિત કરે છે : ઉચ્ચાશાલી પાત્રો, તંગ ગુંઘવણો, વાકદંટાવાળા ધૂમધાડકા, પ્રબળ રાગાવેશોનાં પ્રદર્શનો થાસ થંબાવી દેતા વાદવિવાદોની ઉકેરણી - આ બધું પ્રેક્ષકોને અભિભૂત કરી દે તેવી અસરો નિષ્પત્ત કરે છે, અને એ તમાશો એકાએક સમાન થઈ જાય છે... આમાં વાસ્તવના પ્રસ્તુતીકરણ ઉપર નાટ્યાત્મકતા પૂરેપૂરી હાવી બને છે.

માનવજીતને પોતાના માનવ્યમાં જે છાવતુભૂત રસ છે, જે રસ રંગભૂમિમાં અભિવ્યક્તિ પ્રાપ કરી શકે છે, અને જે બધી લાગણીઓની, બધા ભાવોની આધારશિલા છે, તે રસ આવી કૃતિઓમાં મુખ્યત્વે રંગભૂમિની કણા પૂરતો, કેવળ રંગાંચં પરની ભજવણી પૂરતો મયાંદિત બની જાય છે. બટકબોલા થઈને કહીએ તો, નાટ્યકારને, જે વસ્તુનું પ્રતિનિધાન કરાય છે - એટલે કે માણસમાણસ વચ્ચે (અને તેમની ભીતર) જે કંઈ બને છે, તેમાં રસ નથી, પરંતુ એ પ્રતિનિધાન દ્વારા, એ પ્રયોગ દ્વારા જે લાગણીઓ ઉદ્ભૂત કરી શકાય છે તેમાં જ માત્ર રસ છે... સ્ટ્રાયાખરને મુખ્યત્વે રંગભૂમિ, અને રંગભૂમિને માટે વિષયવસ્તુઓ અને લાગણીઓ વાપરવાની તક - એ જ લખવા પ્રેરે છે. અને પરિણામે એવી કલા ઉદ્ભવે છે, જે વાસ્તવના સંપર્કમાં હોય છે ખરી, વાસ્તવનો સમાવેશ કરતી હોય છે ખરી, પરંતુ જે વાસ્તવને સંપૂર્ણપણે કલાનું બલિદાન બનાવી દે છે.

[બેઝોલ બેઝ : જનલ - ૧૯૮૪-૧૯૮૫] સં. વિલેટ અને મેનાખાયુમ, ૧૯૮૩. (અનુ. હરિવલ્લભ ભાયાણી)  
લી. મે, ૧૯૮૧ની નોંધમાંથી. પૃ. ૧૪૮.]

## આ અંકના લેખકો

**ચન્દ્રકાન્ત ટોપીવાળા:** કવિ, વિવેચક, સંપાદક

નિયામક, ક. લા. સ્વાધ્યાય મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ,  
અમદાવાદ-૮

૩/૬, પૂરોશ્વર ફ્લેટ્સ, ગુલબાઈ ટેકર, અમદાવાદ-૧૫

**શાંતિલાલ મેરાઈ:** કવિ, વિવેચક, અનુવાદક

ગુજરાતીના અધ્યાપક, આર્ટ્સ કોલેજ, વારા  
૧૭, અજિતનાથનગર, વારા (દ. ગુજ.)

**જગદીશ ગુર્જર:** વિવેચક

ગુજરાતીના અધ્યક્ષ, આર્ટ્સ કોલેજ, અંકલેશ્વર  
૨૬, રામનગર સોસાયટી, અંકલેશ્વર-૩૮૮૦૦૧

**સિલાસ પટેલિયા:** વિવેચક

ગુજરાતીના અધ્યાપક, આર્ટ્સ કોલેજ, વારા  
કાન્પુરા, જનક સમારક હોસ્પિટલ રોડ, વારા

**મનોજ ઓંઝા**

સેક્શન અધિકારી, તકેદારી આયોગ, ગાંધીનગર  
'આયામ', પ્લોટ ૫૮૦/૧, સેક્ટર-૩૦,  
ગાંધીનગર ૩૮૨૦૩૦

**રમણ સોની:** વિવેચક, સંપાદક, રીડર

ગુજરાતી વિભાગ, મ.સ. યુનિ. વડોદરા-૨  
ઈ/૨, તારાબાગ, પોલિટેકનિક વડોદરા-૨

**વિજય શાસ્ત્રી:** વાર્તિકાર, અનુવાદક, વિવેચક

ગુજરાતીના અધ્યક્ષ, એમ.ટી.બી., કોલેજ, સુરત-૧  
એમ.ટી.બી. કોલેજ કેમ્પસ, સુરત-૧

**પ્રમોદ્કુમાર પટેલ:** વિવેચક, અનુવાદક

ગુજરાતીના નિવૃત્ત અધ્યાપક  
૨૬ એ, અક્ષરધામ સોસાયટી, અકોયા ગાર્ડન પાસે, વડોદરા.

**અંજ્ય રાવલ:**

ગુજરાતીના અધ્યાપક, આર્ટ્સ કોલેજ, સંતરમાપુર (પંચમહાલ)

**શરીઝા વીજળીવાળા:** વિવેચક, અનુવાદક

ગુજરાતીના અધ્યાપક, એમ.ટી.બી. આર્ટ્સ કોલેજ,  
અઠવા લાઈન્સ, સુરત ૩૮૫ ૦૦૧



અંગેજ શાસનના પ્રારંભિક તબક્કામાં પ્રસરેલો પાશ્ચાત્ય મૌહ ઓસર્યા પણીનો આપણી પ્રાચીન સંસ્કૃતિ પરત્વેનો પુનર્જગરણ કાળ હોય, આર્થિક - દોષથી મુક્ત હોવાને લીધે જેમને સમય ખર્ચવાની લક્જરી પોસાય છે એવાં સાધુ-સાધ્વી જ્યારે એ વિષયની જ ચર્ચા કરવા બેઠાં હોય ત્યારે 'ઘોગની' પરિભાષા અને એનેટોમીની પરિભાષાની તુલના' ન થાય તો જ નવાઈ - એવો મારો નમ્ર મત છે.

પાત્રનું મહત્વનું કાર્ય જો પ્રવચનનો આપવાનું હોય તો આએ-આખું પ્રવચન આવી જાય - જેને પરિષામે પાત્રનો વધુ ઉઘાડ શક્ય બને (આપણા લિજેન્ડ્રી પ્રોફેસર સદ્ગત એસ આર. બહુનું પાત્ર, એમના એકેય લેક્ચર વિના આવેલી શક્ય ખરું ? અરે, એકંકી જેવા 'ઈકોનોમી'-પ્રતિષ્ઠા સ્વરૂપમાં પણ ભાષણો આવેલાં છે ન !) - એ બનવાજોગ નથી ? અને... 'દીક્ષાવિધિ'ને ('પ્રક્રિયા' શબ્દ વધારાનો છે), વિદ્ધો પાર કરીને આવેલી આતુર દીક્ષાર્થીની આંખે

જોઈએ તો ? અલબાટા, મતાંતર સ્વીકાર્ય છે.

અરે, 'મળેલા જીવ' અને 'માનવીની ભવાઈ'માં આવતી આખે-આખી લોકવાતાઓ, શરદ-યગોરની નવલકથાઓમાં પાનાંના પાનાં ભરી દેતી ચચાઓ ઈત્યાદિના હવાલા આપી, બચાવ મજબૂત કરવાનો ઉપકમ નથી.

લેખકને દૂર રાખી, એક વાચકની હેસિયતથી આ લખાયું હોવા છતું, મારે પક્ષે વિવેચનમાં ઉત્તરનું એ અવિવેક જ નહિ, અનધિકાર ચેષ્ટા પણ બની રહે. આપણા સંનિષ્ઠ અને નીવડેલા વિવેચકો પરત્વ આદર ધરાવતો એવો કું, રમણ સોનીએ ચીધેલા અન્ય મુદ્દાઓ શિરોધ્યાર્થ ગણી, 'વિકિમા'ની સમીક્ષામાં એમજો જે સામચર્ય દ્વારાયું છે તે બદલ અમિનંદન આપવાની લાગજી સેવતા 'પ્રત્યક્ષ'ના વાચકોમાં મારો પણ સમાવેશ કરું છું.

ગાંધીનગર, ૧૪-૧૧-૮૪ - ભાનુપ્રસાદ ત્રિવેદી

વિવેચકોએ શું કરવું એ વિશે કોઈ ધર્મચાર્યની અદ્યાથી આદેશ આપવાનો આ સમય નથી. છતાં સાહિત્યનું મૂલ્ય આજના સમાજમાં સ્થાપવાનો પુરુષાર્થ તો એણો કરવાનો જ છે એ વિશે કોઈ અસંમત નહીં થાય. લોકશાહીના સિદ્ધાંતનું સર્વ ક્ષેત્રોમાં થતું આરોપણ, પ્રવર્તમાન સામાજિક સંદર્ભ સાથેની સાહિત્યની પ્રસ્તુતતાનો આગ્રહ, પરંપરાગત ઉત્કર્ષનાં ધોરણો પરત્વેની ઊમાડોળ પરિસ્થિતિ અને 'High Culture'નાં મૂલ્યો વિશે ઉભી થયેલી સંદેહવૃત્તિ - આ બધાને કારણો જે વાતાવરણ ઉભું થયું છે તેમાં આજના સાહિત્યકારે, વિવેચકે અને સાહિત્યના અધ્યાપકે પ્રવૃત્ત થવાનું છે.

[‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના ૨૫મા સંમેલન  
(બાવનગર, ૧૯૭૪)માં કરેલું વક્તવ્ય : ‘અધીત’ (૭૪)માંથી]

- સુરેશ જોશી

વार्षिक सूचि  
वર्ष ૩ □ ૧૯૮૪

સ. ૦૨ ગી. ૨૫૬ ૧૨

અંકકમ ૧ જાન્ય.-માર્ચ ૨ એપ્રિલ-જૂન ૩ જુલાઈ-સપ્ટે. ૪ ઓક્ટો.-ડિસે.

૧

### ગ્રંથનામ

[ક્રમ : ગ્રંથનામ, (લેખક), અંકકમ, (પૃષ્ઠકમ)]

#### કવિતા

- ક્રીસમાં (પ્રબોધ પરીઘ), ૪ (૫)
- દાખલા તરીકે સ્ત્રી (નીતા રમેયા), ૩ (૩૭)
- મુખ્યમુખ (સતીન દેસાઈ), ૩ (૩૭)
- ચાત આતી ગઈ (અમીન અચ્છાદ), ૨ (૨૪)
- રોમાંચ નામે નગર (ઈન્દ્ર પુવાર), ૩ (૫)
- સાત અક્ષર (નિરંજન યાણિક), ૧ (૨૪)
- સૂર્યો જ સૂર્યો (સંસ્કૃતિરાષ્ટ્રી દેસાઈ), ૧ (૫)
- 
- બલાકા (રવીન્દ્રનાથ, અનુ. રાહેન્દ શાહ) ૩ (૩૮)

#### વાર્તા

- માયાવિની (પુરુણ જોશી) ૩ (૭)
- રાતવાસો (મણિલાલ હ. પટેલ) ૪ (૭)
- લાઠાદાદાની બાળવાતર્ભા (લાભશંકર ઠાકર), ૩ (૩૮)
- સંબંધ વિના સેતુ (જોસેફ મેકવાન), ૪ (...)
- હજ્યે કેટલું દૂર ? (યોગેશ જોશી), ૩ (૧૦)

#### નવલકથા

- અન્જિમેધ (વિભૂત શાહ), ૨ (૬)
- આતશ (કિશોર જાદવ), ૨ (૩)
- વિકિમા (ભાનુપ્રસાદ નિરેદી), ૩ (૧૩)
- ધર્મસન (લાભશંકર ઠાકર), ૨ (૧)

#### નાટક

- ઈન્દ્ર પુવારનાં બાળનાટકો (ઈન્દ્ર પુવાર), ૨ (૨૭)
- ઔરંગજેબ ધારે ખલીજનો વેશ (ચિનુ મોદી), ૩ (૧૬)
- ઘર વગરનાં દાર (રવીન્દ્ર પારેખ), ૧ (૭)
- 

- પ્રહસનયુગમ (અનુ. વિજય પંડ્યા), ૨ (૨૫)

#### નિબંધ-મ્રવાસ-ચારિત્ર

- ઈશરાખા તરે નામ (ગુણવંત શાહ), ૪ (૧૪)
- જીવનપાથેય (હરીશ દિરેટી), ૧ (૧૦)
- નવી દિશા (સ્વામી સચ્ચિદાનંદ), ૨ (૭)
- નીરખને (મંજુ જીરેટી), ૩ (૨૦)
- મજબૂલ નહીં સિખાતા (યાસીન દ્વાલ), ૧ (૧૧)
- રેલવેસ્ટેશન (હર્ષદ કાપડિયા), ૪ (૧૧)
- સરિતાઓના સાનિધ્યમાં (રામપ્રસાદ શુક્ર), ૧ (૨૫)
- 
- અણીની રોજનીશી (અનુ. માવજી સાવલા), ૩ (૨૨)

#### વિવેચન-સંશોધન-ભાષાવિજ્ઞાન

- કાવ્યરસ (વિજય શાસ્ત્રી), ૧ (૨૬)
- ગુજરાતી બાલકથાસાહિત્ય (શ્રદ્ધા નિરેદી) ૨ (૧૩)
- ગુજરાતી સાહિત્ય વિવેચન (જ્યંત કોઠારી) ૪ (૧૬)
- જોડાકારવિચાર (હિતવિજ્યજી મહારાજ), ૧ (૧૮)
- તર્જનીસંકેત (ઉત્પલ ભાયાણી), ૩ (૨૮)
- પાણિમનું સાહિત્યવિવેચન (શિરીષ પંચાલ), ૨ (૮)
- પ્રતિમુખ (સતીશ વ્યાસ), ૨ (૧૭)
- મુક્તારીંગ કવિતા (દીપક રાવલ), ૧ (૨૬)
- લોકવાઙ્ય (કનુભાઈ જાની), ૨ (૨૨)
- વાંકદેખાં વિવેચનો (જ્યંત કોઠારી), ૩ (૨૬)
- વિવેચનનો વિધિ (શાયેશ્વામ શર્મા) ૨ (૧૪)
- શબ્દસંગ (શાંતિલાલ મેરાઈ), ૨ (૨૫)
- 'સંસ્પર્શ'... આદિ (કૃષ્ણાંગ દીક્ષિત), ૪ (૧૭)

#### સંપાદન

- અધીત સત્તર (સં. ઉપા ઉપાધ્યાય વ.) ૨ (૨૬)
- અનુઆધુનિકતાવાદ (સં. ચંદ્રકાન્ત ટોપીવાળા, ભોળાભાઈ પટેલ), ૧ (૧૩)
- ઉમરવાડિયા : સમગ્રસર્જન (સં. જશવંત શેખરીવાળા, રવીન્દ્ર ઠાકોર) ૪ (૨૪)

સાધુદાસ-સાહિત્ય

૨૨૬

૬

ગ્રામીત જીતિ... અધ્યયન (સં. દક્ષા વ્યાસ, નવીન મોદી), ૨ (૧૮)  
 ગાંધીજિના ક-અ-ગ (સં. મહેન્દ્ર મેઘાશી), ૪ (૨૬)  
 ચિત્તવિચારસંવાદ (સં. કીર્તિદા જોશી), ૪ (૨૧)  
 મહાનિબંધ સૂચિ (સં. પ્રકાશ વેગડ), ૪ (૨૫)  
 સત્ત્વિધાન (સં. સુમન શાહ વ.), ૧ (૨૭)  
 સ્વાતંત્ર્યોત્તર ગુજરાત (સં. શિરીષ પંચાલ), ૩ (૩૦)  
 હીરક કેસૂંડાં (સં. રમણીક મેઘાશી વ.), ૪ (૨૭)

### વિજ્ઞાન

અંધકારનો ઉજાસ (દિવ્યેશ ત્રિવેદી), ૧ (૨૮)  
 જ્ઞાનવિજ્ઞાન (નાનાલાલ વસા), ૧ (૨૯)  
 વિજ્ઞાનવિસ્મય (રમેશ પટેલ), ૩ (૪૦)

### વાચનવિશેષ

અમેરિકા (જ્યોતિર્યાઃ) ૨ (૨૮)  
 ઇન્નિયન વિમેન્સ ઓફોલાયોગ્રાફી), ૧ (૩૦)  
 દુ સર, વીથ લવ (ઈ. આર. બેર્થવેઠટ), ૪ (૨૮)



### ચર્ચાપત્ર

ઉદ્ઘાપોહ વિશે ઉદ્ઘાપોહ હર્ષદ મ. ત્રિવેદી ગ્રાસત્રેય, ૩ (૪૪)  
 કડક ધોરણે જ તપાસસું જોઈએ - ઉકેશ ઓઝા, ૧ (૩૫)  
 જોડણીસુધારના પ્રશ્નો - ભારતી મોદી, ૧ (૩૬)  
 જોડાજોડ જોતું તુલનાસાપેક્ષ અવલોકન - રાધેશ્યામ શર્મા, ૩ (૪૨)  
 નાટ્યશબ્દને મુક્ત કરીએ - હસમુખ બારાડી, ૧ (૩૪)  
 વિક્ષિપાં વિશે... - ભાનુપ્રસાદ ત્રિવેદી, ૪ (૩૭)  
 વિવેકનું નિર્ભાક દર્શન - રાધેશ્યામ શર્મા, ૨ (૩૨)  
 શબ્દસૂચિ ન મૂકવાનો પ્રમાદ - હર્ષદ ત્રિવેદી, ૨ (૩૩)  
 સમ્યક વિવેચના કે ઉલ્લઙ્ગ નિરીક્ષણો ? - બહાદુરભાઈ વાંક, ૨ (૩૩)

### પ્રત્યક્ષીય

બળવંતરાયની સવાંશતાલિંગ, ૧ (III)  
 મેઘાશીનું સાહિત્યિક પત્રકારત્વ, ૨ (III)  
 વાર્ષિક સમીક્ષાપ્રવૃત્તિની સમસ્યા, ૪ (III)  
 શબ્દકોશને અભિમતા, ૩ (III)

### સમીક્ષકો

અજય રાવલ, ૪ (૨૭)  
 કિશોર વ્યાસ, ૧ (૨૩)  
 કીર્તિદા જોશી, ૨ (૮)  
 ચંદ્રકાન્ત ટોપીવાળા, ૪ (૫)  
 જગદીશ ગુર્જર, ૪ (૮)  
 જ્યંત કોઠારી, ૧ (૧૮, ૨૫), ૨ (૧૮), ૩ (૨૨)  
 જ્યંત ગાડીત, ૨ (૧)  
 જ્યેશ ભોગાયતા, ૨ (૩), ૩ (૭)  
 જ્યાવંત શેખડીવાળા, ૨ (૨૨)  
 ઉકેશ ઓઝા, ૧ (૧૧, ૩૪)  
 નગીન મોદી, ૧ (૨૮, ૨૯), ૩ (૪૦)  
 નીતિન મહેતા, ૩ (૨૬)  
 પારુલ માંકડ, ૧ (૧૭)  
 પ્રમોદકુમાર પટેલ, ૪ (૨૧)  
 પ્રસાદ બલભટ, ૩ (૧૦)  
 બહાદુરભાઈ વાંક, ૨ (૩૩)  
 બાબુ સુથાર, ૨ (૨૮)  
 ભરત મહેતા, ૧ (૧૩), ૩ (૧૫)  
 ભાનુપ્રસાદ ત્રિવેદી, ૪ (૩૭)

ભારતી મોદી, ૧ (૩૬)  
 મધુ કોઠારી, ૩ (૨૦)  
 મનોજ ઓઝા, ૪ (૧૪)  
 માય ડિયર જ્યુ (જ્યંતિ ગોહિલ), ૨ (૬)  
 મીનલ દવે, ૧ (૨૬), ૩ (૩૭)  
 રમણ સૌની, ૧ (૫), ૨ (૨૫, ૨૬), ૩ (૧૩, ૩૮), ૪ (૧૭)  
 રાધેશ્યામ શર્મા, ૧ (૩૦), ૨ (૩૨), ૩ (૫, ૪૨)  
 વિજય શાસ્ત્રી, ૨ (૧૪), ૪ (૧૯)  
 શરીફા વીજળીવાળા, ૩ (૩૦), ૪ (૩૭)  
 શાંતિલાલ મેરાઈ, ૧ (૧૦), ૨ (૭), ૪ (૭)  
 સતીશ વ્યાસ, ૩ (૨૮)  
 સિલાસ પટેલિયા, ૪ (૧૧)  
 હરીશ વટાવવાળા, ૨ (૨૪)  
 હર્ષદ ત્રિવેદી, ૧ (૨૪), ૨ (૨૭, ૩૩), ૩ (૩૮)  
 હર્ષદ મ. ત્રિવેદી 'ગ્રાસત્રેય', ૩ (૪૪)  
 હસમુખ બારાડી, ૧ (૩૪), ૨ (૧૭)  
 હિમંતી શેલત, ૨ (૧૩)



## પુસ્તકસીકાર : ભિતાક્ષરી

- આર. આર. શેઠની કંપની, મુંબઈ-૨,  
અમદાવાદ-૧  
અલગ - રાજેશ અંતાણી, ૧૯૮૮. કા. ૨૨૨, રૂ. ૫૦.  
નવલકથા
- ધીર સો ગંભીર - સારંગ ભારોટ (બીજી આ.) ૧૯૮૮  
કા. ૩૪૪ રૂ. ૭૫. નવલકથા
- હથેળીમાં રક્ષા - કનુ અડાતી, ૧૯૮૮. કા. ૨૪+૨૮૪,  
રૂ. ૬૫. નવલકથા
- જ્ઞાનભૂનાં પારિજીત - ગુજરાતં શાહ, (પમી આ.)  
૧૯૮૮ કા. ૧૫૨, રૂ. ૩૫. નિબંધસંગ્રહ
- મા - ગુજરાતં શાહ, સુરેશ દલાલ, સંકલન - હરીન્દ્ર દવે,  
૧૯૮૮. કા. ૪૮, રૂ. ૧૫. વક્તવ્યો
- મહિલા શ્રમશક્તિ - સં. અકાયકુમાર દેસાઈ, નીરા  
દેસાઈ, ૧૯૮૮. કા. ૪૨૮, રૂ. ૧૦૦. સમાજ  
વિજ્ઞાનમાણા અંતર્ગત, મહિલા વિષયક અંગેજ  
લેખોના અનુવાદોનો સંચય
- સાહસિકોની સુર્દિ - અનુ. મૂળશંકર ભંડ (૧૧મી આ.)  
૧૯૮૮ કા. ૧૬+૧૩૨, રૂ. ૫૦ જુલૈ વર્નની  
Mysterious Icelandનો ટૂંકાવેલો અનુવાદ
- આરોગ્ય રલાકર - લાભશંકર ઠાકર, ૧૯૮૮. કા.  
૨૮૮, રૂ. ૫૦ : લેખકના વૈદકવિષયક લેખોમાંથી  
વિસ્મય ઠાકરે સંપાદિત કરેલા લેખોનો સંગ્રહ.  
(ગુયા અંકમાં ભૂલથી ઝોંકું પુસ્તકને રમાદનું પ્રકાશન  
બતાવ્યું હતું.)
- લોકપ્રિય પ્રકાશન, મુંબઈ-૨  
સૂરજની આંખમાં શમણું - પ્રીતમલાલ કવિ, ૧૯૮૮. કા.  
૨૪૦, રૂ. ૮૦. નવલકથા
- અભ્યાવનો દરિયો - રાજેશ અંતાણી, ૧૯૮૮. કા. ૨૩૬,  
રૂ. ૪૫. નવલકથા
- પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ-૧  
ગાંધારી - હસમુખ બારાડી, ૧૯૮૮. કા. ૮૦, રૂ. ૩૦.  
નવલકથા
- જાળિયું - હર્ષદ ત્રિવેદી, ૧૯૮૮. કા. ૧૧૧+૧૪, રૂ.  
૩૦, ટૂંકીવાતાંઓનો સંગ્રહ.
- એક ને એક અગ્યાર - જયંત ગાડીત, મંજુલા ગાડીત,  
૧૯૮૮. કા. ૧૩૬, રૂ. ૩૫. ટૂંકીવાતાંસંગ્રહ

- કુવરબાઈનું માસેરું (પ્રેમાંદ) - સં. લાભશંકર ઠાકર,  
પ્રસાદ પ્રલાભદ, ૧૯૮૮. કૃ. ૧૨૭, રૂ. ૩૦.  
અભ્યાસવેખ ને ટિપ્પણ સાથેનું સંપાદન  
ભારતીય સંસ્કરપરંપરા અને આપણો વર્તમાન -  
ધર્મવળબ્લ ભાયાણી, ૧૯૮૮. કૃ. ૧૭૫, રૂ. ૪૦.  
'પરેપરા અને આધુનિકતા' તથા 'વિગ્રથન,  
અનુઆધુનિકવાદ, દિશાદીન' તથા 'વર્તમાન  
ગતિવિધિ' એ ત્રણ પુસ્તકાંસ લેખોનો સંચય  
ભરતેચૂર બાહુભાવિરાસ (શાલિભદ્રસૂરી) - સં. બળવંત  
જાની, ૧૯૮૮. કૃ. ૨૦૦. રૂ. ૭૦. કૃતિ-કર્તા  
અધ્યયન, ગુજરાતી અનુવાદ સમેતનું મૂળ પાઠનું  
સંપાદન.
- ગ્રંથઘટન - ચંદ્રકાન્ત ટોપીવાળા, ૧૯૮૮. કૃ. ૧૭૮, રૂ.  
૫૦. ગ્રંથાવલોકનોનો સંચય
- ચંદ્રકાન્ત બક્ષીશી ફેરો - સુમન શાહ, (બીજી આ.)  
૧૯૮૮. કૃ. ૨૩૦, રૂ. ૫૦. સતત્ત્વ ધાર્યકાની  
ગુજરાતી નવલકથાનું વિવેચન
- વિવેચનસંદર્ભ - રમણ સોની, ૧૯૮૮. કૃ. ૨૦૮, રૂ.  
૩૫. વિવેચનવિષયક લેખોનો સંગ્રહ.
- રમાદે પ્રકાશન, અમદાવાદ-૧  
અચલ - રમેશ શાહ, ૧૯૮૮. કા. ૧૨૦, રૂ. ૨૭.  
ટૂંકીવાતાંઓનો સંગ્રહ.
- રલમંજરી - રમેશ શાહ, ૧૯૮૮. કા. ૧૦૦, રૂ.  
૨૫. કાલ્યસંગ્રહ
- અમથાભરણ - મેધનાદ ભંડ, ૧૯૮૮. કૃ. ૧૨૦. રૂ.  
૪૯. કાલ્યસંગ્રહ
- ગુરુદેવ અમારે આંગણે અનુ. રમશીક મેધાણી, ૧૯૮૮.  
કૃ. ૨૪૪+૨૬, પુસ્તકાલય આવૃત્તિ રૂ. ૬૭. સુલભ  
આવૃત્તિ રૂ. ૭૩. મૈત્રેયી દેવીના સંસ્કરણકથન  
મંગ્યુ તે રવીન્દ્રનાથનો અનુવાદ
- પ્રસાર, આતાભાઈ અવેન્યૂ, ભાવનગર-૨  
રઢિયાળી રાત - સં. અવેરચંદ મેધાણી પૂર્વે પ્રકાશિત  
ચારેય ખંડોની સંકલિત આવૃત્તિ, ૧૯૮૮. કૃ. ૩૨૮,  
રૂ. ૭૫ (૩૧-૧૨-૬૪ સુધી રૂ. ૫૦). મેધાણીએ  
સંચિત કરેલાં લોકપીતોનો સર્વસંગ્રહ, દરેક ગીતની  
પરિચાયક નોંધ સાથે.

પત્રચર્ચા-વાદ-વિવાદને લગતા આ વિભાગમાં 'પ્રત્યક્ષ' વિશેની સામ્રાત સાહિત્યિક ઘટનાઓ તથા અન્ય સર્વ વિચારપ્રવૃત્તિઓ વિશેની ચર્ચાઓ માટે નિમંત્રણ છે. ગંભીર વિમર્શની સાથે તીવ્ર-સ્પષ્ટ-ધારદાર અભિપ્રાયો પણ આવકાર્ય. અલબાત્ત મંતવ્યો સુચિત્તિત ને લાઘવપૂર્ણ હોય તથા અપરૂપિને ન સ્પર્શિતાં હોય એ આવશ્યક છે.

- સં

### 'વિકિમા' અંગ થોડુંક...

'વિકિમા'ના ઘનિષ્ઠ વાચક તરીકે (ચાર વાર વાંચી છે.) થોડુંક ધ્યાન દોરવા માગું છું. 'કઈ સત્ત્વશીલતા સ્વુહણીય ?' ('પ્રત્યક્ષ' : જુલાઈ-સપ્ટેમ્બર '૮૪)ને શીર્ષસ્થ મુદ્રો બનાવી, રમણ સોનીએ પ્રશ્ન કર્યો છે : 'તો નવલકથાકારે આવો જ આત્મવિચાસ દૃઢાવવાનો ?' (પૃ. ૧૬)

જેને આધારે આ પ્રશ્ન કરવામાં આવ્યો છે તે છે 'વિકિમા'ની પ્રસ્તાવનાનો બીજો પરિચ્છેદ. આ આખો પરિચ્છેદ એક જ વાક્યનો બનેલો હોવાથી, ને તેનાં ઘટક આઠ ઉપવાક્યોમાંથી પ્રથમ બે ઉપવાક્યો જ દૃષ્ટિમાં રહી ગયાં હોવાથી અન્વય છટકી ગયો લાગે છે, વાક્યના વિદેશનું ઉદેશ્ય નજર બહાર રહી ગયું છે. સંબંધિત અન્વય આ પ્રમાણે છે : '— આવી બધી હતાશાઓ વચ્ચે પણ, લોહી ફૂટે એવા શબ્દની સર્જનવ્યથા ભોગવ્યે રાખવાનું પ્રસ્તુત છે એ આત્મવિચાસ' (લંબાણ ટાળવા આખો ફકરો ઉત્પારતો નથી).

'વિકિમા' (અને અમની અન્ય નવલકથાઓ) જોતાં, લેખકનું કૃતિ પર તોળાઈ રહેવું, જાતને લાદવી, પ્રોમ્પ્રર બનનું, અર્થઘટનમાં ફસાનું, ચૈતસિક વ્યાપારોનાં બોલકાં નિરપણોમાં પડવું એને બદલે વચ્ચેથી ખસી જઈ માત્ર ઘટનાઓનો સાક્ષાત્કાર કરાવી વાચકને સ્વાયત્ત, સક્રિય બની ઉંઠું અવગાહન કરવાનું આહાન આપવાની આ લેખકની રીતિ હોય તેમ જણાય છે. [વેદ સરસ્વતીની ચિક્કી વાંચતા

હષીકેશના ચિત્તમાં કેવા તુમુલ ખળખળાટ થયા હશે તેનું ચિત્તરામણા કરવાને બદલે વેખક લાગે છે : 'હષીકેશની આંખો વિસ્કારિત થઈ ગઈ.. થોડી કષ્ણો એના ચહેરા પર મેઘધનુષી રંગોની રમણ્ણ ચાલી. પછી એ ચહેરો તેલ ખૂટતાં બળેલી વાસવાળી ધૂમ્રસેર કાઢતા કોડિયા જેવો બની ગયો.' / 'બંધુ મોહું થઈ ગયું વેદ !' આવું કઈક એ બોલ્યો — અથવા ન પણ બોલ્યો હોય...' (પૃ. ૫૮)] આથી કવચિત્ત મમો ચૂકી જવાય એવું બને છે. [જોકે હષીકેશ ('ઝષીકેશ' નહિ. જુઓ 'વિકિમા' પૃ. ૩૦૮) કોંગ્રેસ હાઉસમાં જતો કેમ થયો એ, છાપામાં હપતાવાર વાંચતા એક સામાન્ય વાચકને કળાઈ ગયેલું : '... વેદ સરસ્વતીને લીધે.' એણે પત્રમાં લાગેલું !] સંભવિત છે કે 'ઉદ્ધત યજ્ઞમાન', 'હષીકેશ-૨' એ બે પ્રકરણો અને 'કાળબળ'ના અમુક અંશોમાં પુનર્નિમજજન કરવામાં આવે તો અગોચર ગોચર થઈ 'પલટો' ઉત્પાવણે આવી ગયાની, 'ઉત્પાવણા, પ્રતીતિના પ્રશ્નો' થવાની ભીતિ નિર્મૂળ થાય.

તત્વદર્શન, દાશનિક-વૈચારિક સામગ્રી, ચર્ચાઓ ઇત્યાદિને નિરપેક્ષ રીતે જોવા કરતાં પાત્રવ્યક્તિત્વ-પાત્રક્ષા-સાપેક્ષ જોવી જોઈએ. આની સાથે સંજોગો, સમય, વાતાવરણ, દેશ-કાળ, કથા-માહોલનો સંદર્ભ પણ ધ્યાનમાં રહેવો જોઈએ. વેદ સરસ્વતી જેવી મેઘાવિની સાથે, વાત ચાલતી હોય, એ પાછી સંન્યાસીની હોય, યોગની સાધના કરી રહી હોય, બોલનાર યોગના સૈદ્ધાન્તિક પાત્રાના તજ્જી હોય, એ તજ્જી એનેટોમી પણ ભણેલો (ઉંકર) હોય, જે સમયમાં આ ચર્ચા ચાલતી હોય તે સમય,

## પ્રત્યક્ષીય

ગુજરાત સાહિત્યસભા વર્ષોથી, એની 'કાવ્યવાહી'રૂપે, વર્ષભર પ્રગટ થયેલાં પુસ્તકોની સમીક્ષા ગ્રંથસ્વરૂપે પ્રકાશિત કરતી રહેલી. એ પ્રવૃત્તિ પદ્ધીથી તેને વર્ષના 'ગ્રંથસ્થ વાજ્ય'રૂપે ચાલતી રહી છે. અલબાન, પાછળાં થોટાંક વર્ષોથી અનું સાતત્ય ને એના પ્રકાશનની નિયમિતતા રહ્યા નથી - ૧૯૮૪ની સમીક્ષાનું પુસ્તક ૧૯૮૧માં પ્રગટ થયેલું ને '૮૫થી '૮૧ વર્ષોનાં વર્ષોની સમીક્ષાઓ તો થઈ જ શકી નથી. છતાં જેટલું થઈ શક્યું છે એટલું કામ મહત્વનું તો છે જ. આ પ્રકારની કામગીરીની બેકરી ઉપયોગિતા છે : એક તો, એમાં વર્ષભરના સાહિત્યવેખનનો હિસ્સાબ મળે છે ને એ રીતે સાહિત્યની ગતિવિધિ અને વિકાસનું ચિત્ર સંપરે છે અને બીજું એ કે ભવિષ્યના અભ્યાસીઓ તથા સંશોધકોને માટે એ એક હાથવગી સંદર્ભસામગ્રી બની રહે છે.

હમણાં એનું '૧૯૮૧ની સાલનું ગ્રંથસ્થ વાજ્ય' (પ્રકાશન : ફેલ્લુઆરી ૧૯૮૮) જોવા મળ્યું. એમાંથી પસાર થતાં આપણી વાર્ષિક સમીક્ષાપ્રવૃત્તિ અંગે તેમજ એ માટેનાં પ્રકાશનોની પ્રાસિ બાબતે કેટલાક પ્રશ્નો જાગ્યા.

ઘણાં વર્ષોથી આની કાયમી જવાબદીરી સંબાળતા સંપાદક મધુસૂદન પારેખે પ્રાસ્ટારિક નોંધમાં લખ્યું છે કે, સાહિત્યસભાને પ્રકાશકો-લેખકો તરફથી (તે વર્ષનાં) મળ્યાં હોય એટલાં જ પુસ્તકોની સમીક્ષા કરવાની સંસ્થાની નીતિ છે. એટલે એમની જાણમાં અન્ય પ્રકાશનો પણ હોવા છતાં એની સમીક્ષા આ 'ગ્રંથસ્થ વાજ્ય'માં સમાવી શકાઈ નથી. આમ થવાથી વર્ષભરની લેખન-પ્રકાશન-પ્રવૃત્તિનું સ્પષ્ટ ચિત્ર ન ઊપરે એ પણ એમજે સ્વીકાર્યું છે. બેન્ચેક પ્રકાશકી નિયમિત રીતે અને બીજા થોડાક અનિયમિત અને યાદૃચિંહ રીતે પુસ્તકો મોકલતા રહ્યા છે. પત્રો લખ્યા છતાં પ્રકાશકોએ પુસ્તકો ન મોકલ્યાનું પણ સંપાદકે નોંધ્યું છે.

પરિણામ એ આવ્યું છે કે, એમજે મળ્યાં એ ૪૦૦ જેટલાં પુસ્તકો વિશે સ્વરૂપવિભાગવાર, મહેનતપૂર્વક પરિચય ને સમીક્ષા કર્યા છે; કેટલાંક પુસ્તકોની તુલનાસાપેક્ષ વિચારણા પણ કરી છે ને કેટલાંક એમને લાગ્યાં તે સ્પષ્ટ નિરીક્ષણો-તારણો પણ કર્યા છે, તેમ છતાં વર્ષના સાહિત્યનું ચિત્ર અપયોગિ ને ધૂંધળું રહી જ ગયું છે. જે વાર્ષિક સમીક્ષામાં, તે વર્ષે પ્રગટ થયેલા સાહચર્યના ત્રણ કાબ્યસંગ્રહો - 'અરવ' (કમલ વોરા), 'અવતરણ' (ભરત નાયક) અને 'જનપદ' (કાન્ઝ પટેલ), હસમુખ બારાડીનું નાટક 'આખું આયજું ફરીથી', પ્રમોદકુમાર પટેલનો વિવેચનસંગ્રહ 'પ્રતીપ્તિ'; દ્વાપત પઢિયારનો મહાનિબંધ 'ગાંધીયુગનું ગદ્ય', મધુસૂદન બક્ષીની 'દેરિદ્ય' પરની પુસ્તિકા... વગેરે જેવાં મહત્વનાં ને ચર્ચાક્ષમ પુસ્તકો જ, ભવે ન મળવાને કારણે, બાકાત હોય એ સમીક્ષા સ્વાભાવિક રીતે જ અધૂરી રહેવાની.

તો આનો ઉપાય શે ? સાહિત્યસભાએ, મળ્યાં એની જ સમીક્ષા કરવાની નીતિ છોડી દઈને એ સિવાયનાં પુસ્તકો પણ અન્ય ગ્રંથાલયોમાંથી કે વ્યક્તિઓ પાસેથી મેળવીને સમીક્ષા કરાવવી ? એ બહુ વ્યવહારું પણ ન નીવડે ને આમ કર્યા છતાંય કેટલાંક મહત્વનાં પુસ્તકો છટકી જવાની પૂરી શક્યતા. વળી, વાર્ષિક સમીક્ષા કરાવતી આવી એક સન્ત્રીષ સંસ્થાને પુસ્તકો શા માટે ન મળવાં જોઈએ ? એક રીતે જોતાં એની નીતિમાં વાજબીપણું પણ છે.

આમાં બીજી પણ એક બાબત જોઈ શકાય એમ છે. સાહિત્ય-પ્રવૃત્તિઓની રીતે અત્યારે સક્રિય સંસ્થાઓમાં 'ગુજરાત સાહિત્યસભા' પહેલાં હશે એટલી પ્રકાશવર્તુળમાં નથી. એ પણ એને ઓછો સહયોગ મળવાનું એક કારણ જણી શકાય. એટલે, આ પ્રકારની પ્રવૃત્તિ માટે આપણી નજર ગુજરાતી સાહિત્ય પરિષદ તરફ વળે. એ આપણી સૌથી મોટી ને પ્રતિષ્ઠિત સંસ્થા છે - સૌથી વધુ સક્રિય છે ને (ઓથી જ) પુસ્તકો પણ એને ઘણા મોટા પ્રમાણમાં બેટરૂપે મળે છે. પરબરનો પ્રમાણમાં બહોળો ફેલાવો પણ લેખકો-પ્રકાશકોને પરિષદ માટે પુસ્તકો